

# The Gujarat Secondary Education Board, Gandhinagar

## The Gujarat Secondary Education Regulations, 1974

(As amended up to 30 June - 2001)

All correspondence pertaining to this Regulations should be addressed to :

The Secretary,  
Gujarat Secondary Education Board,  
Sector 10-B, Gandhinagar-382 010



## ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪  
(સન ૨૦૦૧ના જૂન મહિનાની છેલ્લી તારીખ સુધી સુધાર્યા મુજબ)

આ વિનિયમોને લગતો તમામ પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો  
સચિવ,

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,  
સેક્ટર ૧૦-બી,  
ગાંધીનગર - ૩૮૨ ૦૧૦  
વર્ષ : ૨૦૦૧

પ્રકાશક :

ડૉ. જી. કે. પટેલ

સચિવ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

સેક્ટર ૧૦-બી, ગાંધીનગર-૩૮૨ ૦૧૦

પ્રથમ આવૃત્તિ ૧૯૭૪

બીજી આવૃત્તિ ૧૯૮૨

ત્રીજી આવૃત્તિ ૧૯૮૮

ચોથી આવૃત્તિ ૨૦૦૧

પૃષ્ઠ સંખ્યા : ૮ + ૮૮ = ૯૬

કિંમત : રૂ. ૫૦/-

તારીખ : ૧૫મી ઓગસ્ટ, ૨૦૦૧

## **પ્રસ્તાવના...**

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા, આ અગાઉ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની સંકલિત પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી હતી. આ પ્રકાશન પછી વખતોવખત નિયમોમાં જરૂરી સુધારા-વધારા થવા પામ્યા છે. આ સુધારા-વધારાને અનુલક્ષી જૂન-૨૦૦૧ સુધીના બધા જ સુધારા-વધારા આ પુસ્તિકામાં આમેજ કરી લેવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ સંચાલનમાં આ પુસ્તિકાને કારણે એકસૂત્રતા સાધી શકાશે, જેથી કાનૂની અને વહીવટી પ્રશ્નો નિવારી શકાશે.

નવી શાળાઓને આ પુસ્તિકાની અપાય્તાને લીધે જે વહીવટી મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલી આ પ્રકાશન દ્વારા દૂર થવા પામશે. આ પુસ્તિકા સરળતાથી મ્રાપ્ત થાય તે દસ્તિએ બોર્ડમાં તેમજ તેનું જહેર વેચાણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૧૫-૮-૨૦૦૧

**ધી. વી. ત્રિવેદી**

**અધ્યક્ષ**

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ  
ગાંધીનગર.

**નોંધ :** આ પુસ્તકમાં થયેલ સુપારા-વધારા શિક્ષણ વિભાગની મંજૂરીની તારીખથી અમલમાં આવેલ ગાંધીજીના રહેશે.

## અનુકૂળાંકિકા

વિનિયમ નંબર	વિનિયમ			પાના નં.
<b>પ્રકરણ ૧</b>				
<b>પ્રારંભિક</b>				
૧.	ટૂંકી સંતા અને આરંભ	...	...	...
૨.	વાખ્યા...	...	...	...
<b>પ્રકરણ ૨</b>				
<b>અધ્યક્ષ અને સેકેટરીની સત્તા અને ફરજો</b>				
૩.	અધ્યક્ષની સત્તા અને ફરજો	...	...	...
૪.	સેકેટરીની સત્તા અને ફરજો	...	...	...
<b>પ્રકરણ ૩</b>				
<b>બોર્ડ અને તેની સમિતિઓ</b>				
૫.	બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ	...	...	...
૬.	બોર્ડની સમિતિઓ અને તેમની મુદ્દા	...	...	...
૭.	કારોબારી સમિતિની રચના અને કાર્યો	...	...	...
૮.	પરીક્ષા સમિતિ	...	...	...
૮-ક.	શૈક્ષણિક સમિતિ	...	...	...
૮-ખ.	અભ્યાસ સમિતિ	...	...	...
૮-ગ.	નાણાં સમિતિ	...	...	...
<b>પ્રકરણ ૪</b>				
<b>માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન</b>				
૯.	બોર્ડ માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન કરવા માટેની કાર્યરીતિ	...	...	૧૦
૯-ક.	માધ્યમિક શાળાઓના રજિસ્ટરમાંથી શાળાનું નામ કાઢી નાખવા માટેની તપાસની રીત	...	...	૧૪

અનુક્રમણિકા (ચાલુ)

વિનિયમ નંબર	વિનિયમ				પાના નં.
૧૦.	કલ્પિક વર્જ કે વધારાના વર્ગો શરૂ કરવાની રીત	...	...	...	૧૫
૧૦-ક.	વર્ગોની કુલ સંખ્યામાં ઘટાડો	...	...	...	૧૬
૧૧.	પત્રવ્યવહારનું સાપન	...	...	...	૧૬

પ્રકરણ ૫

વિદ્યાર્થીઓના પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય અને શિસ્ત

૧૨.	વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની શરતો	...	...	...	૧૬
૧૨-ક.	શાળા રજિસ્ટરોમાં જન્મ તારીખ, નામો વગેરેમાં ફેરફરો ...	...	...	૨૦	
૧૨-ખ.	વિદ્યાર્થીઓના પ્રવેશ માટે દાન સ્વીકારવું નહીં	...	...	૨૨	
૧૩.	કપટથી પ્રવેશ મળ્યો હોય તો પ્રવેશ બિન-અમલી ગણાશે	...	...	૨૨	
૧૪.	વિદ્યાર્થીઓની કસોટી	...	...	...	૨૨
૧૪-ક.	૧૮ વર્ષથી ઉપરના ખાનગી ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે	...	...	૨૨	
૧૫.	૮મા, ૮મા અને ૧૦મા ધોરણોની વાર્ષિક પરીક્ષાઓના વિભાગો	...	...	૨૨	
૧૬.	વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને શપરીરિક સુખાકારી	...	...	૨૨	
૧૭.	શાળાના સત્ર, રજીઓ અને વેકેશનો	...	...	...	૨૩
૧૮.	વિદ્યાર્થીઓમાં શિસ્ત	...	...	...	૨૪

પ્રકરણ ૬

રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી અને નોકરીની શરતો

૧૯.	હેડમાસ્ટરો, શિક્ષકો અને બિન-અધ્યાપકીય સ્ટાફની ભરતી	...	...	૨૪
૨૦.	રજિસ્ટર થયેલી શાળામાં હેડમાસ્ટરો, શિક્ષકો અને બિન-અધ્યાપકીય સ્ટાફના સભ્યોની લાયકાતો	...	...	૨૫

અનુકૂળસિક્ષા (ચાલુ)

વિનિયમ નંબર	વિનિયમ				પાના નં.
૨૧.	તથીબો તપાસ	...	...	...	૨૮
૨૨.	પ્રોબેશન	...	...	...	૨૮
૨૩.	સર્વિસ ભુક્ત	...	...	...	૨૮
૨૪.	પગારથોરજા	...	...	...	૨૯
૨૫.	વેકેશન પગાર	...	...	...	૨૯
૨૬.	ચેન્શાન અને પ્રોવિન્ટ ફેસ	...	...	...	૨૯
૨૭.	રાઇલર થયેલી ખાનગી શાળાના હેડમાસ્ટરો, શિક્ષકો અને બિન- અધ્યાપકીય સ્ટાફના સત્યોનું વર્તન તથા શિસ્તા	...	...	...	૩૦
૨૭-અ.	બિન-સરકારી માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન- શૈક્ષણિક કર્મચારીઓની આચારસંહિતા	...	...	...	૩૨
૨૮.	કામના કલાકો અને અધ્યાપકીય સ્ટાફની હાજરી બાબત	...	...	...	૩૩
૨૯.	ગેરહાજરી	...	...	...	૩૩
૩૦.	રજી	...	...	...	૩૩
૩૧.	રજીના પગારની ગણતરી	...	...	...	૩૪
૩૨.	પૂર્ણકાલીન અધ્યાપકીય સ્ટાફ ખાનગી ટ્રુશન કરવા બાબત	...	...	...	૩૭
૩૩.	નોકરીની સમાપ્તિ	...	...	...	૩૮
૩૪.	બીજી જગ્યા માટેની અરજી	...	...	...	૪૦
૩૫.	ધૂટા થવા માટેનું પ્રમાણપત્ર	...	...	...	૪૦
૩૬.	નિવૃત્તિવય	...	...	...	૪૦
૩૭.	રેદ કર્યા	...	...	...	૪૦

પ્રકરણ ૭

રેકર્ડ અને રજિસ્ટરો

૩૮.	રેકર્ડ અને રજિસ્ટરો	...	...	...	૪૧
-----	---------------------	-----	-----	-----	----

## અનુક્રમણિકા (સંપૂર્ણ)

વિનિયમ	વિનિયમ	પાના નં.
નંબર		
૪૮.	શાળાઓ અને હોસ્પિટો નિરીક્ષણ માટે ખુલ્લાં રહેશે ...	૪૨
૪૯.	૨૬ કર્યો. ...	૪૨
૫૦.	૨૬ કર્યો. ...	૪૨
૫૧.	૨૬ કર્યો. ...	૪૨
૫૨.	સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહ સામે આ વિનિયમો પ્રવર્તશે ...	૪૨
૫૩.	લભુમતિએ સ્થાપેલી અને તેની દ્વારા વહીવટ ચાલતો હોય તેવી કોઈ શૈક્ષણિક સંસ્થાને વિનિયમો લાગુ પડશે નહિ ...	૪૨
<b>પરિશિષ્ટ</b>		
૧.	ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિ નિયમો ...	૪૨
૨.	બિન-સરકારી માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓની આચારસંહિતા ...	૪૩
<b>નમૂનો</b>		
નમૂનો-૧.	ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ નવી માધ્યમિક શાળાના રજિસ્ટ્રેશન માટેની અરજણનો નમૂનો ...	૭૧
નમૂનો-૨.	માધ્યમિક શાળા રજિસ્ટર ...	૭૬
નમૂનો-૩.	રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર ...	૭૭
નમૂનો-૪.	જીહેર આરોગ્ય તબીબી તપાસનો નમૂનો ...	૭૮
નમૂનો-૫.	સર્વિસ બુક ...	૮૨
નમૂનો-૬.	રજાના છિસાબનો નમૂનો ...	૮૪
નમૂનો-૭.	ધૂટા થયાના પ્રમાણપત્રનો નમૂનો ...	૮૬
નમૂનો-૮.	રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ખાનગી અહેવાલનો નમૂનો ...	૮૭
નમૂનો-૯.	શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ...	૮૮

## ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪

(વખતોવખત સુધ્યાર્પા પ્રમાણે અને જૂન-૨૦૦૧ના રોજ અમલમાં હોય તે પ્રમાણે)

### પ્રકરણ-૧

#### પ્રારંભિક

૧. (૧) આ વિનિયમો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪’ કહેવાશે.  
 (૨) તે તારીખ ૧૬મી માર્ચ, ૧૯૭૪ના રોજ અને તે તારીખથી અમલમાં આવશે.
૨. આ વિનિયમોમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય, તો —
  - (૧) ‘અધિનિયમ’ એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨.
  - (૨) “પુરવણી” એટલે આ વિનિયમોની પુરવણી.
  - (૩) “પરીક્ષા સંચાલક” એટલે બોર્ડના વતી પરીક્ષાનું સંચાલન કરવા નિમાયેલી વ્યક્તિ.
  - (૪) “વિભાગ” એટલે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ.
  - (૫) “નિયામક” એટલે શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય.
  - (૬) “નમૂનો” એટલે આ વિનિયમોને જોડેલો નમૂનો.
  - (૭) “અધિકારી” એટલે રાજ્ય સરકારે કલમ ૨૧ ડેઢા બોર્ડના અધિકારી તરીકે નીમેદા જિલ્લા શિક્ષણ અધિકારી અને એવા અધિકારીની ગેરહાજરીમાં, બોર્ડના અધિકારી તરીકે તેવી રીતે નિમાયેલી કોઈ વ્યક્તિ.
  - (૮) “મોડેરેટર” એટલે બીજા પરીક્ષકોએ મૂલ્યાંકન કરેલા પ્રશ્નપત્રોનું નિયમન કરવા નીમવામાં આવ્યા હોય તેવા પરીક્ષક.
  - (૯) “નવું ખર્ચ” એટલે નવી નીતિ અપનાવવામાં, નવી સુવિધાની જોગવાઈ કરવામાં અથવા ચાલુ સુવિધાના પ્રકારમાં સંગીત ફેરફાર કરવામાં થયેલું ખર્ચ.
  - (૧૦) “સૈકેટરી” એટલે બોર્ડના સૈકેટરી.
  - (૧૧) “કલમ” એટલે અધિનિયમની કલમ.
  - (૧૨) માધ્યમિક શાળાના સંબંધમાં “સુપરવાઇઝર” એટલે તે શાળામાં શિક્ષકોનાં કામ ઉપર દેખરેખ રાખવા નિમાયેલ તે જ શાળાના પૂર્ણકાલીન શિક્ષક.
  - (૧૩) બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષાના સંબંધમાં “સુપરવાઇઝર” એટલે પરીક્ષામાં બેસનાર ઉમેદવારો ઉપર દેખરેખ રાખવા બોર્ડ નીમેલી વ્યક્તિ.
  - (૧૪) “અધ્યક્ષ” એટલે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ.
  - (૧૫) “શાળાવર્ષ” એટલે, દર વર્ષે જૂન અહિનાથી શરૂ થતું શૈક્ષણિક વર્ષ.
  - (૧૬) “બોર્ડ” એટલે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ.
  - (૧૭) “પરીક્ષા” એટલે, માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા.
  - (૧૮) “રક્ઝિસ્ટર થયેલ” એટલે, અધિનિયમની કલમ ૩૧ ડેઢા ૧૦મા ધોરણ સુધી રક્ઝિસ્ટર થયેલ.

દૂંઠી સંશો અને  
આરંભ  
વાય્યા

## પ્રકરણ-૨

### અધ્યક્ષ અને સેકેટરીની સત્તા અને ફરજો

અધ્યક્ષની સત્તા અને ફરજો ૩. અધ્યનિયમમાં ઠરાવેલી અધ્યક્ષની સત્તા અને ફરજો ઉપરાંત, અધ્યક્ષની સત્તા અને ફરજો નીચે પ્રમાણે રહેશે —

(૧) અધ્યક્ષની ફરજો નીચે પ્રમાણે રહેશે —

(૧) કારોબારી સમિતિના નિર્ણયોનો અમલ કરશે.

(૨) પોતે જેનો અધ્યક્ષ હોય તે સમિતિની તમામ બેઠકો બોલાવશે.

(૩) પોતે જેનો અધ્યક્ષ હોય, તે સમિતિની તમામ બેઠકોનું અધ્યક્ષસ્થાન દેશે.

(૨) અધ્યક્ષને નીચેની સત્તા રહેશે —

(૧) અંદાજપત્રની જોગવાઈઓને આધીન રહીને, બોર્ડની ઓફિસ માટે જરૂરી સ્ટોર, સ્ટેશનરી, ફર્નિચર અથવા બીજું સાધનસામગ્રીની ખરીદી કરશે અથવા ખરી રાખશે, જો ખરીદ કિંમત અથવા ભાડા પેટેનું ખર્ચ ૧૦૦૦/-થી વધુ હોય પણ રૂ. ૨૦,૦૦૦થી\* વધુ ન હોય, તો.

(૨) સ્ટોર, વેચાણ પ્રકાશનો અને લક્ડી સામાનની બિન-ઉપયોગી ચીજોના સંબંધમાં લેખી થતી વસૂલ ન થઈ શકે તેવી રકમો માંડી વાળશે, પરંતુ આવા દરેક દાખલામાં લેખી થયેલ રકમ અથવા લક્ડી સામાનની કિંમત રૂ. ૨,૫૦૦<sup>૧</sup> કરતાં વધુ હોવી જોઈશે નહિ.

(૩) અંદાજપત્રથી મંજૂર કરેલી રકમથી વધવા પામે નહિ તે દીતે બોર્ડની નાનાં સમિતિ હોય તો તેની સાથે વિચાર-વિનિમય કરીને અંદાજપત્રના વિગતવાળા એક સદરમાંથી બીજી સદરમાં રકમનો પુનવિનિયોગ કરશે.

(૪) બોર્ડની તાકીદની સત્તા બોલાવવાનું તેને જરૂરી લાગે તો, તો ઈ પણ સમયે તેવી સત્તા બોલાવશે.

(૫) ઉમેદવારોને પરીક્ષામાં બેસવા અંગેના જોઈન્ટ<sup>૨</sup> સેકેટરીએ સાદર કરેલા શંકસ્પદ ડેસોનો નિર્ણય કરશે.

(૬) પરીક્ષા સમિતિ સાથે વિચાર-વિનિમય કરીને, પરીક્ષાના જુદાં જુદાં તેનો પર મુખ્ય સંચાલક નક્કી કરશે.\*

(૭) બોર્ડના અને તેની સમિતિઓના સભ્યો અને બોર્ડના અધિકારીઓનાં મુસાફરી બધાંનાં બિલોની ચૂકવણી મંજૂર કરશે.

(૮) તાકીદના પ્રસંગે જરૂરી જ્ઞાય તો પોતાના અભિગ્રામ પ્રમાણે પગણું દેશે અને ત્યાર બાદની બોર્ડની બેઠકમાં રજૂ કરવાનું રહેશે.\*

(૯) સેકેટરી અને બોર્ડના અન્ય અધિકારીઓની ખાસ અધકતતા રજી સહિતની\* રજી મંજૂર કરશે.

(૧૦) બોર્ડના કાર્યકુની સ્ટાફની કોઈ પણ વ્યક્તિને ટપકો આપશે, દાદ કરશે અથવા પથરી ઉત્પાર કરશે અથવા તેને લેખો થતા પગારનો કોઈ પણ ઈજાબો ખાલ મુદ્દત સુધી અટકાવશે અને ગંભીર ગેરવર્તલુક

અથવા કાર્યક્રમતાનો અભાવ હોય તે કેસોમાં, કારકુની સ્ટાફના કોઈ પણ સત્ય અથવા ચોથા વર્ગના કર્મચારી સામે ધોર્ય સત્તાવિકારી લાગા તપાસ કરાવશે અથવા તપાસ કરવાનો હુકમ કરશે અને તેને નોકરીમાંથી દૂર કરશે અથવા બરતરફ કરશે, પરંતુ, સ્ટાફ સામેની સિસ્ટમંગની કોઈ પણ બાબતમાં અથવે કરેલા હુકમોમાં રેકર્ડ મંગાવીને તપાસવાની અને જરૂરી હોય તો, અથવે કરેલા હુકમોમાં ફેરફાર કરવાની, સુધ્યરવાની અથવા તે ફેરવવાની સત્તા રજ્ય સરકારને રહેશે.

(૧૧) બોર્ડના ગ્રીજા વર્ગના કર્મચારીઓ નીમશે.

(૧૨) તેના પોતાના મુસાફરી ભથ્યાનાં બિલ અને અધિકારીઓના મુસાફરી ભથ્યાનાં બિલ મંજૂર કરશે.

(૩) અધ્યક્ષને, રજ્ય સરકારના વિભાગના ઉપરી વાપરતા હોય તેવી તમામ સત્તાઓ રહેશે.

૪. (૧) સેકેટરી —

(ક) અધ્યક્ષની સૂચના પ્રમાણે બોર્ડની અને કોઈ સમિતિની બેઠકો બોલાવવા નોટિસો કાઢશે અને બોર્ડની અને સમિતિઓની આવી તમામ બેઠકોની પથાર્થ અને સ્પષ્ટ કાર્યનોંથ અને રિપોર્ટ રાખશે.

(ખ) તમામ સમિતિઓના સેકેટરી તરીકે કામ કરશે અને આવી સમિતિઓની બેઠકોમાં થતી ચર્ચામાં છાજર રહી ભાગ લેશે અને આવી બેઠકોમાં જે માહિતી આપવાનું અને જે પ્રશ્નોના જવાબો રજૂ કરવાનું અથવા મૂકવાનું તેને જરૂરાવવામાં આવે તે માહિતી અથવા તે પ્રશ્નોના જવાબ આપશે.

(ગ) સામાન્ય સિક્કો, મકાનો રેકર્ડ, પુસ્તકાલયના અને બોર્ડમાં નિલિત થયેલી અથવા બોર્ડ અથવા તેના નિયંત્રણ તળે ધરાવેલી એવી બીજી, જંગમ અને સ્થાવર મિલકતના કસ્ટોડિયન રહેશે અને તેની ધોર્ય યાદી જાળવવા વ્યવસ્થા કરશે અને તેની ધોર્ય સંભાળ અને જતન રાખશે.

(ઘ) અધ્યક્ષના અધિકારથી બોર્ડનો તમામ પત્રવ્યવહાર કરશે.

(ઝ) જરૂર જરૂરાય ત્યારે અથવે આપેલા આદેશોને આધીન રહીને, બોર્ડ અને તેની સમિતિઓની કાર્યનોંથ તથા રિપોર્ટ અંગે પગલાં લેશે.

(ઝી) બોર્ડના કોષાધ્ય તરીકે કામ કરશે અને બોર્ડને આપવાની તમામ ફી અને અન્ય લેસી રકમો સ્વીકારશે અને બેંકમાં તે બધાં નાશાં વિના વિલબે બોર્ડના ધોર્ય ખાતામાં જમા કરાવશે અને સેકેટરી તરીકેની ડેસિયતથી પોતાને મળેલી તમામ રકમોનો અને જે ખર્ચ માટે બોર્ડના નાશાં મંજૂર કરવામાં અથવા જાળવવામાં ઓંબા હોય તે ખર્ચનો ધોર્ય હિસાબ રાખશે.

(ઝી) અધિનિયમ અને વિનિયમોની જોગવાઈઓ અનુસાર બોર્ડની આવક અને ખર્ચના વાર્ષિક સુધારેલા અથવા પૂરક અંદાજપત્રો અને બોર્ડના આવકજીવકના વાર્ષિક હિસાબો તૈયાર કરી રજૂ કરવાની વ્યવસ્થા કરશે.

(ઝ) બોર્ડના પુસ્તકાલય ઊપર દેખરેખ રાખશે અને વિભાગ અથવા લેખકો અથવા પ્રકાશકો પણ એથી મળેલાં પુસ્તકો, અભ્યાસ સમિતિઓ હોય તો તેના કન્વીનરોને મોકલ્યાવશે અને કન્વીનરોની વિનંતિથી, તે પુસ્તકો અભ્યાસ સમિતિ હોય તો તેના સભ્યોમાં ફેરવશે.

(૨) બોર્ડના અધિકારથી લેવાતી પરીક્ષા માટે ઠરાવેલા અથવા મંજૂર કરેલા અભ્યાસકચો અને પઠન-પુસ્તકોને લગતાં સૂચિપત્રો, પરિપત્રો, નોટિસો વગેરે આપશે.

સેકેટરીની સત્તા  
અને રજ્ય.

(૬) સ્ટોર, વેચાઉ પ્રકાશનો, ગુજરાતી અને લકડી સામાનની બિન-ઉપયોગી ચીજે દગેરેના સંબંધમાં બોર્ડની લેખી નીકળતી વસૂલ ન થઈ શકે તેવી માંડી વાળવાની રકમો અંગેની દરેક બાબતની બોર્ડના અધ્યક્ષને જાણ કરશે અને આ અર્થે બહાર પાડવામાં આવે તે આદેશોનું પાલન કરશે.

(૭) કારોબારી સમિતિના આદેશો અનુસાર બોર્ડ તરફથી લેવાતી પરીક્ષાઓનાં સંચાલન માટે જરૂરી તમામ વ્યવસ્થા કરશે.

(૮) જુદા જુદા વિષયોના ગુજરાતી કોષ્ટકોની વ્યવસ્થા કરશે અને પરિણામપત્રકો તૈયાર કરશે.

(૯) બોર્ડ ઠારવેલા નમૂના પ્રમાણેના બોર્ડની પરીક્ષા પાસ કરી હોવાના પ્રમાણપત્રો સંખળ ઉમેદવારોને આપશે.

(૧૦) બોર્ડ રજિસ્ટર કરેલી શાળાઓની પાછી વિભાગને દર વર્ષ આપશે.

(૧૧) રજિસ્ટર થયેલી શાળાઓ પાસેથી રિપોર્ટો, પત્રકો અને બીજી માહિતી મંગાવશે.

(૧૨) પરીક્ષા માટે ઠારવેલાં પાઠ્ય-પુસ્તકોના અને ભલામણ કરેલાં પુસ્તકોના સંબંધમાં નોટિસો કાઢી આપશે.

(૧૩) બોર્ડના નિર્ઝયોનો અમલ કરવા માટે જરૂરી બીજી ફરજી બજાવશે.

(૧૪) બોર્ડની મિલકતમાં રૂ. ૪૦૦/- કરતાં વધ્યારે ક્રિમતની ખોટ જાય તે દરેક કેસમાં તપાસનીશ, લોકલ ફડ હિસ્સાબ ગુજરાતને જાણ કરશે.

(૧૫) સેકેટરીને નીચેના સત્તા રહેશે -

(ક) પોતાની ઓફિસમાં કામ કરતાં બોર્ડના કર્મચારીઓનાં પગાર બિલો ઉપર સહી કરશે અને બોર્ડના અને તેની સમિતિઓના અને બોર્ડની ઓફિસમાં કામ કરતા બોર્ડના અધિકારીઓનાં હોય તે સિવાપના તમામ મુસાફરી બધ્યાનાં બિલો ચુકવણી માટે મંજૂર કરશે.

(ખ) તે સમયે અમલમાં હોય તે નિયમો અનુસાર બોર્ડના ચોથા વર્ગના નોકરોને ખાસ અશક્તતા રજી સિવાપની રજી મંજૂર કરશે.

(ગ) કલમ ૨૮ હેઠળ મંજૂર કરેલી અંદાજપત્રની જોગવાઈઓને આધીન રહીને, બોર્ડની ઓફિસ માટે જરૂરી સ્ટોર, કોર્મ, સ્ટેશનરી, ફર્નિચર અને બીજી સાધારણતામણીની જરીદી અથવા ભાડે રાખવાનું ખર્ચ, જો આવી પરીક્ષા અથવા તે ભાડે રાખવાનું ખર્ચ રૂ. ૧૦૦૦/- થી વધુ ન થાય તો આવું ખર્ચ મંજૂર કરશે.

(ઘ) વિનંતી થયેથી, સરકારી અને અંશતા: સરકારી મંડળોને અને યુનિવર્સિટીઓ અથવા શૈક્ષણિક અથવા જીએર સંસ્થાઓને અને બોર્ડની ઓફિસના મુલાકાતીઓને, સત્તાવાર ઉપયોગ માટે બોર્ડના વેચાઉ પ્રકાશનો વિના મૂલ્યે આપશે.

(ઝ) બોર્ડની ઓફિસમાં પોતાના તાબાના અધિકારીઓ અને સ્ટાફના કામ ઉપર દેખરેખ, નિયંત્રણ રાખશે અને તેના કામનું સંકલન કરશે.

(ઝી) અધ્યક્ષના સામાન્ય અથવા ખાસ હુકમો હેઠળ બોર્ડની ઓફિસમાં સંપુર્ણ સેકેટરીએ અને મદદનીશ સેકેટરીઓએ બજ્જીવાળાની ફરજી અને વાપરવાની સત્તા મુકરર કરી સોંપશે.

(ઝીઝ) બોર્ડ તરફથી લેવાતી પરીક્ષામાં ઉમેદવારોને પ્રવેશ આપવાના કેસોનો નિર્ઝય કરશે.

(ઝીઝી) યોગ્ય કાર્યરીતિ અનુસર્યા પછી, બોર્ડના ચોથા વર્ગના કોઈ નોકરને ઠપકો આપશે અથવા નીચે ઉતારી પાડશે.

(2) પરીક્ષાકાર્યના હેતુ માટે સુપરવાઈઝરો અને સંચાલકોની યાદી મંજૂર કરશે અને અન્ય જરૂરી સ્ટાફ નીમશે.

(3) બોર્ડના ચોથા વર્ગના કર્મચારીઓને નીમશે.

### પ્રકરણ-૩

#### બોર્ડ અને તેની સમિતિઓ

૫. (1) કલમ ઉની પેટા-કલમ (2) માં ઉલ્લેખેલ વર્ગ બના ખંડો (1) અને (10)માં આવતા સત્યો સિવાયની, તે વર્ગની ચુંટવાના સત્યોની ચુંટકી, પરિશિષ્ટમાં નિહિષ કરેલી કાર્યરીતિ અનુસાર કરવામાં આવશે.

(2) બોર્ડના અધ્યક્ષ અથવા તેણે નિયુક્ત કરેલી વ્યક્તિ ચુંટકી અધિકારી રહેશે અને ચુંટકીના સંચાલન માટે જવાબદાર રહેશે.

(3) બોર્ડના સત્યોની જગ્યા પ્રસંગોપાત ખાલી પડે તે પ્રસંગે, ચુંટકી અધિકારી બનતી ત્વરાએ પરિશિષ્ટમાં જ્ઞાનેવી જ્ઞેગવાઈઓ અનુસાર નવેસરથી ચુંટકી કરવા તાત્કાલિક પગલાં લેશે.

૬. (1) સમિતિના સત્યોની નિમણૂક બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. બોર્ડની સમિતિઓ

(2) સમિતિમાં પ્રસંગોપાત ખાલી પડેલી જગ્યા, તે જગ્યા ખાલી પડ્યા પછી, તરત જ અને તેમની મુદ્દત બોર્ડ પોતાની બેઠકમાં ભરશે.

(3) બોર્ડની અભ્યાસ સમિતિ, હોય તો તે સિવાયની તમામ સમિતિઓના સત્યોના હોદાની મુદ્દત બે વર્ષની રહેશે અને અભ્યાસ સમિતિના સત્યોના હોદાની મુદ્દત કે તારીખે સત્યોની નિમણૂક કરવામાં આવે તે તારીખથી ત્રણ વર્ષની રહેશે.

(4) સેકેટરી બોર્ડ નીમેલી તમામ સમિતિઓના સેકેટરી બનશે અને આવી તમામ બેઠકોમાં હાજર રહી તેમની ચર્ચામાં ભાગ લેશે અને આવી બેઠકોમાં પૂછવામાં આવે તે પ્રશ્નોનો જવાબ અને માગવામાં આવે તે માહિતી આપશે પણ તેને મત આપવાનો હક રહેશે નહિ.

(5) કોઈ વ્યક્તિ ચારથી વધુ અભ્યાસ સમિતિઓનો સત્ય થઈ શકશે નહિ.

(6) બોર્ડ નીમેલી કોઈ સમિતિની બેઠકો બોર્ડના મુખ્ય મથકોએ ભરવામાં આવશે. તેમ છતાં, ખાસ ડિસ્સાઓમાં, આવી બેઠકો, અધ્યક્ષની લેખિત પૂર્વ પરવાનગીથી, રાજ્યમાં કોઈ પણ સ્થળે બરી શકાશે.

૭. (1) કારોબારી સમિતિ બોર્ડ ચુંટેલા નીચેના દસ સત્યોની બનશે.

(1) કલમ ઉ(2)માં ઉલ્લેખેલા, વર્ગ-ક હોદાની રૂમે સત્યોમાંથી બોર્ડ નીમવાના બે સત્યો

કારોબારી સમિતિની

રચના અને કાર્યો

સત્યો

(2) કલમ ઉ(2)માં ઉલ્લેખેલા વર્ગ-ખ ચુંટયેલા સત્યોમાંથી બોર્ડ નીમવાના છ સત્યો

(3) કલમ ઉ(2)માં ઉલ્લેખેલા વર્ગ-ગ નિયુક્ત કરેલા સત્યોમાંથી બોર્ડ નીમવાનો એક સત્ય

(4) બોર્ડના તમામ સત્યો, ગમે તે વર્ગના હોય તો પણ તેમનામાંથી બોર્ડ નીમવાનો એક સત્ય

(2) બોર્ડ, અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને કલમ ૧૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ સમિતિના સત્ય તરીકે નિયુક્ત કરી શકશે.

(૩) અધિનિયમ અને આ વિનિયમોની જોગવાઈઓને આધીન રહીને, કારોબારી સમિતિ નીચેનાં કાર્યો બજાવશે -

(૧) બોર્ડના સામાન્ય સિક્કાનું સ્વરૂપ નક્કી કરશે. તેના હવાલા માટે જોગવાઈ કરશે અને તેના ઉપયોગ સંબંધી નિયમન કરશે.

(૨) બોર્ડની સ્થાવર અને જંગમ ભિલકૃત અને નાક્ષાની તબદીલી કરશે અને સ્વીકારશે, તે ધરાવશે, તેના ઉપર નિયંત્રજ્ઞ રાખશે, તેનો વહીવટ કરશે અને તેની તજવીજ કરશે અને તેના વતી કરાર કરશે.

પરંતુ બોર્ડની પૂર્વ મંજૂરી વગર સ્થાવર ભિલકૃતની તબદીલી કરી શકાશે નહિ.

(૩) બોર્ડના નાક્ષાં, ડિસાબો અને રોકાણોની વ્યવસ્થા કરી તેનું નિયમન કરશે.

(૪) કલમ ૨ઊની પેટા-કલમ (૨)માં જાણવેલી જોગવાઈઓ અનુસાર ફડનાં નાક્ષાનું રોકાણ કરશે.

(૫) વસીયતી બકિસ્, દાન, દેખાળી અથવા બીજી કાલા સ્વીકારશે.

(૬) બોર્ડના વાર્ષિક, સુધારેલા અથવા પૂરક અંદાજપત્રો અને તેની આવક અને ખર્ચના વાર્ષિક ડિસાબો અને તે અંગેની નાક્ષાં સમિતિ હોય તો તેની ભલામજ્ઝો ઉપર વિચારક્ષા કરી બોર્ડને રજૂ કરશે.

(૭) વેચાઉ પ્રકાશનો, ગુજરાતી અને લક્ડી સામાનની જિન-ઉપયોગી ચીજોના સંબંધમાં લેખી નીકળતી વસૂલ ન થઈ શકે તેવી રહ્યો, જો દરેક દાખલામાં આવી લેખી નીકળતી રકમ અથવા લક્ડી સામાનની કિંમત રૂ. ૨૫૦/- કરતાં વધુ થાય પણ રૂ. ૧,૦૦૦ કરતાં વધુ ન થાય તો તે માંડી વાલાશે.

(૮) બોર્ડ જે કોઈ બાબત અંગે કારોબારી સમિતિનાં મંતવ્યો મંગાવ્યા હોય અથવા જેના સંબંધમાં કારોબારી સમિતિને એમ લાગે કે તેણે બોર્ડને સલાહ આપવી જોઈએ તે બાબત ઉપર બોર્ડને રિપોર્ટ કરશે.

(૯) બોર્ડના કામ સાથે સંકળાયેલી અને કારોબારી સમિતિને યોગ્ય લાગતી અથવા અથવા તેને લાગી મોકલે તે બાબત અંગે અધ્યક્ષને સામાન્ય રીતે સલાહ આપશે.

(૧૦) બોર્ડની બીજી સમિતિની ભલામજ્ઝો, હોય તો તેના ઉપર વિચારક્ષા કર્યા પછી બોર્ડના વિનિયમો અને ઉપ-નિયમો ઘડવા અથવા સુધારવા અંગે બોર્ડને ભલામજ્ઝો કરશે.

(૧૧) શિખ્યવૃત્તિઓ, ચંદ્રકો, ઈનાબો અને બીજી પારિતોષિકો કાઢશે અને એનાપત્ત કરશે અને તે માટે શરતો ઠરાવશે.

(૧૨) બોર્ડની બીજી કોઈ સમિતિ પાસેથી મળેલી કોઈ દરખાસ્ત, ભલામજ્ઝ અથવા રિપોર્ટ સ્વીકારશે, નામંજૂર કરશે અથવા પાછા મોકલશે.

(૧૩) બોર્ડની બીજી કોઈ સમિતિઓ હોય તો તેની ભલામજ્ઝો વિચારક્ષામાં લીધા પછી પ્રાશ્નિકો, પરીક્ષકો, મોડરેટરો, સુપરવાઈઝરો અને પરીક્ષાનું સંચાલન કરતા બીજી કર્મચારીઓને આપવાનાં મુસાફરી ભથ્ધાં અને મહેનતાકાંના દર મંજૂર કરવા માટે બોર્ડને ભલામજ્ઝ કરશે.

(૧૪) નાના ખર્ચને પહોંચેલી વળવા સેકેટરીને, પોતાને જરૂરી લાગે તેવી કાપમી પેશગીની રકમ મંજૂર કરવાનો અધિકાર આપશે.

(૧૫) બોર્ડ હાવેલાં શૈક્ષિક ધોરણો જગતી શકાય તે ઉહેશથી, અધિનિયમ ડેટા રજિસ્ટર થયેલી કોઈ માધ્યમિક શાળા પાસેથી કંઈ પણ માહિતી મંગાવશે અને રજિસ્ટર થયેલી શાળાએ શૈક્ષિક ધોરણો જગતવા સંબંધમાં રિપોર્ટો અને માહિતી અધિકારીઓ પાસેથી મંગાવશે અને શાળાનું શૈક્ષિક ધોરણ બોર્ડ હાવેલાં ધોરણો કરતાં નીચું જાણાયું હોય તે દાખલામાં શાળાનું રજિસ્ટ્રેશન પાત્ર બેચી લેવાનો નિર્ણય કરશે.<sup>૧</sup>

(૧૬) બોર્ડની પરીક્ષાનું અને ઓફિસનું કામ કરવા માટે મકાનો, જગ્ગાઓ અને બીજા આવશ્યકતાની જોગવાઈ કરવા અધ્યક્ષને સલાહ આપશે.

(૧૭) પરીક્ષાનાં જુદાં જુદાં કેન્દ્રોએ મુખ્ય સંચાલકની નિમન્નોક અંગે અધ્યક્ષને સલાહ આપશે.

(૧૮) પરીક્ષાનાં પરિક્ષામો પ્રસ્તિદ્ધ કરવા માટે વ્યવસ્થા કરશે.

(૧૯) ગ્રાંશિકો, મોડરેટરો અને પરીક્ષકોને વખતોવખત મોકલવાની સૂચનાઓ તૈયાર કરશે.

(૨૦) સરળ અને કાર્યક્રમ વહીવટ માટે જરૂરી હોય તેવા, અધિનિયમ અને વિનિયમો સાથે સુસંગત નિયમો ઘડશે.

(૨૧) નવી શાળાની નોંધશી કરવા અંગેની અધિકારીની ભલામજ અન્વયે નિર્ણય કરશે.<sup>૨</sup>

c. (૧) પરીક્ષા સમિતિમાં નીચેનાનો સમાવેશ થશે -

પરીક્ષા સમિતિ

(૧) અધ્યક્ષ

(૨) ઉપાધ્યક્ષ

(૩) વર્ગ-ક હોદાની રૂખેના સલ્લ્યોમાંથી બોર્ડ નીમેલો એક સત્ય

(૪) પંડ (૩)માં ઉલ્લેખને હોય તે સિવાયના બોર્ડના સલ્લ્યોમાંથી બોર્ડ નીમવાના ચાર સત્યો

(૫) બોર્ડ પોતાના સલ્લ્યોમાંથી નીમવાના બે સત્યો

(૬) અધિનિયમ અને વિનિયમોની જોગવાઈઓને આધીન રહીને, પરીક્ષા સમિતિ નીચેનાં કાર્યો બજાવશે -

(૧) આ વિનિયમો ડેટા હાવેલી આખરી પરીક્ષાની યોજના સુધારવા અંગેની દરખાસ્તો વિચારી તે અંગેનાં પોતાનાં મેન્ટાયો, કારોબારી સમિતિને અને શૈક્ષિક સમિતિ, હોય તો તેને મોકલાશે.

(૨) આખરી પરીક્ષા સાથે સંકળાયેલા કામની જુદી જુદી બાબતો માટે મહેનતાશાં અધવા માનદવેતનના દરની કારોબારી સમિતિને ભલામજ કરશે.

(૩) ગ્રાંશિકો, મોડરેટરો, ભાષાંતરકારો, પરીક્ષકો, મૂલ્યાંકનકારો અને એવી બીજી વ્યક્તિઓની લાયકાતો અને ગેરલાયકાતો અને તેમને આપવાનાં મહેનતાશાંના દર અંગે કારોબારી સમિતિને ભલામજ કરશે.

(૪) ગ્રાંશિકો, મોડરેટરો, ભાષાંતરકારો, પરીક્ષકો, મૂલ્યાંકનકારો અને એવી બીજી વ્યક્તિઓની પાદી રોયાર કરવા અને તેમની નિમન્નોક કરવાના સંબંધમાં અનુસરવાના સામાન્ય સિદ્ધાંતો વિષે કારોબારી સમિતિને ભલામજ કરશે.

(૫) બોર્ડ દ્વારા સંચાલિત આખરી પરીક્ષાનાં પરિણામની સામાન્ય રીતે પુનઃવિચારણા કરશે અને પોતાનાં મંત્રથો કારોબારી સમિતિ અને શૈક્ષણિક સમિતિ હોય તો તેને સાદર કરશે.

(૬) સફળ થયેલા ઉમેદવારોને કાઢી આપવાના પ્રમાણપત્રો અને હંગામી પ્રમાણપત્રોના અને આખરી પરીક્ષાના સંબંધમાં તમામ ઉમેદવારોને આપવાના ગુણપત્રકો અથવા ઐરોએન્ડમના ધોય નમૂના માટે કારોબારી સમિતિને ભલામજ્ઞ કરશે.

(૭) વિનિયમોને અનુસૂધ આખરી પરીક્ષાનું સંચાલન કરવાનો અને પરીક્ષા લેવા માટેની તારીખો નિયત કરવાનો હુકમ કરશે.

(૮) પ્રાક્ષિકો, ભાષાંતરકારો, મોડેટરો અને પરીક્ષકોની નિમણૂક અંગે અભ્યાસ સમિતિ હોય તો તેની ભલામજ્ઞો વિચારમાં લેશે અને કારોબારી સમિતિની મંજૂરી માટે તેમની યાદીઓ તૈયાર કરશે.

(૯) પરીક્ષાનાં જુદાં જુદાં કેન્દ્રોએ મુખ્ય સંચાલકોની નિમણૂક અંગે અધ્યક્ષને સલાહ આપશે.

(૧૦) આખરી પરીક્ષામાં બેસ્ક્વાની પરવાનગી માગતા ઉમેદવારોએ ભરવાના અરજીના નમૂના અને બોર્ડ દ્વારા લેવાતી આખરી પરીક્ષાના કાર્યક્ષમ સંચાલન માટે જરૂરી બીજી નમૂના ઠરાવશે.

(૧૧) બોર્ડ દ્વારા સંચાલિત દરેક આખરી પરીક્ષાનાં કેન્દ્રો અને પેટા-કેન્દ્રો નક્કી કરશે.

(૧૨) લેઝિટ, મૌખિક અને પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાની રીત ઠરાવશે અને બોર્ડ દ્વારા સંચાલિત આખરી પરીક્ષા સાથે સંલગ્ન જુદાં જુદાં કામ જેમને સોંપેલાં હોય તે ઉમેદવારો અને અન્ય વ્યક્તિઓને આપવાનાં સૂચનો ઠરાવશે.

(૧૩) બોર્ડ દ્વારા સંચાલિત આખરી પરીક્ષાઓનાં પરિણામો જીહેર કરશે અને બોર્ડ વખતો-વખત મંજૂર કરે તેવાં ઈનામો, ચંદ્રકો અને શિખ્યવૃત્તિઓ એનાયત કરશે.

(૧૪) બોર્ડ દ્વારા સંચાલિત દરેક આખરી પરીક્ષાના સંબંધમાં ગુણવત્તાના ધોરણો સફળ થયેલા ઉમેદવારોની અને શિખ્યવૃત્તિઓ, ચંદ્રકો, ઈનામો અને બીજી પારિતોષિકો જેમને એનાયત કરવાનાં હોય તે ઉમેદવારોની એક યાદી પરિણામો જીહેર થયા પછી, તરત જ માહિતી માટે બોર્ડને મોકલાવશે.

(૧૫) બોર્ડ દ્વારા લેવાતી આખરી પરીક્ષાના સંચાલનમાંથી ઉપસ્થિત થતી બીજી તમામ બાબતે વિચારજીમાં લઈ તે અંગે નિર્ણય કરશે.

(૧૬) બોર્ડની કારોબારી સમિતિએ જે કોઈ બાબત સંબંધમાં પરીક્ષા સમિતિનાં મંત્રથો મંગાવ્યાં હોય અથવા પરીક્ષા સમિતિને કારોબારી જે કોઈ બાબત સંબંધમાં સલાહ આપવાનું જરૂરી જણાય તે બાબત અંગે રિપોર્ટ કરશે.

(૧૭) રિન્ડિસ્ટર થયેલી શાળાઓમાં આખરી પરીક્ષા સહિતના વિદ્યાર્થીઓના કાર્યનું સામાન્યતઃ મૂલ્યાંકન કરશે અને તે અર્થે બોર્ડને જરૂરી ભલામજ્ઞો કરશે.

**શૈક્ષણિક સમિતિ** C. (ક) (૧) બોર્ડ તેની નિમણૂક કરવી જોઈશે.

(૨) અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત તેમાં દસ સભ્યો રહેશે, તેમાંના પાંચ સભ્યો બોર્ડના ચાલુ સભ્યોમાંથી રહેશે અને પાંચ સભ્યો, બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તૈયાર કરેલી સૂચિમાંથી બોર્ડ પસંદ કરવાના અકાદમીના જાણીતા બિન-સભ્યોમાંથી રહેશે.

(૩) તેમના હોદાની મુદ્દત બે વર્ષની રહેશે.

(૪) કલમ ૧૭ (૧) (ક) (ઘ) (ગ) (ઘ), (૨), (૩), (૪), (૬), (૧૧), (૧૨), (૨૬)માં દરેકનાં કાર્યો અંગે અને બોર્ડ તેને સોંપી હોય તેવી અન્ય શૈક્ષણિક બાબત સલાહ આપવાની તેની ફરજી રહેશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૧૭ની સંગત વિગતો નીચે પ્રમાણે છે :-

૧૭. આ અધિનિયમની જોગવાઈઓને આપીન રહીને, બોર્ડની સત્તા અને ફરજી નીચે પ્રમાણે રહેશે -

(૧) સામાન્ય રીતે પોતાને લખી મોકલવામાં આવ્યેથી અથવા પોતાની મેળે માધ્યમિક શિક્ષણને લગતી નીતિવિષયક બાબતો અંગે અને ખાસ કરીને, નીચેની બાબતો અંગે રાજ્ય સરકારને સલાહ આપવાની -

(ક) માધ્યમિક શિક્ષણની યોગ્ય પદ્ધતિના કિએક વિકાસ બાબત.

(ખ) માધ્યમિક શિક્ષણની આવી પદ્ધતિ માટે શૈક્ષણિક ધોરણો ઠરાવવા અને તે જાળવવા બાબત.

(ગ) માધ્યમિક શિક્ષણના સંબંધમાં રાઝ્યની અને રાજ્યની નીતિનો સમન્વય સાધવા બાબત.

(ઘ) શૈક્ષણિક આપોજન, કાર્યક્રમ અને વ્યવસ્થાને લગતી બાબતો બાબત.

(૨) માધ્યમિક શિક્ષણને લગતા અભ્યાસક્રમ તથા પાઠ્ય-પુસ્તકો વિષે રાજ્ય સરકારને ભલામણ કરવા બાબત અને રજિસ્ટર થયેલી શાળાઓમાં ઉપયોગ માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય-પુસ્તક બોર્ડ તૈયાર કરેલાં પાઠ્ય-પુસ્તકો મંજૂર કરવા અને રાજ્ય સરકારને તેની ભલામણ કરવા બાબત.

(૩) નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષકોને કરી તાલીમ આપવા માટે કાર્યક્રમો યોજવા બાબત.

(૪) બુદ્ધિશાળી વિધાર્થીઓ પારખી કાઢવામાં અને તેમની શક્તિને પૂર્ણ વિકાસ તરફ દોરી જવાના તેમના પ્રયાસમાં રજિસ્ટર થયેલી શાળાઓને માર્ગદર્શન અને સહાય આપવા બાબત.

(૫) માધ્યમિક શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક પ્રયોગો અને સંશોધન કરવા માટે રજિસ્ટર થયેલી શાળાને પરવાનગી અને પ્રોત્સાહન આપવા બાબત અને આવા પ્રયોગો અને સંશોધન કરવાની શરતો ઠરાવવા બાબત.

(૧૧) રજિસ્ટર થયેલી શાળાના સ્થાની નિમણૂક માટે લાયકાતો સહિતનાં ધોરણો અને રજિસ્ટર થયેલી શાળાઓના સંચાલન માટે મકાન, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિચર, સાધન-સામગ્રી, સ્ટેશનરી અને બીજી ચીજું સુસ્થિત માટેની જરૂરિયાતોનું ધોરણ ઠરાવવા બાબત.

(૧૨) પૂરક વાંચન માટેની તથા ગ્રંથાલયનાં પુસ્તકો માટે રજિસ્ટર થયેલી શાળાઓને ભલામણ કરવા બાબત.

(૧૩) લાયકાતો, પસંદગીની પદ્ધતિ અને નિમણૂક, બઢતી અને નોકરીની સમાપ્તિની શરતો અને રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાઓના ડેમાસ્ટર અને અધ્યાપકીય અને બિનઅધ્યાપકીય સ્થાની વર્તણૂક અને શિક્ષત માટેના નિયમો ઠરાવવા બાબત.

c. (ખ) (૧) માધ્યમિક શાળામાં શિખવાતા દરેક વિષય માટે બોર્ડ, અભ્યાસ સમિતિ નીમી અભ્યાસ સમિતિ શક્શીલ.

(૨) આવી દરેક સમિતિ ગ્રંથાં ઓછા નહિ અને પાંચથી વધુ નહિ તેટલા સભ્યોની બનારો, જેમાંથી ઓછામાં ઓછો એક સભ્ય બોર્ડનો ચાલુ સભ્ય હોવો જોઈશે, જે આવી સમિતિના કન્વીનર તરીકે પણ કામ કરશે.

(૩) આવી દરેક સમિતિના છોદાની મુદત, વિનિયમ નંબર ૬ (૩) માં ઠરાવ્યા પ્રમાણે ગ્રંથ વર્ષની રહેશે.

(૪) આવી દરેક સમિતિએ, વિષયના નિયત અભ્યાસક્રમ અને અભ્યાસક્રમ અંગે અને તેમાં જરૂરી લાગે તેવા કોઈ ફેરફાર અંગે બોર્ડને સલાહ આપવી જોઈશે. તે સંબંધિત વિષયમાં માધ્યમિક શાળાઓમાં ઉપયોગ કરવા ધોરણાં તમામ પાઠ્ય-પુસ્તકો અંગે અભિગ્રાહ વ્યક્ત કરવાને પણ સત્તમ રહેશે.

### નાજ્ઞાં સમિતિ

C. (ગ) બોર્ડ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને નીચે પ્રમાણે સાત અન્ય સહ્યોની બનેલી નાજ્ઞાં સમિતિ નીમશે -

(ક) ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ (સન ૧૯૭૭નો અધિનિયમ નંબર ૧૮) ની કલમ  
ગ(૨) (ક)માં ઉત્તેખેલ હોદાના સહ્યોમાંથી એક સહ્ય

- (ખ) હોદાની રૂથેના સહ્યો સિવાપના બોર્ડના તમામ સહ્યોમાંથી ચાર સહ્યો
- (ગ) રાજ્ય સરકારે નીમવાના શિક્ષણ વિભાગના નાયબ સચિવ
- (ઘ) બોર્ડના સ્ટોર્સ અને હિસાબ નિયંત્રક નાજ્ઞાં સમિતિના સહ્ય-સચિવ રહેશે.

### પ્રકરણ-૪

#### માધ્યમિક શાળાઓનું રજિસ્ટ્રેશન

##### બોર્ડ માધ્યમિક

શાળાઓનું  
રજિસ્ટ્રેશન કરવા  
માટેની કાર્યરીતિ

E. (૧) જે મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ ૧૯૫૦ નીચે નોંધાયેલ ટ્રસ્ટ શૈક્ષણિક વર્ષથી શાળાની સ્થાપના કરીને માધ્યમિક શિક્ષણ આપવા માગે તેણે અગાઉના શૈક્ષણિક વર્ષમાં ત૧મી ઓગસ્ટ અથવા તે પહેલાં ખંડ (૨) માં ઠારાચા પ્રમાણેના નમૂના-૧માં બોર્ડને અરજી કરવી જોઈશે અને પછી બોર્ડ કેશુઆરી મહિનાની ૨૮મી તારીખે અથવા તે પહેલાં આવી તમામ અરજીઓ અંગે નિર્ણય કરશે.'

(૨) આ વિનિયમના ખંડ (૧) ડેફલની દરેક અરજી, નિયત કરેલાં ફી સાથે બોર્ડના સેકેટરીને, સ્વીકાર પહોંચ સાથે રજિસ્ટર્ડ ટપાલથી મોકલવી.

(૩) "નોંધણી (Registration) માટેની અરજી, બોર્ડ વખતો વખત નક્કી કરે તેવી ફી ચૂકવીને બોર્ડમાંથી મેળવવાના ફોર્મ-૧માં વિષિસર કરવામાં આવી હોય અને વિનિયમ ૮ (૨)માં નિયત કર્યા પ્રમાણે રૂ. ૧,૦૦૦/- અથવા નિયત કરેલાં ફી ચૂકવવામાં આવી હોય તો જ વિચારણામાં લેવામાં આવશે."

(૪) અરજી મધ્યે સેકેટરીએ તેની એક નકલ રિપોર્ટ માટે અધિકારીને તરત રવાના કરવી જોઈશે અને તેમાં જે તારીખે અથવા જે તારીખ પહેલાં અધિકારીના રિપોર્ટ અને ભલામણો બોર્ડની ઓફિસમાં પહોંચશે તે દર્શાવવું જોઈશે. સેકેટરીએ યોગ્ય ચકાસજી કર્યા પછી અરજી સહિત અધિકારીના રિપોર્ટ અને ભલામણોને મંજૂરી માટે કારોબારી સમિતિ સમક્ષ મુકવાં જોઈશે.

(૫) ખંડ (૪) ડેફલ પોતાનો રિપોર્ટ રવાના કરતી વખતે સંબંધિત અધિકારીએ ટ્રસ્ટ રજિસ્ટર થયેલું છે કે કે કે તેમ અને કઈ શરતે રજિસ્ટર થયેલું છે ' જાગ્ઝાવવું જોઈશે.

(૬) કારોબારી સમિતિ, અરજદાર પાસેણી અરજની વિચારણાને લગતી કોઈ માહિતી મંગાવી શકશે અને અરજદારે સત્તરે અધિકારી મારકણ જરૂરી માહિતી પૂરી પાડવી જોઈશે.

(૭) માધ્યમિક શાળા નીચેની જરૂરિયાતો સંતોષતી ન હોય તો બોર્ડથી તેને રજિસ્ટર કરી શકશે નહિ અથવા તેને રજિસ્ટર કર્યાનું ચાલુ રાખી શકશે નહિ -

(૧) બોર્ડના અભિગ્રાહ મુજબ વહીવટ કાર્યક્રમ અને વિશ્વાસપાત્ર છે અને યોગ્ય રીતે રચેલા

અધિકારી મંડળ અથવા સંચાલક મંડળના ઉસ્તક તેનો વહીવટ છે અને તેની નાણાકીય સદ્ગરતાની ખાતરી છે.

(૨) બોર્ડના અધિકારીઓના, વિભાગના નિરીક્ષણ અધિકારીઓના નિરીક્ષણ માટે અથવા બોર્ડ અધિકૃત કરેલી વ્યક્તિના નિરીક્ષણ માટે શાળા મુલ્લી છે.

(૩) વિનિયમોમાં ઠરાવેલી પ્રમાણભૂત જરૂરિયાતો અનુસાર શાળાનું સંચાલન કરવા માટે બોર્ડના અભિપ્રાય મુજબ શાળામાં ફર્નિચર, પ્રયોગશાળા, ગ્રંથાલય સાધનસામગ્રી, સ્ટેશનરી અને બીજી ચીજા વસ્તુઓ છે, વિનિયમ હેઠળ ઠરાવેલી લાયકાતવાળો બિન-અધ્યાપકીય અને અધ્યાપકીય સ્ટાફ છે અને વિદ્યાર્થીઓ માટે મનોરંજન અને આરોગ્યવર્ધક સંગ્રહી છે.

(૪) શાળામાં અપાનું શિક્ષણ બોર્ડના અભિપ્રાય મુજબ બધી બાબતોમાં સંતોષકારક છે અને જે સંભ્યો આ અર્થે કરેલા વિનિયમો અનુસાર સંભ્યો તરીકે નીમાવા માટે લાયક હોય તે સંભ્યોને શાળા નોકરીએ રાખે છે.

(૫) શાળામાં સરકારે મંજૂર કરેલો પાઠ્યકક્ષ અને વિગતવાર અભ્યાસક્રમ અનુસરવામાં આવે છે અને સરકારે વખતોવખત મંજૂર કરેલા અથવા ઠરાવેલા પાઠ્યપુસ્તકો વપરાય છે.

(૫-ક) શાળાના સંચાલક નમૂનારૂપ જવાબો સાથેના પરીક્ષાના પત્રપત્રોનાં પાઠ્યપુસ્તકો અથવા નવી આવૃત્તિ ઉપરના પત્રો અને જવાબોવાળા મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપનારી નોંધો, ગાઈડો, ત્વરિત તૈયારી માટેનાં પુસ્તકોનાં ટિપ્પણો અને એવાં અન્ય પુસ્તકોનો ઉપયોગ શાળાની જગામાં કરવાની પરવાનગી આપશે નહિ.

(૬) જુદાં જુદાં ધોરણોમાં આપેલા પ્રવેશો કલમ ૧૭ના પંડ ૧૮ હેઠળ બોર્ડ ઠરાવેલી શરતો પ્રમાણે છે.

(૭) કલમ ૧૭ના પંડ ૧૦ હેઠળ બોર્ડ ઠરાવેલા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને એક ધોરણમાંથી ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે.

(૮) વિકાસ ફિલો દર, ડેડનેસ્ટર, અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફના પગારધોરણ અને ભથ્યાં અને પૂરી પાઠેલી સુવિધાઓ આ વિનિયમો અનુસાર છે.

(૯) શાળા, બોર્ડ ઠરાવેલાં રજિસ્ટરો અને રેકર્ડ્સ સંતોષકારક રીતે રાખે છે.

(૧૦) શાળા અથવા સંચાલકો તરફથી અપાતાં રેકર્ડ, આંકડાપત્રકો અને પ્રમાણપત્રો વિચસનીય છે.

(૧૧) શાળા, બોર્ડને સંતોષ થાપ તે રીતે એવી જોગવાઈ કરવાની બાધ્યકરી લે છે કે બોર્ડ વખતોવખત ઠરાવેલા શિસ્તના સામાન્ય નિયમોનું, શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ યોગ્ય રીતે પલાન કરે છે.

(૧૨) સંચાલકો ખાતરી આપે છે કે પોતે વહીવટ કરતા હોય તે શાળાના મકાનમાં અથવા અન્ય જગામાં કોઈ પણ રજિસ્ટર નહિ થયેલી શાળા અથવા વર્ગ ચલાવવામાં આવતાં નથી.

(૧૩) શાળા બોર્ડ દ્વારા સંચાલિત ભાષાભિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા જેવા પ્રકારની અથવા તેના કરતાં ઊંચી કોઈ પરીક્ષા માટે એકના એક વિદ્યાર્થીને તૈયાર કરતી નથી અને મોકલતી નથી.

(૧૪) શાળાને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય તો તે શાળા ધર્મ, કોમ, ઘાતિ, ભાષા અથવા તે પૈકી કોઈ કારણે જ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની ના પારી શકશે નહિ.

(૮) (૧) કારોબારી સમિતિને એવી ખાતરી થાય કે શાળા રજિસ્ટર કરવાને પાત્ર છે, તે પ્રસંગે, સેકેટરીએ રાખવાની રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાઓની પાઈમાં, તે શાળાનું નામ દાખલ કરવા કારોબારી સમિતિએ તેને આદેશ કરવો જોઈશે અને સેકેટરીએ અરજદારને ખબર આપવી જોઈશે કે શાળા રજિસ્ટર કરવામાં આવી છે અને કારોબારી સમિતિ એવો નિર્ણય કરે કે શાળા રજિસ્ટર કરવી નહિ, તે પ્રસંગે, સેકેટરીએ અરજદારને તે નિર્ણયની જ્ઞાન કરવી જોઈશે.

(૨) કોઈ શાળાને રજિસ્ટર કરવા કે રજિસ્ટર ન કરવા અંગેની અધિકારીની ભલામણ કારોબારી સમિતિએ સ્વીકારી ન હોય, ત્યારે તે ખાટેનાં કારકો લેખિત નોંધવાં જોઈશે.

(૮) બોર્ડના સેકેટરીએ નમૂના ૨ પ્રમાણેનું રજિસ્ટર રાખતું જોઈશે.

(૧૦) રજિસ્ટર થયેલી શાળાનો વહીવટ સંભાળનાર વ્યક્તિએ કરેલી વિનંતી ઉપરથી સેકેટરી, બને ત્યાં સુધી, શાળાના રજિસ્ટ્રેશન માટેની કાર્યરીતિ જેવી કાર્યરીતિ અનુસર્યા પછી અને રજિસ્ટરમાં નોંધવાના સંબંધમાની નોંધોમાં ફેરફાર કરવા અંગે બોર્ડની કારોબારી સમિતિની અગાઉથી મંજૂરી મેળવ્યા પછી, આવો ફેરફાર કરી શકશે.

'(૧૦-૧) નોંધાયેલી માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર માટે માધ્યમિક શાળાનું મકાન જો,

(૧) જૂન, વિસ્માર અને ભયજનક હાલતમાં હોય.

(૨) શાળાનું મકાન ભાડાનું હોય અને ખાલી કરવાના સંજોગો ઉપરથિત થાય અથવા સંસ્થા તરફથી મંજૂરી લઈને, નવા મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય, અને

(૩) શાળાનું મકાન હથાત હોય તેમાં માધ્યમિક શિક્ષણ વિનિયમોની જોગવાઈ અનુસાર વધુ સારા પ્રમાણમાં અધ્યતન સગવડો ધરાવતું બનાવ્યું હોય કે વધુ સારા પ્રમાણમાં સગવડો ધરાવતું મકાન બાટે રાખ્યું હોય તો,

ઉપરોક્ત સંજોગો ધ્યાનમાં લઈને શાળાનું નવું મકાન જો એક ડિ. મી. વિસ્તારમાં આવતું હોય તો તેના સ્થળ ફેરફારની નીચે જણાવેલ શરતે મંજૂરી આપી શકાશે.

(૧) આવા સ્થળ ફેરફાર માટે શાળાએ તેના વાલીમંડળના ૫૦ ટકાથી વધારે સભ્યોની તથા શિક્ષક અને અન્ય કર્મચારીઓની લેખિતમાં સંમતિ રજૂ કરવાની રહેશે.

(૨) આવા સ્થળ ફેરફારની મંજૂરી શાળાના સમગ્ર જીવનમાં ફક્ત એક જ વાર આપવામાં આવશે. તે શિવાય સ્થળ ફેરફારની મંજૂરી આપવામાં આવશે નહીં.

વધુમાં આથી ઠરાવવામાં આવે છે કે કે ડિસ્પેન્સ શાળા પોતાના માલિકીના મકાનમાં સ્થળ ફેરફાર કરતી હશે તો તેને નવા મકાનના ભાડાની ગ્રાન્ટ મળશે નહિ.

(૧૧) માધ્યમિક શાળા, રજિસ્ટર કરવામાં આવ્યેથી, રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર નમૂના ઉ મુજબ આપવાનું રહેશે.

(૧૨) રજિસ્ટર થયેલી શાળાના સંચાલકો વધુ વિષયોમાં અથવા બીજી શિક્ષણના માધ્યમ અથવા માધ્યમોમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરવા, માંગે, તો રજિસ્ટ્રેશન માટે ઠરાવેલી હોય તે જ કાર્યરીતિ બને ત્યાં સુધી અનુસરવી જોઈશે.

(૧૨-ક) સંચાલક, સામાન્ય રીતે, બોર્ડ રાખેલી જીહેર પરીક્ષાઓના સંચાલન માટે, ફર્નિચર, સાધન-સામગ્રી સાથે શાળાનું સમગ્ર મકાન અથવા તેનો ભાગ વાપરવા દેવાની ના પાડવી નહિ.

સંચાલક કરેલી વિનંતી ઉપરથી અને બોર્ડને ખાતરી થાય તો, બોર્ડ શાળાના મકાનની અને પરીક્ષાની મુદ્દત દરમિયાન તેમાં ક્રમ કરતા સ્ટાફની સલામતી માટે જરૂરી પોલીસ રક્ષણ મેળવી આપતું જોઈશે.

(૧૩) રજિસ્ટર થયેલી શાળાના સંચાલન માટે મકાનો, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિયર, સાપન-સામગ્રી, સેશનરી અને બીજી ચીજવસ્તુઓ અને માધ્યમિક શાળાની સાધન-સામગ્રીના સંબંધમાં નીચે પ્રમાણે પ્રમાણભૂત જરૂરિયતો રહેશે.

પરંતુ શાળાના રજિસ્ટ્રેશન માટે કોઈ અરજદાર જરૂરિયાતોનું પાલન કરી શકે તેમ ન હોય ત્યારે અરજદાર જેના કારણે પ્રમાણભૂત જરૂરિયાતો ઓછી સંતોષાય અથવા તે સંતોષી ન શકાય તે બદલ માફી આપી શકાય તે ખાસ સંજોગો, કારણો અથવા સ્થાનિક પરિસ્થિતિ વિશેની પૂરેપૂરી વિગતા નિર્દિષ્ટ કરી શકશે.

(૧) જગ્યા, પૂરતી રીતે આરોગ્યદાયક અને હવાઉઝસવાળી હોવી જોઈશે અને તેમાં વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી જોગવાઈ હોવી જોઈશે અને સહ-શિક્ષણ આપનારી શાળાની બાબતમાં, છોકરીઓ માટે અલગ સંખેખકારક અને પૂરતી સફાઈ વયસ્થા હોવી જોઈશે.

(૨) જે રૂમોમાં વર્ગો ચાલતા હોય તેમાં, દરેક વર્ગમાં ખરેખરા દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી દીઠ આડ ચોરસ ફૂટ કરતાં ઓછી ન હોય તેટલી અર્થાત് ૪૦૦ ચોરસ ફૂટ અથવા ૪૦ ચોરસ મીટર જગ્યાની જોગવાઈ હોવી જોઈશે. આ જગ્યામાં શિક્ષક માટેનાં ખુરાકી ટેલલ, ટીચરીંગ પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ અને શીખવવા માટે જરૂરી બીજી કોઈ સાધનસામગ્રી માટે જોઈતી જગ્યાનો સમાવેશ થતો નથી.

(૩) વર્ગરૂમમાં જેટલા વિદ્યાર્થીઓ માટે જગ્યાની સગવડ હોય તેટલા વિદ્યાર્થીઓ પૂરંતુ ધોરણના ડિવિઝનમાં પ્રવેશ આપવાનું મર્યાદિત રહેશે, પરંતુ વધુમાં વધુ સંખ્યા ૬૦% રહેશે.

“પરંતુ ધોરણ ૧૦ની બાબતમાં બોર્ડ દ્વારા લેવામાં આવેલ આખરી પરીક્ષામાં નાપાસ થયા બાદ, નોંધાયેલ શાળામાં ફરીથી જોડાનાર ૧૦થી વધુ નહી એટલા વિદ્યાર્થીઓને અધિકારીની પરવાનગીથી ધોરણ ૧૦ના પ્રત્યેક વર્ગ (Division) માં પ્રવેશ આપી શકશે આવા વિદ્યાર્થીઓએ, વખતોવખત નિયત કરવામાં આવે તેવી ફી ચૂકવવાની રહેશે.”

વધુમાં જે વર્ગમાં સાઈટ કરતાં વધારે વિદ્યાર્થીઓ માટે પૂરતી જગ્યા અને સાપન-સામગ્રી હોય તે વર્ગમાં સાઈટ વિદ્યાર્થીઓએ ઉપરાંત પાંચ કરતાં વધારે ન હોય તેટલા વિદ્યાર્થીઓને સંબંધિત અધિકારી, પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પ્રવેશની મંજૂરી આપશે.<sup>૩</sup>

વધુમાં, સેકેટરી ખાસ સંજોગોમાં અને જરૂર લાગે તો આ ખંડમાં નિયત કરવામાં આવેલી મર્યાદા ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ફૂટ અધ્યક્ષશ્રીની પૂર્વ મંજૂરીથી નોંધાયેલી શાળાને આપી શકશે.

૩ (ક) “ધોરણના વર્ગોમાં પ્રવેશ સંખ્યા, ઉત્તર બુનિયાદી શાળાઓમાં ૪૦ વિદ્યાર્થીઓની અધિકતમ સંખ્યાને આધીન રહીને, વર્ગખંડની વિદ્યાર્થીઓ સમાવવાની ક્ષમતાની મર્યાદામાં હોવી જોઈશે અને વિકસિત ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ ૮ થી ૧૦માં પ્રવેશ આપવા માટેની અધિકતમ સંખ્યા ૩૫૦ વિદ્યાર્થીઓથી વધ્યી જોઈશે નાદિ.”

(૪) દરેક રજિસ્ટર થયેલી શાળાએ, વલહાર્ય હોય તેટલે સુધી, શાળાથી વાજબી અંતરે દરેક ૨૫૦ વિદ્યાર્થીઓ દીઠ એક એકડ લેખે રમતગમતના મેદાન માટે જરીનાની જોગવાઈ કરવી જોઈશે.

પરંતુ કારોબારી સમિતિ, કેસના ખાસ સંજોગોમાં, આ પેરેગ્રાફ ડેટનાની જરૂરિયાત હળવી કરી શકશે.

(૫) શાળાના સંચાલન માટે પૂરતી અને યોગ્ય પ્રયોગશાળા, ગ્રંથાલય, કન્નિયર, સાપન-સામગ્રી, સ્ટેશનરી અને બીજી ચીજવસ્તુઓની જોગવાઈ કરવી જોઈશે.

(૬) જે રજિસ્ટર થયેલી શાળામાં ટેકનિકલ, વિજ્ઞાન અને વ્યાવસાયિક વિષયો શીખવવામાં આવતા હોય ત્યાં પ્રત્યક્ષ કામ માટે સુસજ્જ વક્ષથોપ, પ્રયોગશાળા અને સાધનસામગ્રી પૂરી પાડવી જોઈએ અને કોઈ પક્ષ એક સમયે પ્રત્યક્ષ કામ માટે એક શિક્ષકને સોંપેલા વિદ્યાર્થીઓની સંખ્યા એક ડિવિઝનની મંજૂર કરેલી સંખ્યાબળ કરતાં વધારે હોવી જોઈશે નહિ.

(૭) શાળાનું પ્રમાણ લક્ષ્યમાં લઈને શાળાનો શૈક્ષણિક સ્ટાફ, પૂરતો અને સારી લાયકાત ધરાવતો હોવો જોઈએ, વૈકલ્પિક અભ્યાસક્રમોની જોગવાઈ હોવી જોઈએ અને તેમાં મૈચ્છિક વિષયો શિખવાડયા જોઈએ, ઉંઘી ધરાવતા અથવા સંબંધિત વિષયોમાં બીજી કોઈ સમક્ષ લાયકાત ધરાવતા, પોતે શીખવતા હોય તેવા વિષયોમાં તાત્કાલિક પામેલા શિક્ષકોની જોગવાઈ હોવી જોઈશે. :

પરંતુ કારોબારી સમિતિ, રજિસ્ટર થયેલી શાળાના ખાસ સંઝેગોમાં, તેના કેસના ગુણીયના આધારે આ વિનિયોગોમાં નિર્દિષ્ટ કરેલી જરૂરિયાતો પૈકી કોઈ જરૂરિયાત હળવી કરી શકશે.

(૮) બોર્ડને ખાતરી થાય કે સંબંધિત લક્ષ્યની પડેલી જરૂરીયાત તેનાથી પરિપૂર્ણ થશે તે સિવાય, સાધારણ રીતે નવી શાળા ખોલવા દેવામાં આવશે નહિ. નવી શાળા શરૂ કરવા માગતા મંડળે, જરૂરિયાતના પ્રકાર અંગે ખાતરી કરાવતી સાબિતી આપવી જોઈશે.

(૯) બોર્ડને એમ ખાતરી થાય કે તે ગ્રામ વિસ્તારોની અંદર ૫ કિલોમીટર તરીકે ગણ્યું હોય તેવા, વાજભી અંતરે આવેલ વિદ્યમાન સંખ્યા સાથેની અયોગ્ય અને/અથવા ગેરવાજભી હરીફાઈમાં પરિણામવાનો સંભવ છે તો તે લક્ષ્યમાં સાધારણ રીતે નવી શાળા ખોલવા દેવાશે નહિ નવી શાળા શરૂ કરવાના પરિણામે, તે જ લક્ષ્યમાં ખરેખર હોય તેવી શાળાને, તેની ધાર્યાત્માં ૨૦ ટકાથી વધારે ખોટ સહેલી પડે તો આને અયોગ્ય હરીફાઈથી મળેલી પ્રત્યક્ષ સાબિતી તરીકે ગજવવામાં આવશે અને બોર્ડ આ આધારે જ, ભલામજા કરી શકશે કે આવી નવી ખોલેલી શાળાને ગ્રાન્ટ આપવી જોઈશે નહિ.

(૧૦) નવી શાળા શરૂ કરવાનું, શક્ય હોય ત્યા સુધી, તે વિસ્તારની વસતી સાથે સંબંધિત રહેશે અને દરેક ૩,૦૦૦ની વસ્તી દીઠ એક માધ્યમિક શાળા હોવાનું ચાલુ ધોરણ સ્વીકારી શકાશે. નવી અરજીઓનો નિર્ધારય કરતી વેળા શૈક્ષણિક સરવે ધ્યાનમાં રાખવી જોઈશે. જે વિસ્તારોમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હોય તે વિસ્તારોએ બીજી શાળા શરૂ કરવા માટે ધક્કાં સંગીન કારણો રજૂ કરવાનું પડશે. તેમ છતાં, આ જોગવાઈ, જેમાં વસતી મોટા ભાગે આદિવાસી અથવા પણી હોય તેવા દૂરના અને દૂદ્યા પરી ગયેલા વિસ્તારોની બાબતમાં, હળવી કરવામાં આવશે. તેમ છતાં, ૫ કિલોમીટરની મર્યાદાને સામાન્ય રીતે વળણી રહેવામાં આવશે.

**માધ્યમિક શાળાઓના રજિસ્ટરમાંથી શાળાનું નામ કાઢી નામના માટેની તપાસની રીત**

૮-ક. (૧) બોર્ડને એમ લાગે કે રજિસ્ટર થયેલી શાળાનો વહીવટ સંભાળનાર વન્નિએ (જેનો આમાં હવે પછી, આ વિનિયમમાં "સંચાલક તરીકે ઉલ્લેખ કર્યો છે. તેણે) અધિનિયમ અથવા વિનિયોગો ડેફન્સ તેના ઉપર મૂકવામાં આવેલી કોઈ પક્ષ ફરજનું અથવા બોર્ડ તેને આપેલી કોઈ પક્ષ સૂચનાઓનું પાલન કરવામાં કસૂર કરી છે અને કલમ ઉ૧ની પેટા-કલમ (૮) ડેફન્સ આવી બાબતમાં તપાસ કરવા માટે પ્રથમ દર્શનીય કેસ છે તો બોર્ડ, બોર્ડના સેકેટરીને અથવા બોર્ડના કોઈ પક્ષ અન્ય અધિકારીને, તપાસ કરવાનું ફરમાવી શકશે.

(૨) તપાસ અધિકારીએ, સંચાલક કરેલી કહેવાતી કસૂરની વિગતો અને એવી કસૂરના સમર્થનરૂપે પુરાવો સમાવિષ્ટ કરતું તહોમતનામું સંચાલક ઉપર બજીવંતું જોઈશે અને તહોમતનામામાં, જાણાવેલ દરેક આરોપના સંબંધમાં આવું તહોમતનામું મળ્યાની તારીખથી દસ દિવસની અંદર, ખુલાસો આપવા સંચાલકને ફરમાવવં જોઈશે.

(૩) તપાસ અધિકારીએ સંચાલકનો જવાબ વિચારક્ષામાં લીધા પછી અને તેને યોગ્ય લાગે તેવી વધુ તપાસ કર્યા પછી, નોટિસમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી મુદ્દતની અંદર જરૂરી હોય તેવી વધુ માહિતી પૂરી પાડવા સંચાલકને ફરમાવવું જોઈશે. તપાસ અધિકારી સંચાલક રૂબરૂમાં સાંભળવા માગે છે કે કેમ તે જરૂરાવવા સંચાલકને આવી નોટિસથી ફરમાવી શકશે. આવી નોટિસથી તપાસ અધિકારી સંચાલકને ક્રયા સ્થળે, સમયે અને તારીખે રૂબરૂમાં સાંભળશે તે જરૂરાવવામાં આવશે. સંચાલકને રૂબરૂમાં સાંભળ્યા પછી અથવા સુનાવણી માટે નક્કી કરેલ તારીખે અને સમયે, સંચાલક આજર ન રહે તો અને સંચાલકે પૂરી પાડેલ હોય તો તે, વધુ માહિતી અંગે વિચારક્ષા કર્યા પછી, તપાસ અધિકારી તેણે કરેલ તપાસનો રિપોર્ટ તૈયાર કરશે, આવા રિપોર્ટમાં સંચાલક કરેલ કસુરો અવશ્ય જરૂરાવશે અને તેની સાથે, તેના નિર્જય માટેનાં સહજ કારણો પણ હોવાં જોઈશે. તપાસ અધિકારી સંચાલક સામે લેવાનાં પગલાં સંબંધી ચોક્કસ ભલામણો પણ આવા રિપોર્ટમાં કરશે.

(૪) તપાસ અધિકારી, આવો રિપોર્ટ બોર્ડની કારોબારી સમિતિને સાદર કરશે. કારોબારી સમિતિ રિપોર્ટની તપાસ કરી તે અંગે વિચારક્ષા કરશે અને સંબંધિત તપાસ અધિકારીએ તેને યોગ્ય લાગે તેવી વધુ તપાસ કરવી જોઈશે. તે પછી સમિતિ કામગલાઉ રીતે એવા નિર્જય પર આવે કે સંચાલકે કસુર કરી છે તો સમિતિ સંચાલક પર નોટિસ બજ્જાવીને, રજિસ્ટરમાંથી શાળાનું નામ શા માટે કાઢી નાખવું નહિ તે અંગે નોટિસમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે મુદ્દતની અંદર જરૂરાવવા અને ખુલાસો આપવા તેને ફરમાવી શકશે. આવી નોટિસમાં સમિતિ શા માટે તપાસ અધિકારીના નિર્જય સાથે સંમત થાય છે અથવા સંમત થથી નથી તેનાં કારણો અને જે પુરાવા અને અન્ય માહિતીના આધ્યાત્મે શાળાનું નામ રજિસ્ટરમાંથી કાઢી નાખવા ધાર્યું હોય તે પણ જરૂરાવવું જોઈશે. સંચાલકનો ખુલાસો મળ્યે, સમિતિ, સંચાલકે સાદર કરેલ ખુલાસો સંતોષકારક છે કે નહિ તે અંગે તપાસ કરી વિચારક્ષા કરશે. સંચાલકનો ખુલાસો તપાસ્યા પછી અને તે ઉપર વિચારક્ષા કર્યા પછી કારોબારી સમિતિ એમ નિર્જય કરે કે અધિનિયમ અથવા વિનિયમો ડેટન સંચાલક તેના પર મૂકેલી કોઈ પણ ફરજનું અથવા સમિતિ તેને આપેલી કોઈ પણ સૂચનાનું પાલન કરવામાં કસુર કરી છે, તો સમિતિ એવો આદેશ કરી શકશે કે આદેશમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી મુદ્દત સુધી શાળાનું નામ રજિસ્ટરમાંથી કાઢી નાખવું અથવા એવા આદેશ આપી શકશે કે કાયમ માટે રજિસ્ટરમાંથી તે શાળાનું નામ કાઢી નાખવું.

(૫) રજિસ્ટર થયેલી શાળાનો સંચાલક સેકેટરીની અગ્રાઉની પરવાનગી લીધા સિવાય, આવી શાળામાં દસ્તું ધોરણ શરૂ કરી શકશે નહિ.

(૬) રજિસ્ટર થયેલી શાળાનો સંચાલક અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય, આવી શાળામાં નવમું ધોરણ અથવા ચાલુ ધોરણના કોઈ પણ વધારાના વર્ગ શરૂ કરી શકશે નહિ.

(૭) (ક) ઉપલું ધોરણ અથવા ઉપલાં ધોરણો શરૂ કરવાની પરવાનગી માટેની અરજી જે શૈક્ષણિક વર્ષથી ઉપલું ધોરણ અથવા ઉપલાં ધોરણો શરૂ કરવા ધાર્યું હોય તે શૈક્ષણિક વર્ષથી ઓછામાં ઓછા છ મહિના અગ્રાઉ અધિકારીને સાદર કરવી જોઈશે.

(૮) તેવી જ રીતે, ચાલુ ધોરણના નવા વર્ગ અથવા વધારાના વર્ગો શરૂ કરવાની પરવાનગી માટેની અરજી શૈક્ષણિક વર્ષના આરંભના એક મહિનાની અંદર અધિકારીને સાદર કરવી જોઈશે.

(૯) (ક) સેકેટરીને એવી ખાતરી થાય કે સંચાલક ધોરણ ૧૦મું સંચાલન કરવા માટે જરૂરી વધારાના કલાસરૂમ, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિચર, સાધન સામગ્રી, સ્ટેશનરી અને અન્ય ગીજ-વસુઓના સંબંધમાં, પૂરતી જોગવાઈ કરવા તૈયાર છે અથવા ખુશી છે. તે સિવાય અધિકારીથી ધોરણ ૧૦ શરૂ કરવાની પરવાનગી આપી શકશે નહિ.

(૧૦) અધિકારીને એવી ખાતરી થાય કે સંચાલક વધારાના વર્ગોનું સંચાલન કરવા માટે જરૂરી વધારાના કલાસરૂમ, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિચર, સાધનસામગ્રી, સ્ટેશનરી અને અન્ય

માધ્યમિક શાળામાં કંપિક વર્ગ કે વધારાના વર્ગો શરૂ કરવાની રીત

શીજવસ્તુઓના સંબંધમાં પૂરતી જોગવાઈ કરવા તૈયાર અને ખુશી છે તે સિવાય, અધિકારીથી નવમું ધોરણ અથવા ચાલુ ધોરણના વધુ વર્ગો શરૂ કરવાની પગવાનગી આપી શકશે નહિ.

(૪) આ વિનિયમની જોગવાઈઓ વધુ સારા આંતરિક સંગઠન માટે કોઈ વર્ગના વિભાગને લાગુ પડશે. પરંતુ જ્યારે આવા વર્ગો કરવાથી સંબંધિત ધોરણ માટે અગાઉ મંજૂર કરેલા વર્ગોની સંખ્યામાં વધારો થતો ન હોય, તો લાગુ પડશે નહિ.

(૫) સંચાલકોને ઉપદ્ધું ધોરણ અથવા ઉપલાં ધોરણો અથવા ચાલુ ધોરણના વધુ વિભાગો શરૂ કરવાની પરવાનગી આપી હોય, તો તેણે રજિસ્ટરમાં સંબંધિત નોંધોમાં ફેરફાર કરવા જરૂરી પગલાં લેવાં જોઈશે.

વર્ગોની કુલ  
સંખ્યામાં ઘટાડો

૧૦. ક. રજિસ્ટર થયેલી શાળાના સંચાલકો અધિકારીની લેખિત પૂર્વ પરવાનગી સિવાય, શાળામાં વર્ગોની કુલ સંખ્યામાં કોઈ ઘટાડો કરી શકશે નહિ. આ હેતુ માટે સંચાલકે, જે તારીખથી તે વર્ગોની સંખ્યામાં ઘટાડો કરવા માગતો હોય તે શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ ૧ માસ સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે.<sup>૧</sup>

વધુમાં કોઈ સંચાલક, અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી સિવાય, તેની શાળામાં વર્ગોની કુલ સંખ્યામાં ઘટાડો થવાને પરિણામે શૈક્ષણિક સ્થાનમાં કોઈ ઘટાડો કરી શકશે નહિ. આવી મંજૂરી લેતાં પહેલાં અધિકારીએ બંને પક્ષકારોને એટલે કે સંચાલક અને સંબંધિત શિક્ષક અથવા શિક્ષકોને સાંભળવા જોઈશે.

નોંધ :- આ વિનિયમોમાં “વર્ગ” અથવા “વર્ગો” એ શબ્દ એટલે કોઈ ખાસ ધોરણના અને શિક્ષણના ખાસ માધ્યમના વર્ગ અથવા વર્ગો.

પત્રવ્યવહારનું  
સાધન

૧૧. (૧) દરેક રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના વડા<sup>૩</sup> શૈક્ષણિક અને વહીવટી બાબતોની સાથે સંબંધિત હોય તેટલે સુધી બોર્ડ સાથે પત્રવ્યવહાર કરશે અને રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સંચાલક મંડળને પત્રવ્યવહાર વિષે માહિતગાર કરવાની ફરજ વડાની રહેશે.

(૨) શાળાના વડાનું નામ તથા સરનામું તેની નિમણૂકની તારીખથી પંદર દિવસની અંદર બોર્ડની ઓફિસમાં નોંધવું જોઈશે.

(૩) સંચાલક શાળાની નાણાકીય બાબતો અંગેની વિવસ્થા કરવા માટે પત્રવ્યવહાર કરનાર તરીકે શાળાના સંચાલક મંડળના સંભ્ય હોય તેવી રજિસ્ટર થયેલી શાળાના વડા સિવાયની કોઈ વ્યક્તિને નીમવા માગે ત્યારે તેણે બોર્ડના સેકેટરીને ખબર આપવી જોઈશે. આવા પત્રવ્યવહાર કરનાર વ્યક્તિનું નામ તથા સરનામું આવી નિમણૂકની તારીખથી પંદર દિવસની અંદર બોર્ડની ઓફિસમાં નોંધવામાં આવશે. નાણાકીય બાબતો માટે, પત્રવ્યવહાર કરનાર વ્યક્તિના નામમાં કોઈ ફેરફાર થાય તો પત્રવ્યવહાર કરનાર વ્યક્તિનું નામ તથા સરનામું બોર્ડની ઓફિસમાં નોંધવું જોઈશે.

#### પ્રકરણ ૫

વિદ્યાર્થીઓ પ્રવેશ, કસોટી, પરીક્ષાઓ, આરોગ્ય અને શિક્ષણ

૧૨. (૧) રાજ્ય સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ દારા, ગ્રાન્ટ વિના<sup>૪</sup> ચલાવવામાં આવતી હોય તેવી રજિસ્ટર થયેલી શાળામાં કોઈ વિદ્યાર્થી ધર્મ, ક્રેમ, જ્ઞાતિ, ભાષા અથવા તે પૈકી કોઈ કારણે જ પ્રવેશ આપવાનો ઈન્કાર કરી શકશે નહિ.

(૨) વિદ્યાર્થીના પ્રવેશ માટેની અરજ શાળાના વડાને -

- (ક) વિદ્યાર્થી પુઝ ઉમરનો હોય તો તેણે પોતે,
- (ખ) તે સગીર હોય ત્યારે તેના મતાપિતાએ અથવા વાતીએ, લેખિતમાં અરજ કરવી જોઈશે.

(૩) શાળાના વડાએ શાળાને લાગુ પડતા નિયમોની નકલો, વિદ્યાર્થીને, અથવા યથા-પ્રસગ માતાપિતા અથવા વાલીને આપવાની વ્યવસ્થા કરવી જોઈશે. જે ઉપરોક્ત અધિકારીને લખાણ કરીને તે નિયમોનું પાલન કરવાની લેખિત બાંહેખરી આપશે.

(૪) શાળા છોડવા પછી કોઈ વિદ્યાર્થી પ્રવેશ મેળવવા માગે અથવા માબાપ અથવા વાલી, જેણે શાળા છોડી દીધી હોય તેવા વિદ્યાર્થીનો પ્રવેશ મેળવવા માગે, ત્યારે આવા વિદ્યાર્થીએ, અથવા વાલીએ શાળાના વડાને પ્રવેશ માટેની અરજી સાથે છેલ્લી શાળાનું શાળા છોડવાનું પ્રમાણપત્ર પૂરું પાડવું જોઈશે :

પરંતુ કોઈ વિદ્યાર્થીએ અગાઉ કોઈ પણ શાળામાં હાજરી આપી ન હોય, ત્યારે તે પતલબનો એકરાર વિદ્યાર્થી પાસેથી અથવા યથાપ્રસંગ, તેનાં માબાપ અથવા વાલી પાસેથી મેળવવો જોઈશે :

વહુમાં, કોઈ વિદ્યાર્થીએ અગાઉ કોઈ શાળામાં હાજરી આપી હોય અને આગાઉની શાળાના વડાએ શાળા છોડવાનું પ્રમાણપત્ર આય્યું ન હોય, ત્યારે શાળાના વડા અગાઉની શાળાના વડા સાથે વિચારવિનિમય કરીને વિદ્યાર્થીને કામચલાઉ દાખલ કરી શકશે અને તે બાબત અધિકારીને લખી મોકલી શકશે અને એવા અધિકારીના હુકમ પ્રમાણે કામ કરશે.

(૫) એપી રોગથી પીડાતો કોઈ વિદ્યાર્થી પાતે રોગમુક્ત છે, એવું તબીબી પ્રમાણપત્ર વિદ્યાર્થી અથવા યથાપ્રસંગ, વિદ્યાર્થીના માબાપ કે વાલી રજૂ ન કરે ત્યાં સુધી, તેને રજિસ્ટર થયેલી શાળામાં હાજરી આપવાની ધૂટ રહેશે નહિ.

(૬) સામાન્ય રીતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષના આરંભથી ત્રીસ<sup>1</sup> દિવસની મુદ્દત દરિસેપાન રજિસ્ટર થયેલી શાળામાં દાખલ કરી શકાશે :

પરંતુ આવી શાળાના વડા વિદ્યાર્થીની માંદગી, કુટુંબમાં શોક, માબાપ અથવા વાલીની એક જગાનેથી બીજી જગાએ બદલી અથવા રહેઠાજામાં ફેરફાર જેવા ખાસ સંજોગોમાં, ઉપરોક્ત મુદ્દત પૂરી થયા પછી, વિદ્યાર્થીઓને દાખલ કરી શકશે અને જ્યારે કોઈ વિદ્યાર્થીને એવી રીતે દાખલ કરવામાં આવે ત્યારે તેનો રીપોર્ટ અધિકારીને કરવો જોઈશે.

(૭) (ક) જૂનથી મે સુધીનું શૈક્ષણિક વર્ષ અનુસરતી શાળા, જ્ઞાન્યુઆરીથી ડિસેઅબર સુધીનું શૈક્ષણિક વર્ષ અનુસરતી શાળામાંથી કોઈ વિદ્યાર્થીને જ્ઞાન્યુઆરીમાં અથવા તે પછી દાખલ કરી શકાશે : પરંતુ એવી રીતે દાખલ કરેલો વિદ્યાર્થી તેણે જે શાળા છોડી હોય અને જે શાળામાં તેને દાખલ કરવામાં આવ્યો હોય તે શાળાના શૈક્ષણિક વર્ષના કામકાજના દિવસોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા ૭૫ ટકા જેટલા દિવસો સુધી જે ધોરણમાં તેને દાખલ કરવામાં આવે તે ધોરણના વર્ગોમાં હાજરી આપી હોય તે સિવાય, જે શાળામાં તેને દાખલ કરવામાં આવ્યો હોય તે શાળાની આગામી વાર્ષિક પરીક્ષામાં બેસવાને લાયક થશે નહિ.

(ખ) જ્ઞાન્યુઆરીથી ડિસેઅબર સુધીનું શૈક્ષણિક વર્ષ અનુસરતી શાળા જૂન થી મે સુધીનું શૈક્ષણિક વર્ષ અનુસરતી શાળામાંથી આવતા વિદ્યાર્થીને જૂન મહિનામાં અથવા ત્યાર પછી દાખલ કરી શકાશે.

પરંતુ એવી રીતે દાખલ કરેલો વિદ્યાર્થી, તેણે જે શાળા છોડી દીધી હોય અને જેમાં તેને એવી રીતે દાખલ કર્યો હોય તે શાળાના શૈક્ષણિક વર્ષના કામકાજના દિવસોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા ૭૫ ટકા જેટલા દિવસો સુધી તેને જે ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હોય તે ધોરણના વર્ગોમાં હાજરી આપી હોય તે સિવાય, જે શાળામાં તેને દાખલ કરવામાં આવ્યો હોય તે શાળાની આગામી વાર્ષિક પરીક્ષામાં બેસવાને લાયક ગણશો નહિ.

(ગ) રજિસ્ટર થયેલી શાળામાં કોઈ વિદ્યાર્થીને મોડો દાખલ કરવામાં આવે તે બાબતમાં, આવા વિદ્યાર્થીએ પહેલી ટર્મની શરૂઆતની ફી ભરવી જોઈશે, પરંતુ નવી શાળામાં દાખલ થતાં પહેલાંની મુદ્દત માટેની ફી આગાઉની શાળામાં ભરેલી હોવી જોઈશે.

<sup>1</sup> શિ.વિ. ગાંધીનગરના કારણ ક્રમાંક : મશાબ-૧૦૮૬-૧૨૮૩-૭ તા. ૧૪-૮-૮૭ અન્વયે

- (c) ફક્ત છોકરાઓ માટે રજિસ્ટર થયેલી શાળા છોકરીઓને દાખલ કરે ત્યારે આવી શાળાએ –
- (ક) છોકરીઓ માટે અલગ સફાઈ વ્યવસ્થા અને એકાત્મ ઓરડાની જોગવાથી કરવી જોઈશે.
- (ખ) સ્થાફમાં શાળામાં ચાળીશ છોકરીઓ દીઠ એક સ્ત્રી શિક્ષકના પ્રમાણમાં સ્ત્રી શિક્ષકો રાખવા જોઈશે.

(ગ) <sup>૧</sup> સંચાલક મંડળ હુંછે તો છોકરીઓ માટે રજિસ્ટ્રેશન થયેલી શાળામાં સ્ત્રી કર્મચારી રાખી શકશે.

(ઘ) (ક) અન્ય કોઈ રાજ્યમાં અથવા સંધ રાજ્ય ક્ષેત્રમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને જો વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર ઉપર તે રાજ્ય કે સંધ રાજ્યક્ષેત્રના શિક્ષણ અધિકારીએ સામી સહી કરી હોય તો જ રજિસ્ટર થયેલી શાળામાં તેને દાખલ કરી શકાશે :

પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્ર ઉપર તેવી રીતે સામી સહી કરેલી ન હોય, ત્યારે શાળાના વડા આવી સામી સહી કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીને કામચલાઉ ધોરણે દાખલ કરી શકશે એ કેસની પૂરી વિગતોનો અધિકારીને રિપોર્ટ કરી શકશે.

(ઘ) અન્ય રાજ્યમાં અને સંધ રાજ્યક્ષેત્રોમાં આવેલી શાળામાંથી આ રાજ્યમાંની રજિસ્ટર થયેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના હેતુ માટે, શાળાના વર્ગોના સમાન ધોરણ માટે નીચેની ફોર્મલા અનુસરવામાં આવશે :

(૧) અગિયાર વર્ષી ઉચ્ચ શાળામાંથી અન્ય અગિયાર વર્ષી ધોરણની ઉચ્ચ શાળામાં સ્થળાંતર કરતા વિદ્યાર્થીઓને, તે અભ્યાસ કરતો હોય તે જ વર્ગમાં દાખલ કરવામાં આવશે.

(૨) શાળામાંથી સ્થળાંતર કરનાર વિદ્યાર્થીની બાબતમાં શાળા અભ્યાસક્રમની મુદ્દત જે શાળામાં વિદ્યાર્થી જતો હોય તે શાળાના, શાળા અભ્યાસક્રમની મુદ્દત કરતાં જુદી હોય ત્યારે, જે શાળામાંથી તેણે સ્થળાંતર કર્યું હોય તે શાળામાં ઉચ્ચ શાળાની પરીક્ષાવાળો ઉપલો વર્ગ અને જે શાળામાં તે સ્થળાંતર કરવા માંગતો હોય તે શાળામાં ઉચ્ચ શાળાની પરીક્ષાવાળો ઉપલો વર્ગ સમાન ગણથો જોઈએ અને નીચેલા વર્ગોની, સમાન ધોરણની, ઉપલો વર્ગમાં પદોંચવા માટે જરૂરી વર્ષોની સંઘાના આધારે ગણતરી કરવી જોઈએ;

(૩) અગિયાર વર્ષી ઉચ્ચ માધ્યમિક શાળામાંથી અગિયાર વર્ષી ઉચ્ચ શાળામાં સ્થળાંતર કરતા વિદ્યાર્થીને એક ઉપલો વર્ગમાં દાખલ કરવામાં આવશે. અગિયાર વર્ષી ઉચ્ચ શાળામાંથી અગિયાર વર્ષી ઉચ્ચ માધ્યમિક શાળામાં સ્થળાંતર કરતા વિદ્યાર્થીને એક નીચેલા વર્ગમાં દાખલ કરવામાં આવશે.

(૪) સમાન ધોરણની ફોર્મ્યુલાના ધોરણે કોઈ વિદ્યાર્થીને દાખલ કરતી રજિસ્ટર થયેલી શાળાના વડાએ આચો પ્રવેશ આપ્યાના આઠ ટિવસની અંદર સંબંધિત અધિકારીને માહિતી પૂરી પાડવી જોઈશે અને અધિકારીએ આપેલો પ્રવેશ બરાબર છે કે કેમ અને સંદર્ભ ફોર્મ્યુલા પ્રમાણે છે કે કેમ તેની બનતી ત્વરાએ ચકાસડી કરવી જોઈશે અને સંબંધિત શાળાના વડાને તદ્દનુસાર જાણ કરવી જોઈશે.

(૫) બીજા દેશોમાંથી આવેલા વિદ્યાર્થીને રજિસ્ટર થયેલી શાળાના વડાને, અધિકારીને લખાડ કરીને એવી ખાતરી થાય કે વિદ્યાર્થી પાસે પોતે જે રાજ્યમાં જેટલી મુદ્દત સુધી અભ્યાસ કરવા માગતો હોય તે રાજ્યમાં તેટલી મુદ્દત આવરી લેતો યોગ્ય પ્રકારનો વીસા છે, ત્યારે જ તેને દાખલ કરવો

જોઈશે. આવા વિદ્યાર્થીને દાખલ કરતાં પહેલાં તેની કસોટી પડી લેવામાં આવશે અને તે દેશના શિક્ષણ સત્તાધિકારીઓએ પોંચ રીતે સામી જરૂરી કરેલું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ત્યાં પોતાના અભ્યાસનો તબક્કો દર્શાવતા તેવા દસ્તાવેજો રજૂ કરવા જોઈશે.

(૧૦) અધિકારીની ખાસ મંજૂરી સિવાય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે ધોરણ માટે વિદ્યાર્થીને લાયક હયાવતું હોય તે ધોરણ કરતાં ઉપલા ધોરણમાં તેને મૂડી શકાશે નહિ. વિદ્યાર્થીએ અગાઉ કોઈ મંજૂર કરેલી પ્રાથમિક શાળામાં અથવા રજિસ્ટર થયેલી શાળામાં હાજરી આપી ન હોય અથવા અગાઉ તેણે આવી કોઈ શાળામાં હાજરી આપી હોય અને તે શાળા થોડા સમય માટે છોડી દીધી હોય અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા માંગે તો, રજિસ્ટર થયેલી શાળાના ઉપરીએ, નીચેના સમયના આધારે સામાન્ય રીતે તેણે પૂરું કર્યું હોત તે ધોરણના અભ્યાસકર્મના વિષયોમાં તેની પરીક્ષા લેવી જોઈશે.

(૧) પ્રાથમિક કે માધ્યમિક કોઈ માન્ય શાળામાં અગાઉ હાજરી આપી હોય તે વિદ્યાર્થીઓની બાબતમાં, છેલ્લી રજિસ્ટર થયેલી શાળા છોડવામાં આવે ત્યારથી એક વર્ષના આધારે એક ધોરણ અથવા

(૨) બીજી વિદ્યાર્થીઓની બાબતમાં, ૫ વર્ષની ઉમર ઉપરાંત પ્રાથમિક શાળામાં, પ્રવેશ માટેની ઉમર ગણતાં, એક વર્ષના આધારે એક ધોરણ.

ત્યાર પછી તેને જે ધોરણ માટે તે પોંચ જગ્યાયો હોય તે ધોરણમાં સંબંધિત અધિકારીની મંજૂરીથી મૂકવો જોઈએ.

(૧૧) (ક) માન્ય ન થયેલી શાળામાંથી શાળા છોડ્યાના પ્રમાણપત્રના આધારે પ્રવેશ આપી શકાશે નહિ. આવી શાળામાંથી કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનું પંડ (૨) અનુસાર નિયમિત કરવામાં આવશે.

(ઘ) માન્ય ન થયેલી શાળામાંથી પ્રવેશ માટે આવેલા જે અરજદાર કોઈ માન્ય કરેલી શાળા અથવા મંજૂર કરેલી પ્રાથમિક શાળામાં હાજરી આપી ન હોય તે અરજદાર વૈતનિક મેજિસ્ટ્રેટ સમક્ષમાં બાપ અથવા વાલી સોંગંદનામું કરે એટલે બધા વિષયોમાં નિયમિત લેખિત કસોટીને પાત્ર થશે, અને રજિસ્ટર થયેલી શાળાના વડાએં જે ધોરણ માટે તે લાયક ગણાયા તે ધોરણમાં તેને અધિકારીની મંજૂરીને આધીન રહીને કામચલાઉ દાખલ કરવો જોઈશે. સોંગંદનામામાં સ્પષ્ટ પડો નીચે મુજબ જગ્યાવંનું જોઈશે :

(૧) કયા કારણાસર વિદ્યાર્થી કોઈ માન્ય થયેલી શાળા અથવા મંજૂરી થયેલી પ્રાથમિક શાળામાં જોડાયો નથી તે કારણો.

(૨) માન્ય ન થયેલી અથવા રજિસ્ટર ન થયેલી શાળાનું નામ.

(૩) તેણે હાજરી આપેલાં ધોરણો અને અભ્યાસ કરેલા વિષયોઃ અને

(૪) પાસ કરેલી પરીક્ષાઓ, હોય તો.

(૫) માન્ય ન થયેલ અથવા પથાપ્રસંગે, રજિસ્ટર ન થયેલી શાળામાંથી આવેલ અરજદારે અગાઉ માધ્યમિક કે પ્રાથમિક માન્ય થયેલી અથવા રજિસ્ટર થયેલી શાળામાં હાજરી આપી હોય, અને માન્ય થયેલી અથવા રજિસ્ટર થયેલી શાળામાં પ્રવેશ મેળવવા માંગે તે પ્રસંગે –

(૧) તેણ અગાઉ હાજરી આપી હોય તેવી માન્ય થયેલી અથવા રજિસ્ટર થયેલી શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તેની બીજી નકલ જરૂર પડે તો રજૂ કરવી જોઈશે.

(૨) તેણાં મા બાપ અથવા વાલીને વૈતનિક મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલું સોંગંદનામું પૂરું પાડવાનું ફરમાવવું જોઈશે; અને

(૩) છેલ્લી માન્ય થયેલી અથવા રજિસ્ટર થયેલી શાળા છોડી દીધાના સમયથી એક વર્ષના આધારે એક ધોરણ એ પ્રમાણે સામાન્ય રીતે જે ધોરણ વિદ્યાર્થીએ પૂરું કર્યું હોત તે ધોરણના બધા વિષયોમાં લેખિત કસોટી આપવાનું વિદ્યાર્થીને ફરમાવવું જોઈએ. અને તે પછી જે ધોરણ માટે તે યોગ્ય જગ્યાએ તે ધોરણમાં તેને અધિકારીની મંજૂરી ને આધીન રહીને કામચલાઉ ધોરણ દાખલ કરવામાં આવશે. સોગંદનામામાં નીચેની વિગતો સ્પષ્ટપણે જગ્યાવવી જોઈશે.

- (૧) માન્ય ન થયેલી અથવા રજિસ્ટર ન થયેલી શાળા જોડવા માટેનાં કારણો.
- (૨) માન્ય ન થયેલી અથવા રજિસ્ટર ન થયેલી અને જે શાળામાં જોડાયો હોય તેનું નામ.
- (૩) જે ધોરણમાં હાજરી આપી હોય અને જે વિષયોમાં તેણે અભ્યાસ કર્યો હોય તે.
- (૪) કોઈ પરીક્ષા પાસ કરી હોય તો તે.

(૧૨) સામાન્ય શાળામાંથી વ્યાવસાયિક શાળામાં અથવા વ્યાવસાયિક શાળામાંથી સામાન્ય શાળામાં સ્થળાંતર કરવા માગતા વિદ્યાર્થીને, સંબંધિત શાળાના વડા ૮માં ધોરણ સુધી દાખલ કરી શકાશે. ખાસ કેસોમાં, સામાન્ય શાળામાંથી અથવા વ્યાવસાયિક શાળામાંથી અથવા વિદુદ્ધ સ્થળાંતર કરવાની છૂટ, અધિકારીની પરવાનગીથી ૮માં ધોરણ સુધી આપી શકાશે. પરંતુ વડાને ખાતરી થવી જોઈએ કે તે વિદ્યાર્થીને વર્જના કક્ષાએ લાવવા માટે તેણે અત્યારે સુધીમાં અભ્યાસ ન કર્યો હોય તે વિષયોમાં અને સંબંધિત અભ્યાસકલના પ્રેક્ટિકલમાં જરૂરી વધારાનું શિક્ષણ તેને મળેલું છે.

શાળા રજિસ્ટરોમાં  
જન્મ તારીખ,  
નામો વગેરેમાં

ફેરફારો

વિનિયમ નં. ૧૨-૬ – (૧) અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી મેળવ્યા વિના શાળા રજિસ્ટરમાના નોંધોમાં કંઈ પણ ફેરફાર કરી શકાશે નહિ :

- (૨) શાળામાં ખરેખર હાજરી આપતા વિદ્યાર્થીના વતી હોય તે સિવાય શાળા રજિસ્ટરમાં કોઈ ફેરફાર માટેની અરજી સ્વીકારી શકાશે નહિ.
- (૩) શાળા રજિસ્ટરમાંથી નોંધોમાં ફેરફાર માટેની અરજી, વિદ્યાર્થીના માભાપ અથવા વાતીએ જ કરવી પડશે અરજી મોકલવામાં આવે ત્યારે શાળાના વડાએ પ્રમાણિત કરું જોઈશે કે તેણે સહીની ખરાઈ કરી છે અને વિદ્યાર્થીના માભાપે અથવા વાતીએ તેની સમક્ષ, અરજીમાં સહી કરી છે.
- (૪) જન્મ તારીખમાં ફેરફાર : જન્મ તારીખમાં ફેરફાર માટે ભૂલ કેવી રીતે કરવામાં આવી છે તે સ્પષ્ટ પણે અરજીમાં જગ્યાવવું જોઈશે અને સૂચિત ફેરફારના સમર્થન રૂપે નીચે પ્રમાણે દસ્તાવેજ પુરાવો રજૂ કરવો જોઈશે : –
- (ક) જન્મ રજિસ્ટરમાંથી પ્રમાણિત ઉતારો.
- (ખ) રસી મૂકાવ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
- (ગ) પ્રિસ્ટિના ડિસ્પાના, બાપિત્રસાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
- (ઘ) માભાપ અથવા વાતીએ, વૈતનિક મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ સોગંદનાનું.
- (ચ) અન્ય કોઈપણ દસ્તાવેજ પુરાવો. જન્માક્ષર પર બહુ આધાર રાખવો જોઈએ નહિ પણ તે સમર્થક પુરાવા તરીકે દાખલ કરી શકાશે.

રજૂ કરેલા દસ્તાવેજ પુરાવાથી બાળક અને માભાપની સ્પષ્ટપણે ઓળખ થતી હોય અને ખરેખર ભૂલ થઈ છે એમાં શંકા ન રહે તેવા પ્રકારના દસ્તાવેજ પુરાવા હોય તે સિવાય, જન્મ તારીખમાં કંઈપણ ફેરફાર કરી શકાશે નહિ. ફેરફાર નામંજૂર કરવા માટેના કારણો, મંજૂર કરતા સત્તાધિકારીએ લેખિતમાં રેકર્ડ પર રાખવાનું જોઈશે.

માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓનાં માબાપ અન્ય કારણોસર જન્મ રજિસ્ટરમાંથી ઉતારો અથવા રસી પ્રમાણપત્ર ૨જુ કરી શકે તેમ ન હોય તે વિદ્યાર્થીઓના સંબંધમાં, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ પાસેથી મેળવેલું પ્રમાણપત્ર ૨જુ કર્યેથી, શાળા રેકર્ડમાં જન્મ તારીખનો ફેરફાર કરવાની પરવાનગી આપી શકાશે.

(પ) (૧) નામમાં ફેરફાર : નામમાં ફેરફાર કરવા માટે, નીચેનાં દસ્તાવેજ પુરાવો, અરજીની સાથે હોવો જોઈશે અને રજુ કરેલો પુરાવો કાળજીથી તપાસ્યા વિના કંઈપ્છા ફેરફાર મંજૂર કરવો જોઈશે નહિ.

(ક) દાટક ગ્રહણા ડિસ્સામાં દાટક ગ્રહણ પછી બદલાયેલું નામ દર્શાવતું મૂળ દાટક ગ્રહણ જત અથવા મેજિસ્ટ્રેટનું પ્રમાણપત્ર.

(દ) લગ્નની બાબતમાં, સાક્ષીઓ અને છોકરીએ જીતે સાખ કરેલ માતાપિતા અથવા વાતીની જાહેરાત.

(ઘ) અન્ય તમામ ડિસ્સાઓમાં માબાપ અથવા વાતીએ, મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ સોગંદનામું.

(ઝ) જાહેર પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીના ડિસ્સામાં, નામમાં ફેરફાર મંજૂર કરવામાં આવે તો, ગુજરાત સરકારી રાજ્યપત્રમાં તેના નામનો ફેરફાર જાહેર કરવા તેને ફરમાવવું જોઈશે.

(તેમ છતા, લગ્નને કારણે નામમાં થતો ફેરફાર રાજ્યપત્રમાં જાહેર કરવાનું જરૂરી નથી.)

(૨) અટકમાં ફેરફાર<sup>૧</sup>

(૩) પિતાના નામમાં ફેરફાર<sup>૨</sup>

(૪) જન્મ સ્થળમાં ફેરફાર<sup>૩</sup>

(૫) ધર્મ અને જાતિમાં ફેરફાર<sup>૪</sup>

ઉપરોક્ત (૨) થી (૫)માં જણાવેલા ફેરફાર કરવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે સમાજ કલ્યાણ અધિકારીનું, મામલતદારનું પ્રમાણપત્ર, મેજિસ્ટ્રેટ સમક્ષનું સોગંદનામું, રાજ્યપત્રમાં પ્રસિદ્ધ અંગેના પુરાવા રજુ કર્યેથી ફેરફાર કરવાની પરવાનગી આપી શકાશે.

(૬) વિદ્યાર્થીએ ખરેખર શાળા છોડી દીધા પછી, શાળા રેકર્ડમાંની નોંધોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહિ.

અલખત સાચી જન્મ તારીખના સમર્થન રૂપે કોઈપણ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી પુરાવો રજુ કરવાનો અને તેને ખાતરી થયે, તમામ હેતુઓ માટે સાચી જન્મ તારીખથી માન્ય સાખિતી તરીકે સ્વીકાર્ય હોય તેવી જન્મ તારીખના સંબંધમાં તેની પાસેથી પ્રમાણપત્ર મેળવવાનો જ ભાર્ગ રહે છે.

(૭) કાયદાથી સોગંદ લેવા અધિકૃત કર્યા હોય તેવા અવિકારીઓ અથવા વ્યક્તિઓ સમક્ષ, સોગંદનામું કરવું જોઈશે.

નોંધ : (૧) માનદ્દ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ, જસ્ટિસ ઓફ પીસ અને માનદ્દ મેજિસ્ટ્રેટ, સોગંદ લેવડાવી શકશે નહિ અથવા તેમની સમક્ષ સોગંદનામું જાહેર કરાવી શકશે નહિ. માત્ર વૈતનિક મેજિસ્ટ્રેટ, જે તેમ કરી શકશે.

(૨) સોગંદનામાં ઉપર ભારત સ્ટેમ્પ અધિનિયમની અનુસૂચિ ૧ના આર્ટિકલ ૪ હેઠળ સ્ટેમ્પ જુદી લેવાપાત્ર છે.

**વિદ્યાર્થીઓના પ્રવેશ વિનિયમ નં : ૧૨ (બ)** "કોઈપણ શાળાના વડા" કે સંચાલક મંડળ માતા/પિતા/વાલીઓ માટે દાન પાસેથી તેમના પાલ્ય માટે અથવા વિદ્યાર્થીઓ પાસેથી તેમના પ્રવેશ માટે રોકડ કે વસ્તુ રૂપે કોઈ દાન સ્વીકારશે નહિ કે તે માટે એમને ફરજ પાડશે નહિ સંચાલક મંડળ કે પ્રમુખ શિક્ષક (Head Master) શાળામાં પ્રવેશ આપવા માટે દાન સ્વીકારવા બદલ દીઘિત જણાશે તો પ્રસ્તુત શાળાની નોંધકૃતી રેખા પાત્ર થશે."

**કપઠથી પ્રવેશ વિનિયમ નં : ૧૩** કપઠથી પ્રવેશ મખ્યો હોય તો પ્રવેશ બિન અમલી ગણાશે : "કોઈ વિદ્યાર્થીને રજીસ્ટર થયેલી શાળામાં દાખલ કરવામાં આવે તે પછી એમ જણાયું હોય કે વિદ્યાર્થીએ અથવા તેના મા-બાપે અથવા વાલીએ ખોદું અથવા શાળા છોડી દીપાંતું બનાવટી પ્રમાણપત્ર રજુ કરીને અથવા ખોટી રજુઆત કરીને પ્રવેશ મેળવ્યો છે. અથવા ગંભીર પ્રકારનો શિક્ષણભંગ કર્યો હોય અથવા નૈતિક અંધકારના ગુના બદલ દીઘિત છરતો હોય ત્યારે રજીસ્ટર થયેલી શાળાના વડા, જે કંઈ કહેબું હોય તે કહી સંભળાવવાની તક આપ્યા પછી અને બોર્ડના અધિકારીની પૂર્વ મંજૂરીથી એવી રીતે મેળવેલો પ્રવેશ ગુના બદલ બિન અમલી જાહેર કરી શકાશે અને તદ્વારાનુસાર વિદ્યાર્થીને શાળામાંથી બરતરક કરી શાળા બોર્ડની સુચના મુજબ શાળા છોડવાના પ્રમાણપત્રના નમૂના-૮ માં દર્શાવેલ સમયગાળા સુધી દાખલ કરી શકશે નહિ."

**વિદ્યાર્થીઓની કસોરી** ૧૪. એક ધોરણમાંથી પછીના ઉપલા ધોરણમાં ચારવાનો નિર્ણય બોર્ડ દ્વારા તેવા નમૂનારૂપ નિયમોના ધોરણે કરવાં જોઈશે. ઉપલા ધોરણમાં ચારવાના અંગે શાળા નમૂનારૂપ નિયમો અનુસાર પોતાના નિયમો ધઢ્યો અને અધિકારી દ્વારા તે બોર્ડ પાસે<sup>૩</sup> મંજૂર કરાવશે.

**૧૮ વર્ષથી ઉપરના** ૧૪-ક. જે ઉમેદવાર ૧૮ વર્ષથી વધારે ઉમરનો હોય તેવા કોઈ ખાનગી ઉમેદવારને સંબંધિત ખાનગી ઉમેદવારને ધોરણ માટે દ્વારાની એક મહિનાની ફી ભર્યે, રજિસ્ટર થયેલી ઉચ્ચ શાળાના કોઈપણ ધોરણની શાળા પરીક્ષામાં બેસવાની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવી જોઈશે.

### કાર્યવાહી

**૮મા, ૯મા, ૧૦મા અને ૧૧મા ધોરણોની વાર્ષિક પરીક્ષાઓના વિષયો, નિયત દિવસની તરત જ પહેલાં સરકારે તત્ત્વમાન ધોરણો માટે દ્વારાની હોય તે જ વિષયો ડોવા જોઈશે.**

**વિષયો.** ૧૫. (૧) રજિસ્ટર થયેલી શાળામાં ૮મા, ૯મા અને ૧૦મા ધોરણોની વાર્ષિક પરીક્ષાઓના વિષયો, નિયત દિવસની તરત જ પહેલાં સરકારે તત્ત્વમાન ધોરણો માટે દ્વારાની હોય તે જ વિષયો ડોવા જોઈશે.

(૨) રજિસ્ટર થયેલી શાળાઓમાં ધોરણ ૧૦મા (એટલે કે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા) વગ માટેના વિષયો આ વિનિયમોના આરંભની તરત જ પહેલાં અમલમાં હોય તેવા ગુજરાત માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો, ૧૯૮૦ની પારિશીલ-કમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રહેશે.

**વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી** ૧૬. (૧) રજિસ્ટર થયેલી દરેક શાળા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ધ્યાન આપશે અને તેમના સ્વાસ્થ્ય વિષે ખ્યાલ રાખવા પ્રયત્ન કરશે. શાળા ખાસ કરીને નીચેની બાબતો પ્રત્યે ધ્યાન આપશે :

(ક) વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય.

(ખ) વિદ્યાર્થીઓની યોગ્ય બેક્ગ વ્યવસ્થા માટે વર્ગ ફર્નિચરની યોગ્યતા.

(ગ) શાળાના સમયપત્રકમાં જરૂરી આરામના ગાળાની જોગવાઈ.

(ઘ) બાળ રમતો સહિત શારીરિક શિક્ષણ.

(ચ) રસ્તા પર ચાલવાના અને તે ઓણગવાના અને તેના ઉપર વાહનો ચલાવવાના સંબંધમાં પ્રથમ સલામતી ઉપાયો અંગે શિક્ષણ.

- (૭) ચોખા પીવાના પાકી માટેની જોગવાઈ, અને  
 (૮) આનારોગ્યપદ અથવા નુકશાનકારક ખોરાક, પીંડાં, અથવા ખાવાની ચીજો, શાળાની જગ્યામાં વેચવાની મનાઈ.

(૨) રાજિસ્ટર થયેલી શાળામાં દરેક વિદ્યાર્થીની બે શૈક્ષણિક વર્ષમાં એક વખત તબીબી તપાસ હાથ ધરવી જોઈશે. :

પરંતુ આવી કોઈ તબીબી તપાસમાં કોઈ વિદ્યાર્થી તબીબી રીતે અધોગ્ય જણાયો હોય તો તેની શારીરિક યોગ્યતા માટે દર વર્ષ તેની તપાસ થવી જોઈશે :

વધુમાં જે વિદ્યાર્થી કોઈ શિક્ષકને શારીરિક રીતે નબળો અથવા ખામીવાળો જણાય તેની, તે દેતું માટે શાળાને નીમેલા ડેક્ટર મારફત તપાસ કરાવવી જોઈશે.

(૩) રાજિસ્ટર થયેલી શાળામાં, બધા વિદ્યાર્થીઓનાં શરીરનાં માપ (ઉંઘાઈ, વજન વગેરે) ખાસ કરીને વ્યાયામ શિક્ષકો દ્વારા લેવાવાં જોઈશે.

(૪) દરેક વિદ્યાર્થીનો, તબીબી તપાસનો અને શરીરના માપનો અહેવાલ નમૂના ૪ મુજબ રાખવામાં આવશે.

(૫) શરીરના માપની માહિતી અને તબીબી તપાસના અહેવાલ વિષે, વિદ્યાર્થીના પ્રગતિપત્રક મારફત વિદ્યાર્થીનાં માબાપ અથવા વાલીને ખબર આપવી જોઈશે અને માબાપ અથવા વાલી તેના ઉપર પોતાની સહી કરી ને શાળામાં પાછા મેડલશે. માબાપ અથવા વાલીને, જરૂર પડે ત્યારે વિદ્યાર્થીને યોગ્ય તબીબી સારવાર અપાવવાની સલાહ આપવી.

(૬) શિ. વિભાગ, ગાંધીનગરના ઠાકુર કમાંક : મધ્યાખ-૧૦૮૬-૧૨૮૩-૭.તા. ૧૪-૮-૫૭ થી કમી કરેલ છે.

૧૭. (૧) રાજિસ્ટર થયેલી શાળાઓ ઉધ્ઘવાની તારીખ એકસરખી રહે તે માટે બોર્ડ, રાજ્યમાં શાળાના સત્ર, બધી શાળાઓ માટે એક સરખી તારીખ નિયત કરશે અને શૈક્ષણિક વર્ષ શરૂ થયા તે પહેલાં, સમયસર રજીઓ અને તે માટે હુકમ કરશે.

(૨) રાજિસ્ટર થયેલી શાળામાં વેકેશનોના દિવસો સહિત રજીના દિવસોની વધુમાં વધુ સંચા

કોઈપણ સંઝોગ્યોમાં રવિવાર અને અર્ધી રજીના દિવસો બાદ કરતા ૮૦ દિવસ કરતાં વધવી જોઈશે નહિએ :

પરંતુ રાજિસ્ટર થયેલી શાળાએ શૈક્ષણિક વર્ષમાં ૨૪૦ દિવસ કરતાં ઓછા ન હોય તેટલા દિવસ સુધી શિક્ષક આપણું જોઈશે, જેમાંથી ૧૮૦ દિવસ કરતાં ઓછા ન હોય તેટલા દિવસો આખા દિવસો રહેશે.

વધુમાં શાળા ૮૦ દિવસ ઉપરાંત સરકારે વખતોવખત જીહેર કરેલ અસાધારણ જીહેર રજી પણ પાળશે.

(૩) રાજિસ્ટર થયેલી શાળા, રાજ્ય સરકાર તરફથી જીહેર થયેલા જીહેર રજીના દિવસો, તેની રજીના દિવસોમાં સમાવિષ્ટ કરશે. ૧

(૪) રાજિસ્ટર થયેલી શાળા સામાન્ય રીતે છ કલાક ચાલશે અને લાંબી અને ઢૂંઢી રીસેસની યોગ્ય જોગવાઈ કરીને, અઠવાડિયામાં પાંચ દિવસ સુધી દરરોજ આશરે પાંચ કલાક શિક્ષણ અપારો

૧ નિયમ ૧૭ (૩) શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠાકુર કમાંક : મધ્યાખ-૧૦૮૬-૧૨૮૩-૭ તા. ૧૪-૮-૫૭ અન્વયે સુધીરો

અને અઠવાડિયામાં એક દિવસ, આવી શાળા રીસેસની યોગ્ય જોગવાઈ કરીને બે થી નજી કલાક ચાલશે, પણ તે એવી રીતે કે અઠવાડિયામાં બધું મળીને સત્તાવીશ કલાક સુધી શિક્ષણ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓનાં  
શિક્ષણ

૧૮. રજિસ્ટર થયેલી શાળાના વડામે ખાતરી કરવી જોઈશે કે -

- (ક) શિક્ષણા સિદ્ધાંતો બરાબર પાળવવામાં આવે છે.
- (ખ) નિયમિતતા અને સંપૂર્ણ આજ્ઞાપાલન જીળવવામાં આવે છે; અને
- (ગ) સત્ત્યતા, વિવેકી ભાષા અને વર્તન તેમજ પોષાકની અને શારીરિકે સ્વસ્થતા જળવાય છે.

#### પ્રકરણ - ૬

રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના સ્ટાફની ભરતી અને નોકરીની શરતો

હેડ માસ્ટરો,  
શિક્ષકો  
અને બિન-  
અધ્યાપકીય  
સ્ટાફની ભરતી

૧૯. (૧) દરેક રજિસ્ટર થયેલી શાળામાં, તે શાળામાં શિખવવામાં આવતા વિષયના પ્રકારના સંબંધમાં, કેવા પ્રકારના શિક્ષકોની જરૂરિયાત રહેશે એ બાબત લક્ષ્યમાં રાખીને, શિક્ષકોની જે સંખ્યા શાળાના વર્ગોની સંખ્યા સાથે ઓછામાં ઓછા ૧.૩ થી ૧.૫નું જે પ્રમાણ ધરાવતી હોય તે જ પ્રમાણ ધરાવતી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

(૨) રજિસ્ટર થયેલી શાળાઓમાં ભરતી કરવાના કારણની સ્ટાફનું સંખ્યા બળ નીચે મુજબ રહેશે -

અ.નં.	શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા	જગ્યાઓની સંખ્યા	
(૧)	૦ થી ૨૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	એક જૂનિયર કલાર્ક	કુલ ૧
(૨)	૨૦૧ થી ૪૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	એક જૂનિયર કલાર્ક એક સીનિયર કલાર્ક	કુલ ૨
(૩)	૪૦૧ થી ૬૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	એક જૂનિયર કલાર્ક એક સીનિયર કલાર્ક એક હેડ કલાર્ક	કુલ ૩
(૪)	૬૦૧ થી ૮૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	એક જૂનિયર કલાર્ક એક સીનિયર કલાર્ક એક હેડ કલાર્ક એક ઓફિસ સુપ્રિન્ટેન્ડર	કુલ ૪
(૫)	૮૦૧ થી ૧૦૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	બે જૂનિયર કલાર્ક એક સીનિયર કલાર્ક એક હેડ કલાર્ક એક ઓફિસ સુપ્રિન્ટેન્ડર	કુલ ૫
(૬)	૧૦૦૧ થી ૧૨૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	બે જૂનિયર કલાર્ક બે સીનિયર કલાર્ક એક હેડ કલાર્ક એક ઓફિસ સુપ્રિન્ટેન્ડર	કુલ ૬

(૭) ૧૨૦૧ થી ૧૪૦૦ સુધીની વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા માટે	ત્રણ જૂનિયર કલાર્ક બે સીનિયર કલાર્ક એક હેડ કલાર્ક એક ઓફિસ સુપ્રિન્ટેન્ટ
---	--

કુલ ૭

(૮) ૧૪૦૧થી દર ૨૦૦ વિદ્યાર્થી દીક કે તેના ભાગદીક	એક વધારાનો સીનિયર કલાર્ક
---	-----------------------------

(૩) રજિસ્ટર થયેલી શાળામાં પૂરા સમયના પટાવાળાઓનું અને ભરતી કરવાના નોકરોનું સંખ્યાબળ નીચે પ્રમાણે રહેશે। —

અ.નં.	શાળાના વિદ્યાર્થીની સંખ્યા	મળવાપાત્ર પટાવાળા
૧	૧ થી ૧૦૦ સુધી	૧ પટાવાળા
૨	૧૦૧ થી ૨૦૦ સુધી	૨ પટાવાળા
૩	૨૦૧ થી ૪૦૦ સુધી	૩ પટાવાળા
૪	૪૦૧ થી ૭૫૦ સુધી	૪ પટાવાળા
૫.	૭૫૧ થી ૧૦૦૦ સુધી	૫ પટાવાળા
૬.	૧૦૦૧ થી ૧૫૦૦ સુધી	૬ પટાવાળા
૭.	૧૫૦૧ થી વધુ	૭ પટાવાળા

૧૫૦૧ કરતાં વિદ્યાર્થી સંખ્યા વધે ત્યારે ૨૦૦ વિદ્યાર્થી દીક ૧ (એક) પટાવાળાની વધારાની જગ્યા મંજૂર કરવાની રહેશે.

(૪) શિક્ષણ વિભાગ ગાંધીનગરના છરાવ ક્રમાંક : મશબ-૨૦૦૦-૧૮૨૮-૪, તા. ૧૧-૭-૨૦૦૦થી કંઈ કરેલ છે.

(૫) દસ કરતાં વધારે વર્ગોવાળી રજિસ્ટર થયેલી શાળાના સંચાલકો, અધિકારીની મંજૂરીથી ઉપરીના છાથ નીચે સુપરવાઈઝરો નીભી શકશે :

(૧) ૧૦ અથવા ૧૦ કરતાં ઓછા વર્ગોવાળી શાળામાં સુપરવાઈઝરની જરૂર નથી.

(૨) ૧૧ થી ૨૦ વર્ગ સુધી એક સુપરવાઈઝરની જગ્યા મળવાપાત્ર થશે.<sup>૨</sup>

(૩) ૨૧ થી વધુ વર્ગો માટે બીજા સુપરવાઈઝરની જગ્યા મળવાપાત્ર થશે. કોઈ પજ સંજ્ઞેગોમાં શાળામાં બે થી વધુ સુપરવાઈઝરની જગ્યા મળવાપાત્ર થશે નહિ.<sup>૩</sup>

(૬) અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવામાં ન આવે તો કોઈ રજિસ્ટર થયેલી શાળ માં હંગામી ઘોરણે દેખાસ્તર અને શિક્ષકોની નિભષૂક<sup>૪</sup> કરવી જોઈશે નહિ.

૧ - શિક્ષણ વિભાગ ગાંધીનગરના છરાવ ક્રમાંક : ક્રમાંક-૧૦૭૮-૧૦૮૫-૫, તા. ૨૭-૨-૮૦ અન્વયે

૨, ૩, ૪ - શિક્ષણ વિભાગ છરાવ ક્રમાંક : મશબ-૧૦૮૬-૧૨૮૩-૪ તા. ૧૪-૮-૮૭ અન્વયે

**સ્પષ્ટીકરણ :** હંગામી ધોરણે એટલે રજી અથવા રજુનામાને લીધે અથવા અન્ય કોઈ કારણસર ખાલી પડેલી હંગામી જગ્ગામાં શૈક્ષણિક વર્ષ કરતાં વધારે ન હોય તેટલી નિયત મુદ્દત માટે —

પરંતુ —

(૧) આ વિનિયમોના આરંભની તરત જ પહેલાં રજિસ્ટર થયેલી શાળામાં તાલીમ ન લીધેલા શિક્ષક હોય ત્યારે આવી શાળાના સંચાલકોએ તે શાળામાં તે શિક્ષક જે વિષય શિખવતો હોય તેમાં તેને શિખવવામાં મદદરૂપ થાય તે અભ્યાસક્રમમાં તાલીમ દેવા માટે તેને મોકલવો જોઈશે અને જો આવો શિક્ષક તે હેતુ માટે પાંચ વર્ષ કરતાં ઓછી ન હોય તેટલી મુદ્દત સુધી રજ્યાની કોઈ રજિસ્ટર થયેલી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાની બાંધદરી આપે તો તેને મળવાપાત્ર હોય તેવી રજી મંજૂર કરવી જોઈશે.

(૨) ખંડ (૧) હેઠળ આવા શિક્ષકને વગર પગારની રજી મંજૂર કરવામાં આવે, ત્યારે આવી રજીને વગર પગારની રજી તરીકે ગજીવી અને તે લાયકી સેવા માટે ગજાશે નહિ.

**સ્પષ્ટીકરણ :** આ પરંતુકુમાં “તાલીમ ન પાખેલા શિક્ષક” એટલે વિનિયમ ૨૦ના પથાપ્રસંગ ખંડ (૧), (૨), (૩), (૪), (૫), (૬), (૭) અથવા (૮)માં જણાવેલી જરૂરી લાયકાતો પરાવત્તા ન હોય તે શિક્ષક.

રજિસ્ટર થયેલી  
શાળામાં  
હેડમાસ્ટરનો,  
શિક્ષકો અને  
બિનઅધ્યાપકીય  
સ્ટાફના સભ્યોની  
લાયકાતો

૨૦. (૧) કોઈ વ્યક્તિ તાલીમ લીધેલો સ્નાતક (બી.ટી. અથવા બી.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ) હોય અને તાલીમ પછીનો પાંચ વર્ષનો શિખવવાને નિરીક્ષણનો અનુભવ હોય, જેમાં માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાનો શિખવવાને નિરીક્ષણનો ઓછામાં ઓછો ગ્રાન્ડ વર્ષનો અનુભવ હોય.

#### અથવા

સ્નાતક અને એસ.ટી.સી., ટી.ડી./એચ.એસ.એસ.' લાયકાત પછીના ૧૦ વર્ષનો માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાનો શૈક્ષણિક અનુભવ પરંતુ કુલ ૧૫ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય.

તે સિવાય તેને હેડમાસ્ટર તરીકે નીમી શકાશે નહીં.

પરંતુ માત્ર છોકરીઓની શાળામાં, ઉપરોક્ત લાયકાતો પરાવતી સ્ત્રી સિવાય બીજી કોઈ વ્યક્તિની ઉપરી અથવા બીજી ઉપરી તરીકે નિમણૂક કરી શકાશે નહીં.

(૨) સુપ્રવાઈઝર તરીકે નીમાવા માટેની લાયકાતો ખંડ (૧)માં હેડમાસ્ટર માટે હરાવેલી લાયકાતો જેવી રહેશે.

(૩) કોઈ વ્યક્તિને —

(ક) તેણે અધાર વર્ષની ઉમર પ્રાપ્ત કરી હોય, અને

(ખ) (૧) તે કાયદાથી સ્વપાયેલી ભારતમાંની કોઈ યુનિવર્સિટીની કોઈ વિદ્યાશાખામાં પદવી પરાવતી હોય, અથવા

- (૨) બી.ટી.ની પદવી અથવા બી. એડ.ની પદવી અથવા બોર્ડ માન્ય કરેલી કોઈ પદવી અથવા તેને સમકક્ષ પદવી ધરાવતી હોય, અથવા
- (૩) સ્નાતકોની પાયાની તાલીમકેન્દ્રો તરફથી અપાતો શિક્ષણનો ડિપ્લોમા, અથવા
- (૪) રાજ્ય સરકારે અથવા આંતર યુનિવર્સિટી બોર્ડ પેરેગ્રાફ (૨)થી(૩)માં જરૂરવેલી કોઈ લાયકાતને સમકક્ષ તરીકે મંજૂર કરેલી બીજી કોઈ પદવી, ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર ધરાવતી હોય તે સિવાય, શિક્ષક તરીકે નીભી શકાશે નહિ.
- (૫) કોઈ વ્યક્તિને –
- (ક) તેણે અધાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય, અને
- (ખ) (૧) કાયદાથી સ્થપાયેલી ભારતમાંની કોઈ યુનિવર્સિટીની લાલિત કલાની પદવી તે ધરાવતી હોય, અથવા
- (૨) ડ્રોઇંગ ટીચર અથવા ડ્રોઇંગ માસ્ટરનો ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર તે ધરાવતી હોય,
- (૩) આઈ માસ્ટરનું પ્રમાણપત્ર તે ધરાવતી હોય,
- તે સિવાય, ડ્રોઇંગ શિક્ષક તરીકે નીભી શકાશે નહિ.
- (૬) કોઈ વ્યક્તિને –
- (ક) તેણે અધાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય, અને
- (ખ) (૧) માધ્યમિક શાળા પ્રમાણપત્ર તે ધરાવતી હોય, અને
- (૨) મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ અથવા યથાપ્રસંગ, સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા, અથવા
- (૩) શિલ્પાઈકામનો અથવા યથાપ્રસંગ, ભરતકામનો અથવા એ બંનેનો ડિપ્લોમા અથવા જુદા જુદા હુન્નરોના અભ્યાસકર્મોમાં ડિપ્લોમા ધરાવતી હોય,
- તે સિવાય, હુન્નરઉંઘોગ શિક્ષક તરીકે નીભી શકાશે નહિ.
- (૭) કોઈ વ્યક્તિને –
- (ક) તેણે અધાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય, અને
- (ખ) શિક્ષક તરીકે નિમાવા માટે ખંડ (૩)માં ઠરાવેલી લાયકાતો અથવા ઉપર્યુક્ત લાયકાતોને સમકક્ષ તરીકે રાજ્ય સરકારે અથવા આંતર યુનિવર્સિટી બોર્ડ માન્ય કરી હોય તેવી લાયકાતો ધરાવતી હોય તે સિવાય ભાષા (અરેબિક, હિન્દી, પર્શિયન, સંસ્કૃત વગેરે) શિક્ષક તરીકે નીભી શકાશે નહિ.
- (૮) કોઈ વ્યક્તિને –
- (ક) તેણે અધાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય, અને
- (ખ) તે સંગીત વિશારદ હોય તે સિવાય સંગીત શિક્ષક તરીકે નીભી શકાશે નહિ.

## (c) કોઈ વક્તિને-

- (ક) તેણે અધાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છોય, અને  
 (ખ) (૧) મેટ્રિક્યુલેટ અથવા એસ.એસ.સી. પરીક્ષા વ્યાપામ શિક્ષણમાં એક વર્ષના પ્રમાણપત્ર અભ્યાસક્રમ સાથે પાસ કરી છોય, અથવા

(૨) કાયદાથી સ્થપાયેલી ભારતમાંની કોઈ પણ યુનિવર્સિટીની શારીરિક શિક્ષણની પદવી અથવા કાયદાથી સ્થપાયેલ ભારતની કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાશાખામાં પદવી અને વ્યાપામ શિક્ષણની ડિપ્લોમા અથવા બોર્ડ માન્ય કરેલ તેને સમકક્ષ ડિપ્લોમા પરાવતી છોય, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એકટ હેઠળ જીહેર થયેલ ડીપ્ટ દુંબી— યુનિવર્સિટીની શારીરિક શિક્ષણની પદવી પરાવતી છોય.<sup>૧</sup>

તે સિવાય, વ્યાપામ શિક્ષક તરીકે નીમી શકાશે નહિ.

## (૮) કોઈ વક્તિને-

- (ક) તેણે અધાર વર્ષની ઉપર પ્રાપ્ત કરી છોય, અને  
 (ખ) એક વિષય તરીકે ગણિત સાથે મેટ્રિક્યુલેટ અથવા એસ.એસ.સી. પ્રમાણપત્ર પરાવતી છોય.  
 તે સિવાય કારકુની સ્ટાફના સભ્ય તરીકે નીમી શકાશે નહિ.

(ગ) બિનસરકારી માધ્યમિક શાળામાં કામ કરતા અને જરૂરી રીકાંશિક લાયકાત પરાવતા પટાવાળાઓને બઢતીની તકો મળી રહે માટે જૂનિયર કારકુનની જગ્ગા સીધી ભરતીથી નહી ભરતાં જે શાળામાં વર્ગ-૪ના (પટાવાળા) કોઈ કર્મચારી બિનસરકારી માધ્યમિક શાળામાં કારકુન થવાની રીકાંશિક લાયકાત પરાવતા છોય અને પટાવાળા તરીકે ઓછામાં ઓછી તરફ વર્ષની સર્વંગ નોકરી છોય તેવા પટાવાળાઓને જૂનિયર કલાર્ક તરીકે બઢતી આપીને ભરવી. શાળામાં જે આવા જરૂરી લાયકાત પરાવતા કર્મચારીઓ (પટાવાળા) ઉપલબ્ધ ન છોય તો જૂનિયર કલાર્કની જગ્ગા સીધી ભરતીથી ભરવી.<sup>૨</sup>

## (૧૦) કોઈ વક્તિને -

- (ક) તેણે ૧૮ વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છોય અને

- (ખ) તેણે ધોરણ - ૪ પાસ કરેલ છોય તે સિવાય તેને પટાવાળા તરીકે નીમી શકાશે નહિ.<sup>૩</sup>

## તથીબી તપાસ

૨૧. ડેડમાસ્ટર, શિક્ષક અથવા બિન-અધ્યાપકીય સ્ટાફના કોઈ સભ્ય તરીકે દરેક વક્તિની નિમણૂક તેની તથીબી તપાસ થાય અને એવી નિમણૂકની તારીખથી તરફ મહિનાની મુદતની અંદર આ અર્થે બોર્ડ નિર્દિષ્ટ કરેલા તથીબી વ્યવસાયીઓ પાસેથી એમ જરૂરાવતું પ્રમાણપત્ર મેળવે કે તે વક્તિ શારીરિક ધોરણી અનુભૂતિ હોય તે એ કોઈ ચેથી રોગથી મુક્ત છે તો જ ચાલુ રહેશે.

## પ્રોબેશન

૨૨. કોઈ વક્તિની ડેડમાસ્ટર, શિક્ષક અથવા બિન-અધ્યાપકીય સ્ટાફના સભ્ય તરીકે ઉંગામી ધોરણ સિવાય બીજી રીતે નિમણૂક કરવામાં આવે ત્યારે, સંચાલકી નિર્ધિય કરે તે મુજબ તે બે વર્ષ કરતાં વધારે ન હોય તેટલી મુદત સુધી પ્રોબેશન ઉપર રહેશે અને સદરદંડ મુદતમાં સંતોષકારક નોકરી પૂરી થયે તે વક્તિ, કાયદી કર્મચારી ગણાશે.

## સર્વિસ બુક

૨૩. (૧) રાજીસ્ટર થયેલી શાળાના દરેક કર્મચારી માટે શાળાના સંચાલકોએ તેની નિમણૂકથી તરફ મહિનાની અંદર, નમૂના પમાં સર્વિસ બુક શરૂ કરવી જોઈશે અને સંચાલકોએ તે ચાલુ રાખવી જોઈશે.

૧ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : મશબ-૧૦૮૮-૧૪૫૦-૪, તા. ૧૪-૫-૧૯૮૮ અન્વયે

૨ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : મશબ-૧૩૮૩-૨૮૮૬-૮૧-૧, તા. ૧૯-૧૨-૧૯૮૯ અન્વયે

૩ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : મશબ-૧૦૮૭-૨૮૮૫-૮૧-૪, તા. ૦૭-૦૭-૧૯૮૮ અન્વયે

(૨) રજિસ્ટર થયેલી શાળાના સંચાલકોએ મૂળ રેકર્ડો અથવા પથાપ્રસંગ, પ્રમાણપત્રો સાથે સર્વિસ બુકની નોંધોની ખરાઈ કરવી જોઈશો અને સંચાલકોએ ખરાઈ કર્યાના મતીકરૂપે બુકમાં વિશેષ નોંધ લખવી કે નોંધો મૂળ રેકર્ડો અને પ્રમાણપત્રો અનુસાર છે.

૨૪. અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફનાં પગાર ધોરણ રાજ્ય સરકાર વખતોવખત ઠરાવે પગારધોરણ તેવાં રહેશે.

૨૫. (૧) ખંડો (૨) અને (૩)ને આધીન રહીને, રજિસ્ટર થયેલી શાળાનો બિનઅધ્યાપકીય વેકેશન પગાર સ્ટાફના સત્ય સિવાયનો દરેક કર્મચારી વેકેશન અને વેકેશન પગાર માટે હક્કાર રહેશે.

(૨) રજી, તેચુટેશન જેવી તદ્દન હંગામી ખાલી જગ્યા અથવા નિર્દિષ્ટ મુદ્દત માટે ઊભી કરેલી હંગામી જગ્યા નહિ પરાવતા જે હંગામી કર્મચારીએ રજિસ્ટર થયેલી શાળામાં પહેલા સત્રમાં ત્રણ મહિના સુધી કામ કર્યું હોય અને બીજી સત્રમાં ચાર મહિના સુધી કામ કર્યું હોય અને જેની નોકરી સંચાલકોએ સમાપ્ત કરી હોય તે હંગામી કર્મચારી ઓક્ટોબર અથવા, પથાપ્રસંગ, ડિસેમ્બર મહિનાના પગાર માટે અને વળી ઉત્તાળાના વેકેશન માટે હક્કાર રહેશે.

(૩) (ક) (૧) વળતર (Compensation) આપવામાં આવ્યું હોય તેવો કાયમી કર્મચારી વેકેશનની મુદ્દત માટે પગારને માટે હક્કાર ગણાશે નહીં.

(૨) પુનઃ નોકરીમાં રખાયેલ (Re-employed) વ્યક્તિ, તેને આપવામાં આવેલ પુનઃ નોકરીની મુદ્દત પૂરી થયા પછીના વેકેશનની મુદ્દત માટે પગાર માટે હક્કાર ગણાશે નહિ."

(૩) વધ નિવૃત્તિની ઉભર બાદ નિવૃત્ત થનાર કાયમી કર્મચારી પ્રથમ સત્રમાં, ૩૧ ઓક્ટોબર સુધી અને બીજી સત્રમાં ૩૧મે સુધી પગારને માટે હક્કાર ગણાશે.

(૫) મહેકમમાં ઘટાડો થવાને કારણે જે કાયમી કર્મચારીની નોકરી સમાપ્ત કરવામાં આવે તે કાયમી કર્મચારી, વેકેશનની મુદ્દત માટે પગાર મેળવવા હક્કાર રહેશે.

૨૬. (૧) સરકારી ખદદ મેળવતી રજિસ્ટર થયેલી શાળા (જેનો આ વિનિયમમાં "સહાયિત શાળા" પેન્શન અને તરીકે ઉત્સેન કર્યો છે તે)ના જે કર્મચારીને ૧લી એપ્રિલ, ૧૯૬૮ પહેલાં નીમવામાં આવ્યો હોય પ્રોવિંઝન ફંડ અને જેણે પેન્શનની યોજના માટે તેનો વિકલ્પ દેખિત વાપર્યો હોય તે દરેક કર્મચારી શાળામાં ૧લી અને આવી એપ્રિલ, ૧૯૬૮ના રોજ અથવા તે પછી નિમાયેલા દરેક કર્મચારી રાજ્ય સરકારે ઠરાવેલા નિયમો પ્રમાણે પેન્શન મેળવવાપાત્ર થશે.

(૨) જે ૧લી એપ્રિલ, ૧૯૬૮ પહેલાં નિમાયેલા હોય અને વર્ષિત પ્રોવિંઝન ફંડ માટે વિકલ્પ વાપર્યો હોય તેવા સહાયિત શાળાના કર્મચારીએ તે ફરમાં રાજ્ય સરકારે તે અર્થે ઠરાવેલા નિયમો પ્રમાણે પૈસા ભરવા જોઈશે.

(૩) સહાયિત શાળા સિવાયની રજિસ્ટર થયેલી શાળાના સંચાલકો, બોર્ડ મંજૂર કરે તે પ્રમાણોની પોતાની વર્ષિત પ્રોવિંઝન ફંડ યોજના ચાલુ રાખશે.

(૪) આ વિનિયમમાંનો કોઈ મજાકુર, રજિસ્ટર થયેલી શાળાના અંશકાલિક કર્મચારીઓને લાગુ પડશે નહિ.

રજિસ્ટર થયેલી

ખાનગી શાળાના

સહિત શાળાની અભ્યાસેતર અને સંસ્થાપિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું અને તે અંગેનું કામ કરવા ફરમાવી

હેડમાસ્ટરો શિક્ષકો શકશે.

અને

બિનઅધ્યાપકીય

સ્ટાફના સભ્યોનું

વર્તન તથા શિક્ષણ

૨૭. (૧) રજિસ્ટર થયેલી શાળાના હેડ માસ્ટર અને શિક્ષકને, શાળાના સંચાલકો સમાજ શિક્ષણ અધ્યાપકીય સ્ટાફના કોઈ સત્ત્યને રજીઓ દરમિયાન અથવા અઠવાડિક દિવસોમાં શાળાના સમય પછી શાળાના કામના સંબંધમાં કોઈ કામ કરવાની ફરજ પાડી શકશે.

(૨) જરૂર પડે ત્યારે હેડમાસ્ટર, અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફના કોઈ સત્ત્યને રજીઓ દરમિયાન અથવા અઠવાડિક દિવસોમાં શાળાના સમય પછી શાળાના કામના સંબંધમાં કોઈ કામ કરવાની ફરજ પાડી શકશે.

(૩) રજિસ્ટર થયેલી શાળાના કર્મચારી રાજકીય બેઠકોમાં હજૂર રહી શકશે અને રાજ્ય સરકારે જેને ગેરકાયદેસર જીહેર કર્યો હોય તેવા પક્ષ સિવાયના કોઈ રાજકીય પક્ષના સભ્યો વથી શકશે અથવા તેની પ્રવૃત્તિઓમાં સહિત્ય ભાગ લઈ શકશે.

(૪) રજિસ્ટર થયેલી શાળાના કર્મચારીને ફરજ ઉપર અથવા શાળાની જગ્ગામાં હોય ત્યારે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં જોડાનું જોઈશે નહિ.

(૪) (ક) રજિસ્ટર થયેલી કોઈ પક્ષ માધ્યમિક શાળાનો કોઈ પક્ષ કર્મચારી બોર્ડ દ્વારા લેવાતી જીહેર પરીક્ષામાં ગેરરીતિ આચરતાં કે આચરવામાં મદદ કરતાં બોર્ડ દ્વારા દોષિત ઠિંક્યી બરતરફ સુધીની શિક્ષણ થવાને પાત્ર ઠરશે.<sup>1</sup>

(૫) (ક) અધ્યાપકીય અથવા બિન-અધ્યાપકીય સ્ટાફનો કોઈ સત્ત્ય જે એસોસિયેશનના ઉદ્દેશો અથવા પ્રવૃત્તિઓ ભારતની સાર્વલૌભાગીયતા અને એકત્તાના હિતોને અથવા જીહેર વ્યવસ્થા અથવા નીતિમત્તાને બાધ આવે તેવા હોય તે એસોસિયેશનના સત્ત્ય તરીકે તેમાં જોડાઈ શકશે નહિ અથવા તેના સત્ત્ય તરીકે ચાલુ રહી શકશે નહિ.

(ખ) અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફના કોઈ સત્ત્યથી-

(૧) તેના શૈક્ષણિક પાઠ દ્વારા અથવા બીજી રીતે જ્ઞાતિ સંબંધી અથવા સાંપ્રદાયિક મંતવ્યનો પ્રચાર કરી શકશે નહિ અથવા કોઈ વિદ્યાર્થીને જ્ઞાતિ સંબંધી અથવા સાંપ્રદાયિક પ્રવૃત્તિમાં છૂટથી ભાગ લેવા ઉકેરી શકશે નહિ અથવા ભાગ લેવા દઈ શકશે નહિ.

(૨) જ્ઞાતિ, પંથ, ભાષા, જન્મસ્થાન, સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકાને કારણે અથવા તે પૈકી કોઈ કારણસર કોઈ વિદ્યાર્થી સામે લેદાબાબ રાખી શકશે નહિ.

(૩) જ્ઞાતિવાદ, કોમવાદ અથવા અસ્પૃષ્યતા આચરી શકશે નહિ અથવા કોઈ વિદ્યાર્થીને તે આચરવા માટે ઉકેરી શકશે નહિ.

(૪) કોઈ હેડમાસ્ટર અને અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફના કોઈ સત્ત્યથી, પોતાની નોકરીની શરતોને લગતી કોઈ બાબત સંબંધમાં, કોઈ પક્ષ પ્રકારની હડતાળનો આશરો લઈ શકશે નહિ.

(૫) (ક) "કોઈ કર્મચારી, બોર્ડ દ્વારા લેવાતી જીહેર પરીક્ષા સંબંધમાં તેને સોંપવામાં આવે તેવી કોઈ કામગીરી સ્વીકારવાની ના પાડી શકશે નહિ. આમ છતાં, બોર્ડ કર્મચારીને વાજબી કારણોસર ખાસ સંજોગોમાં મુક્તિ આપી શકશે."

(૬) (ક) હેડમાસ્ટર અને અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફનો સત્ત્ય પોતે પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે કોઈ વેપાર કે ધંધામાં રોકાઈ શકશે નહિ અથવા કોઈ બીજું કામ હાથ પરી શકશે નહિ પરંતુ સામાજિક કે ધર્માદા પ્રકારનું અવેતન કામ અથવા સાહિત્ય વિષયક, કલાત્મક, અથવા વૈજ્ઞાનિક પ્રકારનું માસંગિક કામ તેની ફરજોને તેનાથી અસર પહોંચે નહિ તે રીતે કરી શકશે.

૧. — શિક્ષણ વિભાગ, ગાંધીનગરના હરાવકમાંક - બમશ - ૧૦૮૭ - ૪૨૪૪ - (૮૮) ગ, તા. ૧૭-૨-૮૮ અન્વયે આગેજ કર્યું.

**સ્પર્ધીકરણ—** હેડમાસ્તર અથવા અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફના કોઈ સત્ય તેની પત્ની અથવા તેના કુટુંબના બીજી સત્યની માલિકીની અથવા તેમના દારા વહીવટ થતો હોય તે વીમાની એજન્સી અથવા કમિશન એજન્સી વગેરેના કામકાજના સમર્થનમાં પ્રચાર કરે તો તે આ નિયમોનો ભંગ થયો છે એમ ગજાશે.

(ખ) હેડમાસ્તર તેમજ અધ્યાપકીય અથવા બિન-અધ્યાપકીય સ્ટાફના સત્યના કુટુંબનો કોઈ સત્ય કોઈ વેપારમાં અથવા ધંધામાં રોકાયો હોય અથવા વીમાની એજન્સી અથવા કમિશન એજન્સીની માલિકી ધરાવે અથવા વ્યવસ્થા કરે તો તેણે અધિકારી મારકત બોર્ડને જાણ કરવી જોઈશે.

**સ્પર્ધીકરણ—** આવા વિનિયમ ૭ (ક)ના હેતુ માટે, “કુટુંબ”માં પતિ, પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થશે.

(ગ) હેડમાસ્તર તેમજ અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફનો કોઈ સત્ય, કોઈ બેન્ક અથવા કંપની અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ના ૧૬ા)ના અથવા જે તે સમયે અમલમાં હોય તેવા બીજી કોઈ કાયદા હેઠળ રજિસ્ટર કરવાનું આવશ્યક હોય તેવી બીજી કંપનીના અથવા વાણિજ્યિક હેતુ માટેની કોઈ સહકારી મંડળીઓના રજિસ્ટ્રેશન, ઉત્કર્ષ અથવા સંચાલનમાં અધિકારીની પૂર્વમજૂરી લીધા વગર ભાગ લઈ શકશે નહિ. પરંતુ સ્ટાફનો સત્ય સહકારી મંડળી અધિનિયમ, ૧૯૧૨ (સન ૧૯૧૨ના ૨૪ા) અથવા જે તે સમયે અમલમાં હોય તેવા બીજી કોઈ કાયદા હેઠળ મહિદાંશે સ્ટાફના સત્યોના લાભાર્થી રજિસ્ટર થયેલ સહકારી મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૨૧મા) અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ તત્સ્વાની કાયદા હેઠળ રજિસ્ટર થયેલી સાહિત્યિક, વૈજ્ઞાનિક અથવા ધર્માદી મંડળીના રજિસ્ટ્રેશન, ઉત્કર્ષ અથવા સંચાલનમાં ભાગ લઈ શકશે.

(ઘ) કોઈ પૂર્ણકાલીન કર્મચારી કોઈ પણ સ્થળે કોઈ પ્રકારની કોઈ બીજી લાભદારી નોકરી સ્વીકારી શકશે નહિ.

પરંતુ સંચાલકો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની માન્ય દોસ્ટેલમાં, દોસ્ટેલ સુપરિન્ડેન્ટ તરીકે કામ કરવાની શિક્ષકને છૂટ આપી શકશે અથવા ચિત્રકામ, વાયામ, સંગીત વગેરે જેવા વિષમોના શિક્ષકોને, સંચાલક તાલીમ કોલેજ અથવા કોઈ પણ માન્ય સંસ્થામાં અંશકાલીન શિક્ષક તરીકે કામ કરવા દઈ શકશે. આવા કેસોમાં અઠવાડિયામાં ત્રણ કલાકથી વધુ સમય માટે આ સંસ્થાઓ કામ કરવા દેશે નહિ.

(ઝ) (\*\*\* શિક્ષણ અને ભજૂર વિભાગના તા. ૨૧-૬-૭૬ના સરકારી હરાબ કામાં ગેસેરિઆર ૧૦૭૪૭-૫૭૪૫-૪ થી કમી કરેલ છે.)

(ઝ) હેડમાસ્તર તેમજ અધ્યાપકીય અથવા બિન-અધ્યાપકીય સ્ટાફનો સત્ય પોતાની નોકરીને લગતી બાબતોના સંબંધમાં પોતાના ડિલ આગળ ધ્યાવવામાં કોઈ રાજકીય અથવા બાધારની લાગવગ લાવી શકશે નહિ અથવા લાવવાની કોશિશ કરી શકશે નહિ.

(ઝ) હેડમાસ્તર અથવા અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફનો કોઈ સત્ય—

(૧) જે તેને નેતૃત્વ અધ્યપત્રનવાળા ગુના બદલ દોષિત હરાવવામાં આવ્યો હોય તો;

(૨) તે વિદ્યાર્થીઓના વાલી, તેના ઉપરી અધિકારીઓએ અને તપાસણી અધિકારીઓ પ્રત્યે એવા હેડમાસ્તર અથવા સત્યને કોઈ પણ રીતે ન છાજે એવું ગંભીર વર્તન દાખલે તો;

(૩) વિભાગ તરફથી મોકલાવેલા કોઈ હુકમનું પાલન કરવાની તે ના પાડે અથવા આ વિનિયમો પૈકી કોઈ વિનિયમોનું ઉલ્લંઘન કરે તો;

(૪) પૂરતા કારણો વગર અભ્યાસક્રમ કરવાનું તેને ફરમાવ્યા પછી વાજબી સમયની અંદર તે કરવાની ના પાડે તો બરતરફ થવાનેપાત્ર ઠરશે.

(૫) હેડમાસ્તર અથવા અધ્યાયકીય અથવા બિન-અધ્યાયકીય સ્ટાફના કોઈ સભ્યને સુનાવણીની વાજબી તક આપ્યા પછી સંચાલકો એવો અભિપ્રાય પરાવે કે તે આ વિનિયમની કોઈ પક્ષ જોગવાઈનો ભંગ કરવા બદલ ગુરોઝાર છે, તો બરતરફી, રૂખ્સદ અથવા પાપરી ઉત્તરમાં પરિષાખતી ન હોય તેવી કોઈ શિક્ષાને પાત્ર થશે.

પરંતુ સંચાલકોનો એવો અભિપ્રાય થાય કે બરતરફી સિવાપની કોઈ શિક્ષા કરવાથી ન્યાયનો હેતુ સરશે તો તે પેટાંડ (ખ) હેઠળ પગણું લઈ શકશે.

૮. રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના કોઈપક્ષ કર્મચારી તે જ શાળાના સંચાલક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી/સંચાલક કે મેનેજર તરીકે રહી શકશે નહીં. આ નિયમ અસ્તિત્વમાં આવતા હાલના આવા કર્મચારીઓએ બેમાંથી એક વિકલ્પ નજી માસમાં જિલ્લાશિકશાખાધિકારીશ્રીને આપવાનો રહેશે. આપેલા વિકલ્પનું (ઉત્તંધન કરવાર કર્મચારી જે શાળાના સંચાલક, મેનેજિંગ ટ્રસ્ટી કે મેનેજર હોય તે શાળા અને શાળાની નોંધકી રદ કરવાની કાર્યવાહી વિનિયમ ૮(ક) મુજબ કરી શકશે.<sup>૧</sup>

બિનસરકારી  
માધ્યમિક  
શાળાઓના  
શૈક્ષણિક તેમજ  
બિન-શૈક્ષણિક  
કર્મચારીઓની  
આચારસહિતા

૨૭ (અ) વર્તન તેમજ શિસ્ત પરતે રજિસ્ટર માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સભ્યો (સ્ટાફ) તરફી અવગણના બદલ ઊભી થતી બાબતો સંબંધમાં વિનિયમોમાં અન્યત્ર કરાયેલી સુચનાઓ (જોગવાઈઓ) ઉપરાંત રજિસ્ટર માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓને શિક્ષાની બાબતમાં શિસ્ત વિષયક પગલાં તરીકે આ વિનિયમ હેઠળના પરિશિષ્ટ-૧માં નિહિત કરી દર્શાવેલી શિક્ષાઓ કરવા આચાર્ય/મુખ્ય શિક્ષકની સત્તા રહેશે.<sup>૨</sup>

૯. રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફની કામગીરીઓ અને રચનાઓ પરતે વિનિયમો હેઠળ અન્યત્ર કરાયેલ જોગવાઈઓ ઉપરાંત સંચાલક મંડળ, આચાર્ય, સુપરવાઈઝર, શિક્ષકો તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફના વર્ગ-ઉમાં અને વર્ગ-રૂમાં આવરી લેવાતા તમામ કર્મચારીઓની ફરજે તથા સેવા (વર્તન)ની શરતો આ વિનિયમ હેઠળના પરિશિષ્ટ-૨માં નિહિત કરી દર્શાવેલી જોગવાઈઓ અનુસારની રહેશે.<sup>૩</sup>

૧૦. રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક તમામ વર્ગના કર્મચારીઓ માટે વિનિયમ ૨૭(દ)માં નિશ્ચિત કરેલી ફરજે તથા સેવાઓ ઉપરાંત નીચે મુજબના નિયમો ઉત્તર બુનિયાદીના સંચાલક મંડળ સહિતના શાળાના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક તમામ વર્ગના કર્મચારીઓને લાગુ પડશે.

- (૧) ફરજ દરમિયાન અને સંસ્થામાં ખાદી પહેરતા હોવા જોઈશે.
- (૨) ઉત્પાદક શ્રમ-ઉદ્યોગમાં સક્રિય રીતે ભણશે.
- (૩) પ્રાર્થના તેમજ સમૂહજીવન તથા છાત્રાલયના કાર્યમાં પ્રત્યક્ષ જોડાશે.
- (૪) સમાજસેવાના અને સેવા વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે.
- (૫) બીડી, ટેકી, માદક પદાર્થ નહીં લેતા હોય.
- (૬) સંસ્થાના શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લેશે.
- (૭) સંસ્થા પાસે સંસ્થાના મકાનની સવલત હોય તો સંસ્થાના કેમ્પસમાં જ રહેશે.<sup>૪</sup>

૧ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : બમશ-૧૦૮૭-૪૭૬૨-(૮)-૨, તા. ૧૭-૨-૮૮ અન્યથે

૨, ૩, ૪ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : મશબ-૧૦૮૮-૨૭૫૮-૭, તા. ૨૦-૫-૮૨ અન્યથે

૨૮ (૧) પૂર્વકાલીન શિક્ષકે શાળાની જરૂરિયાતો પ્રમાણે દરરોજના વિચામના સમય બાદ કરતા, કામના કલાકો અઠવાડિયાના ૩૦ કલાક સુધી શાળાના કામકાજના સમય દરમિયાન શાળાની જગ્યામાં હાજર અને અધ્યાપકીય રહેવું જોઈશે.

(૨) પૂર્વકાલીન શિક્ષકે વિરામનો સમય બાદ કરતા દર અઠવાડિયે ઓછામાં ઓછા ૨૧ કલાક ખરેખર શૈક્ષણિક કામ કરવું જોઈશે અને બાકીના સમયની શાળાની અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, સુધારવાના અને તેવા બીજી કામમાં ઉપયોગ કરવો જોઈશે.

(૩) (ક) શાળાના સમયપત્રકમાં ઠરાવેલાં બધાં કામનો, કામના ૨૧ કલાક સમયમાં સમાવેશ થશે

(ખ) શાળાના સમયપત્રકમાં શિક્ષકને પૂરેપૂરા ૨૧ કલાકનો સમય શૈક્ષણિક કામ માટે અપાશે.

(૪) રાજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના વડા, પોતાની વિવેકબુદ્ધિ અનુસાર શિક્ષકોનું શૈક્ષણિક કામ દર અઠવાડિયે વધ્યારેમાં વધ્યારે ત્રણ પીરિયડ સુધી ઘટાડી શકશે. પણ તે એવી રીતે કે દરેક શિક્ષક દીઠ દર અઠવાડિયે ૨૧ કલાકની સરાસરીને બાધ ન આવવો જોઈશે.

(૫) તમામ શિક્ષકોને સોંપેલું સુધારણાનું કામ વિચારણમાં લઈને તેમને કામની ન્યાયી અને સમાન વહેંચયાયી માટે ઉપરીએ ખાતરી આપવી જોઈશે.

(૬) ૨૦ વર્ગો કરતાં વધારે વર્ગોવાળી રાજિસ્ટર થયેલી શાળામાં ઉપરીએ, બીજી ઉપરીએ અને સુપરવાઈઝર અનુક્રમે દર અઠવાડિયે ૬, ૮ અને ૧૦ કલાક સુધી શૈક્ષણિક કામ હાથ પરવું જોઈશે.

૨૦ વર્ગો અથવા ૨૦ કરતાં ઓછા વર્ગોવાળી રાજિસ્ટર થયેલી શાળામાં ઉપરીએ, બીજી ઉપરીએ અને સુપરવાઈઝર અનુક્રમે ઓછામાં ઓછા ૬, ૭ અને ૧૨ કલાક સુધી શૈક્ષણિક કામ હાથ પરવું જોઈશે.

(૭) સત્ત્રાની શરૂઆતમાં ૪ અભ્યાસેતર પ્રવૃત્તિઓનું છાઈ જળવાઈ રહે તે રીતે આચાર્ય શિક્ષકોના સહકારથી વર્ષની શરૂઆતમાં આયોજન કરવું અને તેનું અમલીકરણ કરવું.<sup>1</sup>

૨૯ (૧) રાજિસ્ટર થયેલી શાળાનો કોઈ કર્મચારી, સામાન્ય રીતે શાળાના વડાની પરવાનગી ગેરહાજરી પ્રથમ મેળવા વગર, પોતાની ફરજ ઉપર ગેરહાજર રહી શકશે નહિ.

(૨) કટોકટીના પ્રસંગે, જ્યારે તે જરૂરી પરવાનગી મેળવી શકે તેમ ન હોય ત્યારે તેણે તેની ગેરહાજરીનાં કારણોની સૌથી વહેલી તક ઉપરીને ખરબ આપવી જોઈશે.

પરંતુ કોઈ પણ સંજોગોમાં આવી ગેરહાજરી ત્રણ દિવસ કરતાં વધુ ચાલુ રહેવી જોઈશે નહિ.

૩૦. (૧) ૨૪ હક તરીકે માગી શકશે નહિ. યથાપ્રસંગ, શાળાના ઉપરી અથવા સંચાલક રજી સમિતિને રજીની ના પાડવાની અથવા ૨૬ કરવાની મુનસફી રહેશે.

(૨) (ક) વડા શૈક્ષણિક વર્ષમાં વધુમાં વધુ ૧૫ દિવસની મુદત સુધી પરચૂરણ રજી આપી શકશે, પરંતુ તે એવી શરતે કે સામાન્ય રીતે ત્રણ દિવસ કરતાં વધારે ન હોય તેટલા દિવસની પરચૂરણ રજી એક સાથે ભોગવી શકશે અને તે અપવાદરૂપ સંજોગોમાં ફક્ત ૧૦ દિવસ સુધી લંબાવી શકશે.

(ખ) બે કરતાં વધારે ન હોય તેટલી જ્ઞાને રજીના કોઈ ગાળા સાથે, તેની આગળ કે પાછળ કે આગળ પાછળ એમ બંને સાથે જોડીને ભોગવી શકશે અને પરચૂરણ રજી અને એકો સાથે સતત ભોગવેલી જ્ઞાને રજીઓની કુલ મુદત, અપવાદરૂપ સંજોગોમાં ૧૦ દિવસ સુધી લંબાવી હોય તે સિવાય, ફક્ત સાત દિવસ કરતાં વધવી જોઈશે નહિ.

(ગ) પરચૂરકા રજા સાથે બે કરતાં વધારે ન હોય તેટલી જીહેર રજાઓ તેની આગળ કે પાછળ જોડી શકશે અને એવી રીતે આગળ કે પાછળ જોડેલી કોઈ જીહેર રજાઓ બે કરતાં વધે ત્યારે તે પરચૂરકા રજા તરીકે ગણપાશે. પરચૂરકા રજાની બે મુદ્દત વચ્ચે આવતા રવિવારો અને જીહેર રજાના દિવસો પરચૂરકા રજાના ભાગ તરીકે ગણપાશે.

(હ) પરચૂરકા રજા શાળાના ઉપરીની પૂર્વ પરવાનગી સિવાય, સામન્ય રીતે વેકેશનની સાથે તેની આગળ કે પાછળ જોડી શકશે નહિ.

(દ) ગેરહાજરીની મુદ્દત કામકાજના અર્થા દિવસ જેટલી હોય અથવા તેના કરતાં ઓછી હોય તો અર્થા દિવસની પરચૂરકા રજા ભોગવાની છૂટ આપી શકશે.

(ઇ) શનિવાર, જો ખર્ષે કામકાજનો દિવસ હોય તો તે દિવસની અથવા જો શાળા બીજા કોઈ દિવસે ખર્ષે દિવસ પાળતી હોય તો તે દિવસની ગેરહાજરી અર્થા દિવસની પરચૂરકા રજા ગણપાતી નથી પણ આજા દિવસની પરચૂરકા રજા ગણવાની હોય છે.

(જ) દરેક વર્ષના માર્ચ/એપ્રિલ અને ઓક્ટોબર/નવેમ્બર મહિનામાં બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના સંબંધમાં પ્રત્યક્ષ કામની પરીક્ષા માટે, પેપર-સેટર, મોડેરેટર, પરીક્ષકો વગેરે તરીકેની તેમની નિમશૂકના કારણે ફરજ પરથી ગેરહાજર રહેવાનું જરૂરી હોય તેવી વ્યક્તિઓને પરચૂરકા રજા તેમની પણ લેણી ન હોય તો ખાસ ડિસ્સા તરીકે વેકેશનની આગળ અને / અથવા પાછળ જોડવાની પરવાનગી સાથે, કોઈ વર્ષમાં પંદર દિવસ સુધીની ખાસ પરચૂરકા રજા લેવાની છૂટ આપવી જોઈશે. પરંતુ તે એવી શરતે કે બોર્ડના અધિકૃત અધિકારી એવું પ્રમાણપત્ર આપે કે વ્યક્તિઓની હાજરી પરીક્ષાઓના સંબંધમાં ખાસ દિવસો માટે જરૂરી છે તો.

(ઝ) (ક) શાળાના કાયમી કર્મચારીને તબીબી પ્રમાણપત્ર ઉપરથી અથવા બીજી રીતે દરેક પૂરા વર્ષની નોકરી માટે ૨૦ દિવસ સુધીની અર્થા પગારની રજા મંજૂર કરી શકશે. કર્મચારીએ તબીબી પ્રમાણપત્રના આધારે રજા માટે કરેલી દરેક અરજી સાથે રજિસ્ટર થયેલા તબીબી વ્યવસાયનું પ્રમાણપત્ર સામેલ કરવું જોઈશે અને તેમાં બને ત્યાં સુધી માંડગીનો પ્રકાર અને સંભવિત મુદ્દત સ્પષ્ટપણે જણાવવી જોઈશે.

(ખ) રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી, પોતાના સ્વચ્છિકાનુસાર અરજદારની શારીરિક તપાસ કરવાની સિવિલ સર્જનને અથવા જિલ્લા તબીબી અધિકારીને વિનંતી કરીને બીજો તબીબી અભિપ્રાય મેળવી શકશે. બીજો તબીબી અભિપ્રાય મેળવવાનું નક્કી કરવામાં આવે ત્યારે તેણે જે તારીખે પ્રથમ તબીબી અભિપ્રાય આપ્યો હોય તે તારીખ પછી બને તેટલી વહેલી તારીખે, પોતાના ખર્ચ ફરી તપાસ કરવા માટે વ્યવસ્થા કરવી જોઈશે અને અરજદારે મૂળ રજૂ કરેલું તબીબી પ્રમાણપત્ર જે તબીબી અધિકારી તેની ફરી તપાસ કરવાના હોય તેને મોકલવું જોઈશે.

(ગ) અર્થા પગારની રજાની વધુમાં વધુ મુદ્દત એકી સાથે ૧૨૦ દિવસ પૂરતી મર્યાદિત રહેશે.

સ્પષ્ટીકરણ – (૧) આ અર્થપગારી રજાઓ દર વર્ષ પહેલી જાન્યુઆરી દસ અને પહેલી જુલાઈએ દસ એમ અલોતરી કર્મચારીના રજાના ખાનામાં જ્યા કરવાની રહેશે.

(૨) નવી નિમશૂકના ડિસ્સામાં પ્રથમ છમાસિક ગાળા સુધીના સમયવાળા માટે દર માસ દીઠ પાંચ તૃતીયાંશ (૫<sub>૩</sub>) દિવસની રજા જ્યા કરવાની રહેશે.

(૩) કર્મચારી નિવૃત્ત થાય, અવસાન પામે, રાજ્યનામું આપે, નોકરીમાંથી બસ્તરફ કરવામાં આવે કે અન્ય રીતે નોકરીમાં સમાપ્ત થાય ત્યારે છેલ્લા છમાસિક ગાળાના સમય માટે દસ આગોતરી રજાને બદલે જેટલા પૂરા માસ માટે ફરજ બજાવી હોય તે બદલ એક માસ દીઠ પાંચ તૃતીયાંશ (૫<sub>૩</sub>) દિવસની રજા ગણતરીમાં લેવાની રહેશે.

ઉપર મુજબની ગણતરી કરવા માટે દિવસના ભાગ (કેકશન)ને બદલે નજીકનો પૂર્ણ દિવસ ગણતરીમાં લેવો અને માસના ભાગ માટે નજીકનો પૂર્ણ માસ ગણતરીમાં લેવો (અટલે કે ૧૫ દિવસથી વધુ દિવસો માટે આગળનો માસ ગણવો.)<sup>૧</sup>

(૪) લેઝી નીકળતી અર્થાં પગારની રજાની અર્થાં કરતાં વધારે ન હોય તેટલી રૂપાંતરિત રજા નીચેની બાબતોના આધારે મંજૂર કરી શકશે —

(ક) સિવિલ સર્જનના અથવા રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારીએ જગ્ઘાવેલા રજિસ્ટર થયેલા તબીબી વ્યવસાયીના તબીબી પ્રમાણપત્ર ઉપરથી, અથવા

(ખ) સદરહુ સત્તાધિકારીએ માન્ય રાખેલા કાયદેસરના કારણે,

શાખા સંસ્કૃતિ અથવા સંચાલક નીચેની શરતોને આધીન રહીને મંજૂર કરી શકશે —

(૧) સમગ્ર નોકરી દરમિયાન રૂપાંતરિત રજા વધુમાં વધુ ૨૪૦ દિવસ પૂરતી મર્યાદિત રહેશે,

(૨) રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે ત્યારે, આવી રજાથી બમણી રજા લેઝી નીકળતી અર્થાં પગારની રજા સામે ઉપારવામાં આવશે, અને

(૩) હક રજા અને તેની સાથે લીધેલી રૂપાંતરિત કુલ રજાની મુદત ૨૪૦ દિવસ કરતાં વધવી જોઈશે નહિ.

પરંતુ રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારીએ એમ માનવાને કારણ હોય કે કર્મચારી રજા પૂરી થતાં ફરજ ઉપર હાજર થશે નહિ તો રૂપાંતરિત રજા, આ નિયમ ડેઢા મંજૂર કરી શકશે નહિ.

(૪) એકદર છનીસ મહિના કરતાં વધારે ન હોય તેટલા દિવસની વગર પગારની રજા વિનિયમ પ્રમાણે બીજી કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા બીજી રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી વગર પગારની રજા મંજૂર કરવા માટે લેખિત અરજી કરે ત્યારે, ખાસ સંજોગોમાં કર્મચારીને તે આવી શકશે. પરંતુ કાયદી કર્મચારીના દાખલામાં, વગર પગારની રજાની મુદત કોઈ પણ એક પ્રસંગે જ્યારે તે કર્મચારી ક્ષમ્ય અથવા રુક્તપણતાની સારવાર લેતો હોય, ત્યારે ૧૨ મહિના અને બીજી કોઈ દાખલામાં ચાર મહિના કરતાં વધવી જોઈશે નહિ. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજા વગર ગેરહાજરીની મુદતનું પાછળથી વગર પગારથી રજામાં રૂપાંતર કરી શકશે.<sup>૨</sup>

(૫) (ક) જે મહિલા કર્મચારીએ એક વર્ષ કરતાં વધારે નોકરી કરી હોય અને જેને એક કરતાં વધારે બાળક હ્યાત ન હોય તેવી મહિલા કર્મચારીને જ જીત્યું દિવસની પ્રસૂતિની રજા તેમજ પુરુષ કર્મચારીને કે જેને બે કરતાં ઓછા બાળકો હ્યાત હોય તેને પટીની દેખરેખ માટે ૧૫ દિવસની પિતૃત્વની રજા મંજૂર કરી શકશે.<sup>૩</sup>

(ખ) પેટ્રો-ખંડ (ક) ડેડલા પ્રસૂતિ અંગેની રજાના આરંભ પહેલાં જે મહિલા કર્મચારીએ બે વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય, તેને આવી રજા અર્થાં પગારે મંજૂર કરી શકશે.

(ગ) પેટ્રો-ખંડ (ક) ડેડલા પ્રસૂતિ અંગેની રજાના આરંભના દિવસે જે મહિલા કર્મચારીએ બે વર્ષની અથવા બે કરતાં વધારે વર્ષની નોકરી કરી હોય તેને પૂરા પગારે આવી રજા મંજૂર કરશે.

(ઘ) પ્રસૂતિ અંગેની રજા, રજા ખાતે ઉપારશે નહિ. પ્રસૂતિ અંગેની રજા કોઈ પણ પ્રકારની રજાના

૧ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠચાવ ક્રમાંક : બમશ-૧૩૮૧-૨૬૬૦-ગ, તા. ૨૦-૪-૮૮ અન્વયે

૨ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠચાવ ક્રમાંક : બમશ-૧૧૮૮-૨૩૦૮-પાર્ટ-૨-ગ, તા. ૦૮-૦૩-૮૮ અન્વયે

અનુસંધાને મંજૂર કરી શકાશે. પરંતુ રજા મંજૂર કરવા માટેની અરજને તથીબી પ્રમાણપત્ર દ્વારા સમર્થન મળવું જોઈશે.

(ચ) પૂરા પગારની પ્રસૂતિ અંગેની રજા સમગ્ર નોકરી દરમિયાન બે વખત મંજૂર કરવામાં આવશે.

નોંધ : આ વિનિયમ હેઠળની રજા, કસુવાવડ અથવા ગર્ભપાતની બાબતમાં મળવાપાત્ર છે.

(જ) (ક) કોઈ પક્ષ શૈક્ષણિક વર્ગ માટે અધ્યાપકીય સ્ટાફના કાયમી સત્યને મળવાપાત્ર હક્ક રજા જે વર્ષ માટે તેને કામ કરવાની ફરજ પડી હોય તે વર્ષમાં આવતા વેકેશનના દિવસો જેટલી હોવી જોઈશે. પરંતુ આવી હક્ક રજા કોઈ શૈક્ષણિક વર્ષનાં નીસ દિવસ કરતાં વધારે હોવી જોઈશે નહીં. વધુમાં આવા સલ્યોને તેની લેણી નીકળતી હક રજા ૨૪૦ દિવસની થાય કે તરત જ હક્ક રજા પ્રાપ્ત થતી બંધ થશે।

(ખ) (૧) બિનઅધ્યાપકીય સ્ટાફના સત્ય તથા આચાર્ય (પ્રથમ આચાર્ય) કોઈ પક્ષ વેકેશન માટે હક્કદાર થશે નહીં, પક્ષ નોકરીના વર્ષ માટે ૩૦ દિવસ લેખે ફરજોના વર્ષ દીઠ હક્ક રજા મળશે. પરંતુ સત્યને તેની ૨૪૦ દિવસની રજા લેણી થાય એટલે તરત જ હક્ક રજા મળતી બંધ થશે.<sup>૧</sup>

(૨) ઉપરોક્ત મળવાપાત્ર રજાઓ પૈકી દરેક કર્મચારીના રજાના હિસાબમાં દર છ મહિને એટલે કે દરેક વર્ષની પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના દિવસે ૧૫ દિવસની વર્ષ કુલ ૩૦ દિવસની રજા અગાઉથી જમા કરવામાં આવશે.<sup>૨</sup>

(૮) પરચૂરજા રજા સિવાયની કોઈ પક્ષ પ્રકારની રજા બીજા પ્રકારની રજા સાથે કે તેના અનુસંધાને મંજૂર કરી શકાશે.

(૯) (ક) અધ્યાપકીય અને બિન-અધ્યાપકીય સ્ટાફનો હંગામી સત્ય પરચૂરજા અને પ્રસૂતિ અંગેની રજા સિવાયની બીજી કોઈ પગાર સાથેની રજા મેળવવાને હક્કદાર રહેશે નહિ.

પરંતુ જ્યારે આવા સત્યને કાયમી જગ્યા ઉપર કાયમી ધોરણે નીમવામાં આવે ત્યારે, તેણે અગાઉ સતત બજાવેલી ફરજ કાયમી સત્ય તરીકેની હોય તેમ તેને મળવાપાત્ર થઈ હોત તે રજા તેને ખાતે જમા કરી શકાશે.

વધુમાં રજા મંજૂર કરવાની સત્તા પરાવતા અધિકારીને એમ માનવાને કારણ હોય કે સંબંધિત સત્ય અર્થાત પગારની રજા પૂરી થયે ફરજ ઉપર પાછા ફરશે તો દરેક સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ માટે ૧૫ દિવસ લેખે અર્થાત પગારની રજા મંજૂર કરી શકાશે.

(૧૦) રૂપાંતરિત રજા સિવાયની ૧૫ દિવસની મુદ્દત સુધીની કોઈ પ્રકારની રજા, ડેડમાસ્ટર, અધ્યાપકીય અને બિન અધ્યાપકીય સ્ટાફના સત્યને મંજૂર કરી શકાશે.

(૧૧) ડેડ માસ્ટર અથવા અધ્યાપકીય અને બિન અધ્યાપકીય સ્ટાફના સત્યની ગમે તેટલી હક રજા થાય તો પક્ષ નોકરી ચાલુ હોય તો, શાળામાં ફરજાર થવાને જ કારણે રદ થશે નહિ.

૨જાના પગારની  
ગઝતરી

૩૧. (૧) (ક) હક રજા ઉપર હોય તે કર્મચારી જે મહિનામાં રજા શરૂ થાય તેની તરત જ અગાઉના પૂરા દસ મહિના દરમિયાન તેણે મેળવેલા સરેરાશ માસિક પગાર અથવા જે કાયમી પગાર માટે તે હક્કદાર હોય તે કાયમી પગાર, એ મેમાંથી જે વધારે હોય તેના જેટલો રજાનો પગાર મેળવવાને હક્કદાર રહેશે.

૧ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : બમશ-૧૦૮૮-૭૫૨-(૮૮)-ગ, તા. ૧૭-૪-૮૮ અન્વયે

૨,૩ - શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : બમશ-૧૭૮૧-૮૬૪-ગ, તા. ૧૮-૭-૮૧ અન્વયે

પરંતુ જગાનો અધિકતમ પગાર દર મહિને રૂ. ૧૧૦ કરતાં વધુ ન હોય ત્યારે તે કર્મચારી રજી ઉપર ઊતરે તેની તરત જ પહેલાં તેણે મેળવેલા પગાર જેટલો પગાર મેળવવાને હક્કદાર થશે.

(ખ) અર્ધા પગારની રજી ઉપર હોય તે કર્મચારી કાયમી પગારની અર્ધા રકમ અથવા પેટાંખંડ (ક) (ર)માં નિર્દિષ્ટ કરેલી અર્ધા રકમ જેટલો રજાનો પગાર મેળવવા હક્કદાર થશે.

(ગ) રૂપાંતરિત રજી ઉપર હોય તે કર્મચારી પેટાંખંડ (ખ) હેઠળ મળવાપાત્ર રકમથી બમણી રકમ જેટલો રજાનો પગાર મેળવવા હક્કદાર રહેશે.

(ઘ) વગર પગારની રજી ઉપર હોય તે કર્મચારી કોઈ પણ રજાનો પગાર મેળવવાને હક્કદાર રહેશે નહિ.

(૨) કોઈ કર્મચારીને ખાતે જમા નીકળતી રજી તેની નિવૃત્તિની તારીખે રદ થશે,

પરંતુ તે તારીખ પહેલાં પૂરતા સમયમાં તેણે રજી માટે વિધિસર અરજી કરી હોય અને શાળાના દિતમાં રજી આપવાની ના પાડવામાં આવી હોય ત્યારે નિવૃત્તિવયની તારીખ પછી અથવા ફેર-નિમજૂકની મુદ્દત સમાપ્તે થયા પછી, વધુમાં વધુ ચાર મહિનાની મુદ્દત સુધીની (Replusue) ના મંજૂર કરેલી રજી મંજૂર કરી શકશે.

(૩) નિવૃત્તિવય પછી નોકરીમાં ચાલુ રાખેલો કર્મચારી વિનિયમ ઉત્તના ખંડ(૭)માં જણાવેલા દરે તેની નોકરીની વધારેલી મુદ્દત માટે રજી પ્રાપ્ત કરશે, જે તે ફેર-નિમજૂકની વધારેલી મુદ્દત પૂરી થયા પહેલાં ભોગવી શકશે.

(૪) દરેક કર્મચારીની રજાનો ડિસાબ નમૂના એ મુજબ રાખકામાં આવશે.

(૫) પૂરા અથવા અર્ધા પગારની રજી ઉપર હોય તે કર્મચારી રજાની મુદ્દત દરમિયાન પગાર સાથેની કોઈ નોકરી અથવા મહેનતાણું સ્વીકારી શકશે નહિ.

(૬) (ક) રજી માટેની અથવા રજી લંબાવવા માટેની અથવા વેકેશન પછી રજી ઉપર ઊતરવા માટેની અરજી સામાન્ય રીતે જે તારીખથી રજી લેવા અથવા તે લંબાવવા ધાર્યું હોય તે તારીખની પહેલાં સમયસર કરવી જોઈશે.

(૭) શિક્ષણ અને મંજૂર વિભાગના તા. ૨૧-૬-૭૬ના સરકારી દાચાં કમાંક એસેટિઅર ૧૦૭૪-૫૭૮૫-જીથી કર્મચારીની ક્રીડા.

(૮) રજી ઉપર હોય તે કર્મચારીને, મંજૂર કરનાર સત્તાધિકારીની પરવાનગી સિવાય રજી પૂરી થતાં પહેલાં ફરજ ઉપર પાછા ફરવા દઈ શકશે નહિ.

(૯) વહીવટી જરૂરિયાતના અપવાદરૂપ સંજોગો હેઠળ રજી મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી, તાકીદની સ્થિતિનો પ્રકાર સમજાવીને રજી ઉપર હોય તે કર્મચારીને ફરજ ઉપર પાછો બોલાવી શકશે અને ફરજ ઉપર પાછા ફરવાની જવાબદારી કર્મચારીને માણે રહેશે. જ્યારે કર્મચારી ફરમાવ્યા પ્રમાણે ફરજ ઉપર હાજર ન થાય ત્યારે તેણે તે ખરેખરા સંજોગોને કારણે ફરજ ઉપર હાજર થઈ શકશો નથી એવી સદરહુ સત્તાધિકારીને ખાતરી કરાવવી જોઈશે.

૩૨. (૧) રજિસ્ટર થયેલી શાળાના ઉપરી અથવા બીજી ઉપરી કંઈ પણ મહેનતાણું લઈને અથવા પૂર્ણકાલિન અધ્યાપકીય સ્ટાફે લીધા વગર કોઈ પણ ખાનગી ટ્યુશન આપી શકશે નહિ,

પરંતુ આવા ઉપરી પ્રસંગોપાત્ર શાળાના સમય પછી શાળાના વિદ્યાર્થીઓને કંઈ પણ મહેનતાણું ખાનગી ટ્યુશન કરવા બાબતે

વધુમાં આવા ઉપરી શાળાના સંચાલકોએ લેખિત પરવાનગી આપી હોય, તો નીચે મુજબ કામ કરવાની જવાબદારી લઈ શકશે —

(ક) યુનિવર્સિટીની પૂર્વમંજૂરીથી અનુસ્નાતક કક્ષાએ સંશોધન માટે માર્ગદર્શન આપનાર તરીકે કામ કરવાની.

(ખ) કોલેજમાં અથવા રાજ્યમાં કાપદાથી સ્થુપાયેલી યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં —

(૧) જે સૂચિત કામ નાનું હોય અને તેનાથી શાળામાં તેના નિયમિત કામમાં અથવા જરૂરી મુદ્દત માટે શાળામાં તેની હાજરીમાં વિશેપ પડતો ન હોય; અને

(૨) તેના કાપદેસર કામમાં કોઈ પજી રીતે વિલંબ થતો ન હોય, તો અંશકાલિક વાખ્યાતા (લેક્ચરર) તરીકે કામ કરવાની.

(૩) કોઈ શિક્ષક દિવસમાં બે કલાક કરતાં વધુ સમય માટે ખાનગી ટ્યુશન કરી શકશે નહિ તેમજ સદરણ બે કલાકની મુદ્દત દરમિયાન પાંચ કરતાં વધારે વિદ્યાર્થીઓને શીખવી શકશે નહિ, સિવાય કે —

(ક) તે આનું ટ્યુશન કરવાની જવાબદારી લે તે પહેલાં તેણે શાળાના ઉપરીની પરવાનગી મેળવી હોય; અને

(ખ) દરેક મહિનાની આપદે, જે વિદ્યાર્થીઓને તે ટ્યુશન આપતો હોય તેમનાં નામ, દરરોજ કેટલા સમય માટે તે આનું ટ્યુશન આપે છે તે, કયા ધોરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે અને કેટલું મહેનતાણું મળે છે તે દર્શાવતું, તેણે સહી કરેલું પણક શાળાના ઉપરીને રજૂ કરવાનું તે કબૂલ કરે.

**સ્પષ્ટીકરણ :** “પાંચ વિદ્યાર્થીઓ” એટલે તે જ પાંચ વિદ્યાર્થીઓ અને નહિ કે વિદ્યાર્થીઓનો સમૂહ.

(ગ) જે વિદ્યાર્થીઓને ખાસ શિક્ષકની અને શાળાના વિભયોમાં વ્યક્તિગત ધ્યાન આપવાની જરૂર હોય તે વિદ્યાર્થીઓ માટે રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના ઉપરી શાળાના સમય પછી, શાળામાં ખાસ વગોની વ્યવસ્થા કરી શકશે. દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામાન્ય રીતે ૧૫થી ૧૮થી જોઈશે નહિ. માતાપિતા અથવા વાલીને, તેમના બાળકને આ વર્ગમાં મોકલવા માટે દબાજા કરું નહિ. આવા ખાસ શિક્ષક માટે હી લઈ શકશે પજી આ વગોનાં દિવસ દીઠ એક કલાક કરતાં વધારે કામ કરતાં શિક્ષકોને આપવાના વાજબી મહેનતાણાં અંગે આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે જોઈતી રકમ કરતાં તે હી વધવી જોઈએ નહિ. તેમ છતાં, આ હી વિનિયમ ઊર (૨) (ક)માં ઉલ્લેખેલ બે કલાકના ટ્યુશન કામ ઉપરાંતની રહેશે.

આવા વગોની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા, લેવાની ફિનો દર અને ખાસ વગોનાં કામ કરતા શિક્ષકોનાં નામ વિરોની માહિતી અધિકારીને મોકલવી જોઈશે. આવક અને ખર્ચનો ડિસાબ અલગ રાખવો જોઈશે, જે અધિકારીની તપાસ માટે ખુલ્લો રહેશે.

(હ) કોઈ શિક્ષક પોતે પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે કોઈ પજી માધ્યમિક શાળાની અંદરની અથવા બહારની પરીક્ષા અથવા અન્ય કોઈ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાને કોઈ તાલીમ વગોની સાથે સંકળાયેલો હોવો જોઈશે નહિ.

(ઝ) રજિસ્ટર થયેલી શાળાના સંચાલકોએ પોતાની શાળાના મકાનનો અથવા તેના કોઈ ભાગનો અથવા તેની જગાઓનો, વિભાગે માન્ય કરેલા એસોસિએશન તરકથી લેવાતી ભાષાની પરીક્ષા માટે શિક્ષક ચલાવતા હોય તે સિવાયના તાલીમ વગોના માટે ઉપયોગ કરવા દેવો નહિ,

પરંતુ આવા વર્ગમાં ટ્યુશન આપવામાં કોઈ શિક્ષક જે સમય ગાળે તે સમય, આ વિનિયમોથી મુક્તેલી ખાનગી ટ્યુશનની બે કલાકની સમય મર્યાદા સામે મજૂરે આપવામાં આવશે.

સ્પષ્ટીકરણ - આ વિનિયમના હેતુઓ માટે તાલીમ વર્ગ એટલે જે સ્થળે અંદરની અથવા બહારની પરીક્ષાની તૈયારી કરવા માટે ખાનગી ટ્યુશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ કરતાં વધારે થાય તે સ્થળ.

(પ) (ક) અંશકાલિક શિક્ષકે કોઈ ખાનગી ટ્યુશનની જવાબદારી લેતાં પહેલાં, શાળાના ઉપરીની પૂર્વ પરવાનગી મેળવવી જોઈએ અને જો તેવી પરવાનગી આપવામાં આવી હોય તો પંડ (૨) (ભ)માં કરાવ્યા પ્રમાણેના માસિક પત્રકો ઉપરીને સાદર કરવાં જોઈશે.

(ખ) અંશકાલિક શિક્ષકે એક અથવા વધારે શાળામાં શિખવવામાં ગાળેલા કલાકો અને ખાનગી ટ્યુશનમાં તેણે ગાળેલા કલાકોની કુલ સંખ્યા શાળામાં શિખવવામાં ગાળેલા કલાકોની એકંદર સંખ્યા અને પૂર્ણકાલિક શિક્ષકને ખાનગી ટ્યુશન લેવા માટે પરવાનગી આપેલા કલાકોની સંખ્યા કરતાં વધવાં જોઈશે નહિ.

પરંતુ ખાનગી ટ્યુશનમાં અંશકાલિક શિક્ષકે ગાળેલા કલાકોની કુલ સંખ્યા દિવસના ચાર કલાક કરતાં વધવી જોઈશે નહિ.

૩૩. (૧) કોઈ કાયમી કર્મચારીની નોકરી કલમ ઉદ્દેશ્યાની અનુસાર સંચાલકોએ સમાપ્ત નોકરીની કરી હોય ત્યારે, આવો કર્મચારી - સમાપ્તિ

(ક) જો તેણે શાળામાં પાંચ વર્ષ કરતાં વધારે ન હોય તેટલી મુદ્દત માટે નોકરી કરી હોય તો ભથ્થાં સહિત હ મહિનાના પગાર જેટલી રકમનું, અને

(ખ) જો તેણે શાળામાં પાંચ વર્ષ કરતાં વધારે મુદ્દત માટે નોકરી કરી હોય તો પ્રથમ પાંચ વર્ષ માટે ભથ્થાં સહિત છ મહિનાના પગાર અને પાંચ વર્ષ કરતાં વધારે મુદ્દતના દરેક વર્ષ માટે એક મહિનાના પગાર જેટલી રકમનું વણતર મેળવવાને હક્કદાર રહેશે.

પરંતુ આ કર્મચારીને જો ફાજલ કે સુપરન્યુમરી શિક્ષક તરીકેના લાભ મળ્યા હશે તો તે કોઈ વળતર મેળવવાને હક્કદાર રહેશે નહિ.<sup>૧</sup>

(ગ) શાળાના ધૂટા થતા કર્મચારીને જો ફાજલનું રકાશ આપવામાં આવે તો, તેવા ડિસ્સાયોમાં ઉપર (ક) (ખ)માં જાગ્ઞાવેલ વળતરની રકમ મંડળે સંસ્થાએ સરકારશ્રીમાં જમા કરાવવાની રહેશે.<sup>૨</sup>

(ર) હંગામી કર્મચારીની નોકરી સંચાલકે કોઈ પણ સમયે આવી નોટિસના બદલામાં એક અંગેજ વળતર મહિનાનો પગાર અને ભથ્થાં (કોઈ હોય તો) આપ્યા પછી કોઈ પણ કારણ આપ્યા વગર સમાપ્ત કરી મેળવવાનો શકશે, હક્કદાર રહેશે.

પરંતુ વેકેશન દરિયાન અથવા વેકેશનનો કોઈ ભાગ આવી જ્યાય તે રીતે અથવા વેકેશન પછી પ્રથમ પંદર દિવસની અંદર નોટિસ આપી શકશે નહિ.

(ઢ) હંગામી કર્મચારી ૩૦ દિવસની નોટિસ આપ્યા પછી, નોકરીમાંથી રાજીનામું આપી શકશે. તે પૂરેપૂરી નોટિસ આપે નહિ તો, ડરાનેલી મુદ્દત એટલે કે ૩૦ દિવસથી ઓછી હોય તેવી તેની નોટિસની મુદ્દત માટે (ભથ્થાં સહિત) નોટિસ પગાર આપવો જોઈશે. તેવી જ રીતે કાયમી કર્મચારી ૮૦ દિવસની નોટિસ આપ્યા પછી નોકરીમાંથી રાજીનામું આપી શકશે. તે પૂરેપૂરી નોટિસ આપે નહિ તો, ડરાનેલી મુદ્દત એટલે કે ૮૦ દિવસથી ઓછી હોય તેવી તેની નોટિસની મુદ્દત માટે (ભથ્થાં સહિત) નોટિસ પગાર આપવો જોઈશે,

૧. શિક્ષણ વિભાગ, ગાંધીનગરના કારાવકમાંક: એમ.એસ. -૧૧૮૩-૩૧૬૪-(૮૭)-૪, તા. ૧૨-૪-૮૮ અન્વયે સુધ્યારો

૨. શિક્ષણ વિભાગ, ગાંધીનગરના કારાવકમાંક: મશાલ-૧૧૮૮-૧૨૨૮-૪, તા. ૧૩-૮-૮૮ અન્વયે સુધ્યારો

પરંતુ નિયમો પ્રમાણે વેકેશન પગાર માટે હક્કદાર કર્મચારીઓ એક જ વેકેશન માટે બે શાળાઓમાંથી પગાર લઈ શકશે નહિ.

વધુમાં, તેમ છતાં ટૂકી મુદ્દતની નોટિસ બંને પશ્કારો પરસ્પર સંમત થાય, તો સંચાલક સ્વીકારી શકશે.

**બીજુ જગ્યા  
માટેનીની  
અરજી**

૩૪. (૧) (ક) રજિસ્ટર થયેલી શાળામાં કામ કરતા કર્મચારી, શિક્ષકની જગા સિવાયની અન્ય જગા માટે બીજે ઠેકાણે અરજી કરવા માંગે, ત્યારે તેણે સદરફુ જગા માટેની તેની અરજી સંચાલકોને જોડી કરીને શાળાના વડા મારફત મોકલાવવી જોઈશે.

(ભ) રજિસ્ટર થયેલી શાળાના વડા ડેરમાસ્ટરની જગા સિવાયની કોઈ જગા માટે બીજે ઠેકાણે અરજી કરવા માંગે ત્યારે, આવી અરજી સંચાલકો મારફત મોકલાવવી જોઈશે.

(ગ) અરજી, યથાપ્રસંગ, વડાએ અથવા સંચાલકોએ દરેક કેસની અગત્યતા ધ્યાનમાં રાખી સત્તવે અને કોઈ પજી સંજોગોમાં અરજી મધ્યાની તારીખથી એક અઠવાદિયાની અંદર મોકલવી જોઈશે,

પરંતુ આવી અરજીની ‘એડવાન્સ કોર્પી’ સીધી અરજદાર મોકલી શકશે મને અરજી સીધી મોકલ્યાની હકીકત, યથાપ્રસંગ, વડા અથવા સંચાલકો મારફત રજૂ કરેલી અરજીમાં જ્ઞાવી શકશે.

(૨) રજિસ્ટર થયેલી ખાનગી શાળાના શિક્ષક બીજુ રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણ્યુક માટે પસંદગી પામવાને ખુશી હોય ત્યારે તે આ વિનિયમો ડેણ તૈયાર કરેલા અને રાખેલા સંબંધિત રજિસ્ટરમાં પોતાનું નામ રજિસ્ટર કરાવશે.

**ધૂટા થવા  
માટેનું  
પ્રમાણપત્ર**

૩૫. જે શિક્ષક વાજબી નોટિસ આપ્યા પછી નોકરી છોડી દે અથવા જેની નોકરી સંચાલકોએ સમાપ્ત કરી હોય તે શિક્ષક ધૂટા થવા માટેના પ્રમાણપત્ર સારુ વિનંતી કરે, ત્યારે સંચાલકો આવા શિક્ષકને આવી વિનંતી કર્યાના એક અઠવાદિયાની અંદર નમૂના ઉ મુજબ ધૂટા થવા માટેનું પ્રમાણપત્ર આપશે.

**નિવૃત્તિવય**

૩૬. (૧) રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાના કર્મચારીને, જે તારીખે તે ૫૮ વર્ષની ઉભરે પહોંચે તે તારીખે ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે.

(૨) સંચાલકો ૫૮ વર્ષની ઉભર પૂરી થઈ હોય તેવી કોઈ વ્યક્તિની નિમણ્યુક અથવા ફેરનિમણ્યુક કરી શકશે નહિ.

પરંતુ તેમ છતાં, કર્મચારીની નિવૃત્તિવયની તારીખે તે મુદ્દતની અંદર આવી જતી હોય તો, તેની નોકરી, તે મુદ્દત પૂરી થાય ત્યાં સુધી આપોઆપ લંબાવેલી ગણાશે.

વધુમાં પટાવાળા અને અન્ય આવા શ્રમિક નોકરોની તેઓ શારીરિક રીતે યોગ્ય હોય તો, ૬૦ વર્ષની ઉભર સુધી સંચાલકોએ સાધારણ રીતે ફેરનિમણ્યુક કરવી જોઈશે.

**બિન-અધ્યાપકીય** નોંધ : ૬૦ વર્ષની ઉભરે ધૂટા થવા પાત્ર વર્ગ-૪ના કર્મચારીઓને તેઓ જે માસમાં ૬૦ વર્ષ પૂરા કરે તે માસની આપી તારીખ સુધી ચાલુ રાખી નિવૃત્તિ ગણવામાં આવશે.<sup>1</sup>

**સ્થાનાં નિવૃત્તિ** ૩૭. (શિક્ષક અને મજૂર વિભાગના તારીખ રજી ડિસેમ્બર, ૧૯૭૫ના સરકારી દરાવ કમાંક વરણાં બધાંનાં અધ્યાપકીય એસઈઆર-૧૦૭૪-૭૬૩૭૮-૪ થી કરી કર્યો).

**પ્રકરણ ૭**  
**રેકર્ડ અને રજિસ્ટરો**

૩૮. (૧) દરેક રજિસ્ટર થયેલી શાળાએ નીચેનાં કેકડો અને રજિસ્ટરો રાખવાં જોઈશે અને રેકર્ડ અને નિરીક્ષણ માટે રજૂ કરવાં જોઈશે —

- (ક) વિદ્યાર્થીઓને લગતાં રજિસ્ટર
- (ઠ) સામાન્ય રજિસ્ટર.
- (૨) હાજરીનું રજિસ્ટર.
- (૩) બીજી શાળામાંથી મળેલાં શાળા છોડ્યાનાં પ્રમાણપત્રો.
- (૪) વિદ્યાર્થીઓને કાઢી આપેલાં શાળા છોડ્યાનાં પ્રમાણપત્રોની સ્થળપત્રો.
- (૫) વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ ગુણ અને પરીક્ષાનાં પરિણામોનાં રેકર્ડ
- (૬) વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય અને તથિબી તપાસનાં રેકર્ડ.
- (૭) આગલા વર્ષની વાર્ષિક પરીક્ષાનાં જવાબપત્રો.
- (૮) નિરીક્ષણ પહેલાંની કરોટી પછી દાખલ કરેલાં વિદ્યાર્થીઓનાં રેકર્ડ.
- (૯) સ્ટાફને લગતાં રજિસ્ટર :
- (૧) શાળાના કર્મચારીઓની સર્વિસબુક.
- (૨) કર્મચારીઓની હાજરી અને રજીનું રજિસ્ટર.
- (૩) શાળામાં રાખેલા શિક્ષકો પાસેથી મળેલા ધૂટા થવા બાબતના પ્રમાણપત્રો.
- (૪) ડેમાસ્ટરની લોગબુક (મંતવ્યો, ટેખરેખ, નોંધો, શિક્ષકોને સૂચનો વગેરે)
- (૫) શિક્ષકોના નમૂના ચ મુજબ ખાનગી અહેવાલો.
- (૬) શિક્ષકોના ખાનગી ટયુશનનું રજિસ્ટર.
- (૭) શાળાને લગતાં રજિસ્ટર :
- (૧) દરરોજની રોકડમેળ.
- (૨) ટર્ફ ફીના જુદા હિસાબ સહિત આવક અને ખર્ચ દર્શાવતી ખાતાવહી.
- (૩) કર્મચારીઓના પગાર બિલની ફાઈલ.
- (૪) ફીના હિસાબની બુક.
- (૫) પ્રોવિઝનટ ફુના ખાતાનું રજિસ્ટર.
- (૬) તમામ નાણાકીય લેવડાઉનનાં વાઉચરો.
- (૭) જુદા જુદા વગોના લકડી સામાનજું રજિસ્ટર.
- (૮) પ્રયોગશાળા અને પુસ્તકાલયનાં રજિસ્ટરો.
- (૯) આવકજીવકનાં રજિસ્ટરો.

શાળાઓ અને ૩૮. (૧) શાળા ચાલુ હોય ત્યારે વિભાગના અધિકારીઓ અને બોર્ડ રજિસ્ટર થયેલી હોસ્ટેલો નિરીક્ષણ કરી શકશે. શાળાના સંચાલકોને નોટિસ આપીને અથવા આપ્યા વગર મુદ્તે, માટે ખુલ્લાં રહેશે તેનું નિરીક્ષણ કરવા આવશે. નિરીક્ષણ કરનાર અધિકારીએ પોતે ખાતરી કરી જોઈશે કે શાળાની છાલત સંતોષકારક છે અને આ વિનિયમો પ્રમાણે વખતોવખત ઠરાવવામાં આવે તે જરૂરિયાતનું તે પાલન કરે છે.

(૨) વિભાગના અધિકારીઓ અને બોર્ડ રજિસ્ટર થયેલી શાળાને સંલગ્ન હોસ્ટેલનું નિરીક્ષણ કરી શકશે અને તેઓને ખાતરી થવી જોઈએ કે તે સુધ્યવસ્થિત છે. તેઓ હોસ્ટેલનાં કામકાજ અંગે જરૂરી ગંતવ્યો વ્યક્ત કરી સલાહ અને સૂચનો કરી શકશે.

(૩) રજિસ્ટર થયેલી શાળાના સંચાલકો વિભાગના અધિકારીઓ અને બોર્ડને જરૂરી પત્રકો અને માહિતી પૂરી પાડશે.

૪૦. (રજિસ્ટર થયેલી માધ્યમિક શાળામાં શિક્ષકો તરીકેની નિમણૂક માટે ઉમેદવારોનાં નામવાળું રજિસ્ટર તૈયાર કરવા બાબત.) કમી કર્યો.

૪૧. (રજિસ્ટર થયેલી અન્ય ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો તરીકેની નિમણૂક માટે શિક્ષકો અને હેડમાસ્ટરોનાં નામવાળું રજિસ્ટર) કમી કર્યો.

**સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહ સામે આ વિનિયમો પ્રવર્તની છે**

૪૨. સન ૧૯૭૪ના એપ્રિલ મહિનાની ૨૨મી તારીખના શિક્ષણ અને મજૂર વિભાગના સરકારી જાહેરનામા ક્રમાંક જીએસી-૧૦૬૪૪સી ડેટા પ્રસિદ્ધ થયેલા સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહમાં સમાવિષ્ટ જોગવાઈઓ, જેટલે અંશે તે આ વિનિયમોમાં જોગવાઈ કરેલી કોઈ બાબતોને લગતી હોય તેટલે અંશે, તેના કરતાં આ વિનિયમોની જોગવાઈઓ પ્રવર્તશે.

**લઘુમતીએ સ્થાપેલી અને તેની દારા વહીવટ ચાલતો હોય તેવી કોઈ શૈક્ષણિક સંસ્થાને વિનિયમો લાગુ પડશે નહિ**

૪૩. વિનિયમો ૧૮, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૬, ૩૭, ૪૦ અને વિનિયમ ૪૧ના પેટા-ખંડો (૪), (૫) અને (૬)માંનો કોઈ પણ મજ્કૂર, ધર્મ કે ભાષા ઉપર આધ્યાત્મિક લઘુમતીએ સ્થાપેલી અને તેના દારા વહીવટ ચાલતા હોય તેવી કોઈ શૈક્ષણિક સંસ્થાને લાગુ પડશે નહિ.

#### પરિશિષ્ટ

#### (જુઓ વિનિયમ ૫)

૧. આ નિયમો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચુંટણી કર્યરીતિ નિયમો કહેવાશે.

૨. આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો —

(૧) “અધિનિયમ” એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨.

(૨) “ચુંટણી” એટલે વર્ગ ખના ખંડો (૧) અને (૧૦)માં આવતા સભ્યો સિવાયના કલમ અની પેટા-કલમ(૨)માં ઉલ્લેખેલા તે વર્ગના ચુંટણેલા સભ્યોમાંથી કોઈ સભ્ય ચુંટવા માટેની ચુંટણી.

(૩) “નમૂનો” એટલે આ નિયમોને જોડેલો નમૂનો.

(૪) “મતદાન મથકના પ્રમુખ અધિકારી એટલે ચુંટણી અધિકારીએ સંબંધિત જિલ્લામાં મતદાન મથકના પ્રમુખ અધિકારી તરીકે નીમેલા જિલ્લા શિક્ષણ અધિકારી અને અથવા શિક્ષણ નિરીક્ષક”

(૫) “ચુંટણી અધિકારી” એટલે બોર્ડના અધ્યક્ષ અથવા તેણે નિર્દિષ્ટ કરેલી વ્યક્તિ;

(૬) “કલમ” એટલે અધિનિયમની કલમ;

(૭) “મતદાર” એટલે ચુંટણીમાં મત આપવાને હક્કદાર વ્યક્તિ.

૩. (૧) ચૂંટણી અધિકારી, ખંડ (૧)માં આવતા સત્યો સિવાયના વર્ગ બચુંટાયેલા મતદાર યાદી તૈયાર સત્યોમાંથી દરેક સત્યની ચૂંટણી માટે અને ખંડ (૨) અને (૪)માં આવતા સત્યોમાંથી દરેક સત્યની કરવા, જીણવવા અને ચૂંટણી માટે જુદી જુદી મતદારયાદીઓ તૈયાર કરાવશે. આવી યાદીઓની વહેંચણી, કલમ ઉની પેટાકલમ રેની કસ્તરી બાબત (૨)ના પહેલાં પરંતુક હેઠળ રાજ્ય સરકારે નક્કી કર્યા પ્રમાણે પાંચ સમૂહ દર્શાવતા પાંચ ભાગોમાં કરવામાં આવશે.

(૨) બોર્ડના અધ્યક્ષ, પેટા-નિયમ (૧) હેઠળ તૈયાર કરેલી દરેક મતદાર યાદી પ્રમાણિત કરશે અને તેના દરેક પાના ઉપર સહી કરશે અને તેના ઉપર સિક્કો લગાવશે.

(૩) બોર્ડના અધ્યક્ષે દરેક મતદાર યાદીની પ્રમાણિત નકલમાં વખતોવખત જરૂરી હોય તે તમામ સુધારા કરવા જોઈશે અને તેવી રીતે કરેલા દરેક સુધારાની નીચે રેણે ઢૂંફી સહી કરવી જોઈશે.

(૪) ઉપર્યુક્ત પ્રમાણે જીણવેલી મતદારયાદી અધ્યક્ષ તાજાંકૂંચીમાં રાખશે અને તેની સલાહત કસ્તરી માટે તે જવાબદાર રહેશે.

૪. અધ્યક્ષે ઉમેદવારોનાં નામોની દરખાસ્ત કરવા માટે નિયત કરેલી તારીખના ઓછામાં મતદારયાદીની ઓછા એક મહિના અગાઉ જ્યાં સંબંધિત મતદારયાદીઓની નકલો જીવા માટે રાખવામાં આવતી હોય પ્રસિદ્ધ તે સ્થળોની જાહેર નોટિસ આપવી જોઈશે.

૫. પોતાનાં કાર્યો બજીવવામાં મદદ કરવા માટે મતદાન મથકના પ્રમુખ અધિકારી પોતાને ચૂંટણીના સ્ટાફની પોગ્ય લાગે તેટલી સંઘામાં મતદાન અધિકારી તેમજ ચૂંટણીકામ માટે જરૂરી બીજો સ્ટાફ પણ ચૂંટણી નિમણૂક અધિકારીની પૂર્વમંજૂરી મેળવ્યા પડી નિમશે.

૬. ચૂંટણી અધિકારી દરેક મતદાન મથકના પ્રમુખ અધિકારીને ચૂંટણી માટે જરૂરી નમૂના ચૂંટણી માટેની અને જોઈની સેશનની સહિત ચૂંટણી માટેની સામગ્રી પૂરી પાડશે. સામગ્રી પૂરી પાડવા બાબત.

૭. (૧) ચૂંટણી અધિકારીએ રાજ્યપત્રમાં અને સંબંધિત વિસ્તારમાં બહોળી ફેલાવો ચૂંટણીના જુદા જુદા ધરાવતા ઓછામાં ઓછા બે વર્તમાનપત્રોમાં જહેરનાસું પ્રસિદ્ધ કરીને ચૂંટણીની તારીખ જહેર કરવી તબક્કાઓ માટે જોઈશે.

(૨) પેટા-નિયમ (૧) હેઠળ જહેરનાસું પ્રસિદ્ધ કરવામાં આવે કે તરત જ ચૂંટણી અધિકારીએ પણ જહેરનાસું પ્રસિદ્ધ કરીને નીચેના તબક્કાઓ માટે તારીખ, સમય અને સ્થળ કે સ્થળો નક્કી કરવાં જોઈશે— અધિકારીએ નક્કી કરવા બાબત.

- (ક) ઉમેદવારોનાં નામોની દરખાસ્ત કરવા માટે.
- (ખ) ઉમેદવારીપત્રોની ચકાસણી કરવા માટે.
- (ગ) ઉમેદવારી પાછી ઝેંચી લેવા માટે.
- (ધ) મતો નોંધવા માટે.
- (ય) મત ગણતરી માટે.

#### પરંતુ—

(૧) પેટાનિયમ (૧) હેઠળ પ્રસિદ્ધ કરેલા જહેરનામાની તારીખ અને ઉમેદવારોના નામોની દરખાસ્ત કરવા માટે નિયત કરેલી તારીખ વચ્ચે ઓછામાં ઓછાં ૪ અઠવાડિયાંનો ગાળો હોવો જોઈશે.

(૨) ઉમેદવારોનાં નામોની દરખાસ્ત કરવા માટે નિયત કરેલી તારીખ અને મતોનોંધવા માટેની તારીખ વચ્ચે ઓછામાં ઓછા ચાર અઠવાડિયાંનો ગાળો હોવો જોઈશે.

(3) ઉમેદવારીપત્રોની ચકાસણી માટેની તારીખ ઉમેદવારીપત્રો રજૂ કરવા માટે નિયત કરેલી તારીખ પછી તરત આપતી તારીખ હોવી જોઈશે.

(3) ઉમેદવારોનાં નામની દરખાસ્ત કરવા માટે નિયત કરેલી એવી તારીખના ઓછામાં ઓછા ૧૫ દિવસ અગાઉ, ચુંટણી અધિકારીએ ચુંટણી માટેના ઉમેદવારોનાં નામની દરખાસ્તો મંગાવતી નિર્ધારિત ચુંટણીની લેખિત જીહેર નોટિસ આપવી જોઈશે અને તેમાં ઉમેદવારીપત્રો સોંપવાનાં હોય તે તારીખ નિર્દિષ્ટ કરવી જોઈશે.

#### ઉમેદવારોનાં નામોની દરખાસ્તો

C. (1) નિયમ ૭ ડેટણ ઉમેદવારોનાં નામોની દરખાસ્તો કરવા માટે નક્કી કરેલા દિવસે અને સમય દરમિયાન ચુંટણી માટે ઉમેદવાર તરીકે ઊભી રહેવા ઈચ્છતી દરેક વ્યક્તિએ નમૂના ક પ્રમાણે ઉમેદવારીપત્ર ભરવું જોઈશે, તેના ઉપર સહી કરવી જોઈશે અને તેણે જીતે અથવા તેણે આ અર્થે લેખિત અધિકૃત કરેલા પ્રતિનિષ્ઠ મારફત ચુંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરવું જોઈશે.

(2) પેટા-નિયમ (1) ડેટણ ઉમેદવારીપત્ર મળ્યે, ચુંટણી અધિકારીએ ઉમેદવારીપત્રમાં તેનો અનુકૂળમાંક લખવો જોઈશે અને તેમાં કઈ તારીખે અને ક્યા ચોક્કસ સમયે ઉમેદવારીપત્ર તેને આપવામાં આવ્યું હતું તે જણાવતા પ્રમાણપત્ર ઉપર સહી કરવી જોઈશે.

#### ઉમેદવારોનાં નામોની દરખાસ્તોની ચકાસણી

E. (1) ચુંટાવા માગતા ઉમેદવારો અથવા આવા દરેક ઉમેદવારે વિધિસર લેખિત અધિકાર આપેલી અન્ય કોઈ વ્યક્તિની, ઉમેદવારોનાં નામોની દરખાસ્તોને ચકાસણી માટે નક્કી કરેલા સમયે અને સ્થળે હાજર રહેવાને હક્કાર રહેશે. ચુંટણી અધિકારી, આવી વ્યક્તિને ચુંટાવા માગતા ઉમેદવારોનાં ઉમેદવારીપત્રો તપાસવા માટે વાજબી સંગવડ આપશે.

(2) ચુંટણી અધિકારી ઉમેદવારીપત્રો તપાસશે અને કોઈ ઉમેદવારના નામની દરખાસ્ત સામે ઉઠાવવામાં આવે તે કોઈ વાંધાનો નિર્ણય કરશે અને આવા વાંધા ઉપરથી અથવા પોતાની મેળે અને પોતાને જરૂરી જણાય તેવી સંક્ષિપ્ત તપાસ કર્યા પછી નીચેના કોઈ પણ કારણે ઉમેદવારીપત્ર ના મંજૂર કરી શકશે —

(1) ઉમેદવાર, અધિનિયમ ડેટણ ચુંટણી માટે ગેરલાયક છે.

(2) ઉમેદવારનું નામ મતદાર યાદીમાં જણાતું નથી, અથવા

(3) ઉમેદવાર આ નિયમો અથવા વિનિયમોથી આવશ્યક હોય તેવી કોઈ જોગવાઈનું પાલન કરવાનું ચૂક્યો છે.

(3) પેટા-નિયમ (1)ના ડેટુ માટે, મતદાર યાદીમાં કરેલી નોંધ તે નોંધમાં જણાવેલા કોઈ પણ મતદારની ચુંટણી માટે ઊભા રહેવાનો હકનો નિર્ણયિક પુરાવો ગણાશે.

#### ઉમેદવારોનાં નામોની દરખાસ્તોની ચકાસણી પૂરી કરવા બાબત

10. (1) ચકાસણી આ માટે નક્કી કરેલા દિવસે પૂરી કરવામાં આવશે.

(2) ચુંટણી અધિકારી તે જ દિવસે દરેક ઉમેદવારીપત્ર ઉપર તેનો સ્વીકાર અથવા અસ્વીકાર બાબતના નિર્ણયનો શેરો કરશે અને ઉમેદવારીપત્રનો અસ્વીકાર કરવામાં આવે તો તે આવા અસ્વીકાર માટેના પોતાનાં કારણોનું સંક્ષિપ્ત નિવેદન કરશે અને આવા નિવેદનની એક નકલ જે ઉમેદવારના નામની દરખાસ્ત નામંજૂર કરી હોય તે અર્થે અરજી મધ્યાના ૨૪ કલાકની અંદર પૂરી પાડશે.

(3) જેના ઉમેદવારીપત્રનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય તે કોઈ ઉમેદવાર ચુંટણી અધિકારના કુઝ સામે શિક્ષણ નિયામકને, પેટાનિયમ (2) ડેટણ તે નિવેદન મધ્યાના જે દિવસની અંદર અપીલ કરી શકશે અને અપીલની નકલ ચુંટણી અધિકારીને મોકલી શકશે. શિક્ષણ નિયામક અપીલ રજૂ થયાના ત્રણ દિવસની અંદર તે અંગે પોતાનો નિર્ણય આપશે અને ચુંટણી અધિકારીને તે નિર્ણયની તરત જ જાણ કરશે. શિક્ષણ નિયામકનો નિર્ણય આખરી ગણાશે.

૧૧. (૧) નિયમ ૧૦ હેઠળ ઉમેદવારોનાં નામની દરખાસ્તની ચકાસકી પૂરી થયાના જાણ ઉમેદવારી પાછી દિવસ કરતાં મોહું ન હોય તેવા કોઈ દિવસે સવારના અગિયાર વાગ્યાથી બપોરના ગ્રંથ વાગ્યા સુધીના ખેંચી લેવા બાબત સમય દરમિયાન કોઈ ઉમેદવાર પોતે સહી કરેલી લેખિત નોટિસ આપીને અને ચુંટણી અધિકારીને તે પહોંચાડીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લઈ શકશે. આવી નોટિસ ઉમેદવાર જાતે આપી શકશે અથવા તે માટે તેજો લેખિત અધિકાર આપેલી વ્યક્તિ આપી શકશે. સદરથું મુદ્દત પૂરી થયા પછી આપવામાં આવેલી ઉમેદવારી પાછી ખેંચી લેવાની કોઈ પણ નોટિસ અસરકારક રહેશે નહિ.

(૨) જે વ્યક્તિએ પેટા-નિયમ (૧) હેઠળ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ આપી હોય તેને તે નોટિસ રદ કરવા દેવામાં આવશે નહિ.

૧૨. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે નિયમ ૧૧ હેઠળ છૂટ આપેલી મુદ્દત પૂરી થયે, ચુંટણી હરીફ ઉમેદવારોની અધિકારીએ પોતાની સહી કરીને તમામ હરીફ ઉમેદવારની પાદી તૈપાર કરવી જોઈશે અને મતદાન નોંધણી પાદી તૈપાર કરવા માટે નક્કી કરેલી તારીખના ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ પોતે નક્કી કરે તેવાં સ્થળોએ તે મુકાવવી બાબત અને ચુંટણીની નોટિસ.

૧૩. હરીફ ઉમેદવાર મૃત્યુ પામે અને મતદાન શરૂ થાય તે પહેલાં તેના મૃત્યુની ખબર મળે, મતદાન પહેલાં તો ચુંટણી અધિકારીએ ઉમેદવારના મૃત્યુની લકીકત વિચે ખાતરી થયેથી, મતદાન રદ કરવું જોઈશે અને ઉમેદવારનું મૃત્યુ શિક્ષણ નિયામકને તે લકીકતની જાણ કરવી જોઈશે અને ચુંટણી અંગેની તમામ કાર્યવાહી, જાણે તે નવી ચુંટણી હોય તેમ બધી બાબતોમાં નવેસરથી શરૂ કરવી જોઈશે,

પરંતુ જે વ્યક્તિ મતદાન રદ કરવાના સમયે હરીફ ઉમેદવાર હોય તેની બાબતમાં વહું દરખાસ્ત કરવાનું જરૂરી રહેશે નહિ,

વહુમાં જે વ્યક્તિએ મતદાન રદ થતાં પહેલાં નિયમ ૧૧ હેઠળ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ આપી હોય તે વ્યક્તિ આવી રીતે મતદાન રદ થયા પછી ચુંટણી માટેના ઉમેદવાર તરીકે પોતાના નામની દરખાસ્ત કરાવવા માટે લાયક ગણાશે.

૧૪. હરીફ ઉમેદવારોની સંખ્યા બેઠકો ભરવાની સંખ્યા જેટલી હોય, ત્યારે ચુંટણી અધિકારી બિનહરીફ ચુંટણી હરીફ ઉમેદવારોને કોઈ પણ મત લીધા સિવાય યોગ્ય રીતે ચુંટાયેલા જોઈએ કરશે.

૧૫. મતપત્ર નમૂના બંધ મુજબ હોવું જોઈશે અને તેમાં કક્ષાવારી પ્રમાણે તમામ ઉમેદવારોનાં મતપત્રનો નમૂનો નામ હોવા જોઈશે.

૧૬. (૧) મતદાન માટે નિયત કરેલા દિવસની તરત જ અગાઉના દિવસે દરેક મતદાન મથકના ચુંટણીની સામગ્રી પ્રમુખ અધિકારીને મતપત્રો નાખવા માટે બાકોરાંવાળી મતપેટી, તેના મતદાન મથકને લગતી મતદાર અને મતપેટીએ પાઈના ભાગની એક નકલ, મતદારયાદીમાંના દરેક મતદાર માટે એક મતપત્રના ડિસાલે અનુક્રમ નંબર આપેલી પ્રતો અને સ્થળપ્રતોવાળાં મતપત્રો અને મત લેવા માટે જરૂરી હોય તેવી બીજી સામગ્રી આપવામાં આવશે.

(૨) મતદાન શરૂ થતાં પહેલાં, મતદાન મથકના પ્રમુખ અધિકારીએ મતદાન મથકે હાજર હોય તેવા ઉમેદવારોને અથવા તેમના એજન્ટોને મતપેટીએ ખાલી બતાવવી જોઈશે અને પછી તેને તાજું મારવું જોઈશે અને સીલ તોડવા સિવાય ઉઘાડી શકે નહિ તેવી રીતે સીલ મારવું જોઈશે.

૧૭. ચુંટણીના દિવસે દરેક મતદાન મથકના પ્રમુખ અધિકારીએ, જે મતદાન મથકનું તેજો પ્રમુખ મતદાન મથકામાં સ્થાન લીધું હોય તે મતદાન મથકમાં ઉમેદવારો અને તેમના એજન્ટો ઉપરાંત માત્ર મતદારો અને ચુંટણી દાખલ થવા બાબત અધિકારીએ આ માટે આપેલા ખાસ આદેશ હેઠળ દાખલ કરવામાં આવે તેવી બીજી વ્યક્તિઓને જ મતદાન મથકના દાખલ કરવી જોઈશે.

મતદારોએ મતદાન  
મથક ઉપર છાજર  
રહેવા બાબત

મતો નોંધવા બાબત

૧૮. પોતાનો મત નોંધવા ઈચ્છતા દરેક મતદારે આ હેતુ માટે મતદાન મથકે ચુંટણી અધિકારીઓ આ અર્થે નક્કી કરેલી તારીખે અને સમય દરમિયાન છાજર રહેણું જોઈશે.

૧૯. મતો નીચેની જોગવાઈઓ અનુસાર નોંધવામાં આવશે—

(૧) મુખત્વારનામાંથી મત આપી શકાશે નહિ.

(૨) મત આપવા માગતા મતદારને મતપત્ર આપવામાં આવે તે પહેલાં મતદાર પાદીમાનું તેનું નામ અને તેનો નંબર ત્યાં છાજર રહેલી તમામ વ્યક્તિઓ સાંભળી શકે તે રીતે બોલવાં જોઈશે.

(૩) (ક) કુઈ પણ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હોય ત્યારે, મતદાન અધિકારીએ મતપત્રની સ્થળપત્ર ઉપર મતદારની સહી અથવા નિશાની લીધા પછી અને પ્રત તથા સ્થળપત્રની વચ્ચમાં મતપત્ર ઉપર સિક્કો માર્યા પછી અને સ્થળપત્ર ઉપર ટૂંકી સહી કર્યા પછી મતપત્રની પ્રત મતદારને આપવામાં આવશે અને ત્યાર પછી મતદાનખંડમાં તેને દાખલ કરવામાં આવશે.

(ખ) ઉમેદવારો અને તેમના ચુંટણી એજન્ટો વાંધો ઉઠાવે, ત્યારે મતદાન મથકના પ્રમુખ અધિકારી આવા વાંધાનો નિકાલ કરશે અને મત આપવા ઈચ્છતો મતદાર મત આપવાને હક્કાર છે અને તેણે હજુ સુધી મત આપ્યો નથી એવી તેને ખાતરી થાય ત્યારે તે મતદાન અધિકારીને, મતપત્રની પ્રત મતદારને, મતપત્રની સ્થળપત્ર ઉપર તેની સહી અથવા નિશાની લીધા પછી અને પ્રત તથા સ્થળપત્રની વચ્ચમાં મતપત્ર પર સિક્કો માર્યા પછી અને સ્થળપત્ર ઉપર ટૂંકી સહી કર્યા પછી આપવામાં આવશે. ત્યાર પછી મતદારોને મતદાનખંડમાં દાખલ કરવામાં આવશે. મતદાન મથકના પ્રમુખ અધિકારી જે મતદારના સંબંધમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તે મતદારના મતપત્રની પ્રત ઉપર ટૂંકી સહી કરશે.

(૪) મતદાર જે ઉમેદવારને મત આપવા માગતો હોય તેના નામ સાથે મતપત્રના ‘ચોકરી’ એ શીર્ષક હેઠળના કોલમમાં તે દરેક માટે (X) ચોકરીની નિશાની કરશે. ત્યાર પછી તે નિશાની છુપાયી શકાય તે રીતે નિશાની કરેલા મતપત્રની ગડી વાળશે અને એવી રીતે ગડી વાળેલું મતપત્ર મતપેટીમાં મૂકશે અને અયોગ્ય વિલંબ કર્યા વગર મતદાનખંડ છોડી જશે.

(૫) જે મતદાર, અંધાપાને અથવા અન્ય કોઈ કારણે પોતાનો મત જીતે નોંધવા શારીરિક રીતે અશક્ત હોય તેણે વિનંતી કર્યોથી, મતદાન મથકના પ્રમુખ અધિકારી તેની સાથે મતદાન કુટિરમાં જરૂર અને મતદારની ઈચ્છા પ્રમાણે તે મતદાર વતી મત નોંધશે.

(૬) મતદાન બંધ થવાના સમયે મતદાન મથકમાં છાજર હોય તે મતદારો સિવાયના કોઈ પણ મતદારને મતદાન બંધ કરવા માટે ડરાવેલા સમય પછી મતપત્ર આપવામાં આવશે નહિ. આ મતદારોને મતદાન બંધ થયા પછી પણ તેમના મતો નોંધવા દેવામાં આવશે.

૨૦. મતો પૂરેપૂરી ગુપ્તતાથી નોંધવામાં આવ્યા છે તે જોવાની, આ નિયમો ડેઢણ મતદાન મથકે દાખલ કરવાની વ્યક્તિઓને જ તેમાં દાખલ કરવામાં આવી છે તે જોવાની અને જે વ્યક્તિઓએ તેમના મત નોંધ્યા હોય અથવા તેમની સામે વાંધા સાંભળવામાં આવ્યા હોય અને સ્વીકારવામાં આવ્યા હોય તે વ્યક્તિઓ મતદાન મથક તરત છોડી જાય તે જોવાની અધિકારીઓ અને તેમના મદદનીશોની ફરજ રહેશે. આ નિયમો અને તે ડેઢણ ચુંટણી અધિકારીએ જે કાઈ ખાસ સૂચનાઓ આપી હોય તેનું દરેક રીતે ચુસ્તાપક્ષે પાલન થાય તે જોવાની પણ તેમની ફરજ રહેશે.

૨૧. ચુંટણીનું સંચાલન ચુંટણી અધિકારીની સામાન્ય દેખરેખ નીચે થશે. કોઈ મતદાન મથકના પ્રમુખ અધિકારી, શંકાસ્પદ મુદ્હો ચુંટણી અધિકારી, જે મતદાન મથકે છાજર હોય તો તેને લખી મોકલી શકશે.

મતદાન મથકના  
પ્રમુખ અધિકારીઓ  
અને અન્ય મતદાન  
અધિકારીઓની  
ફરજી

ચુંટણી અધિકારીએ  
ચુંટણીના સંચાલનની  
દેખરેખ રાખવા  
બ્યાબત

૨૨. મતદાર યાદીમાં દાખલ કરેલ અમુક મતદાર તરીકે પોતાને ઓળખાવનાર કોઈ વ્યક્તિ, પેશ કરેલાં મતપત્રો બીજી વ્યક્તિએ એવા મતદાર તરીકે મત આપ્યા પછી મતપત્ર માટે અરજી કરે, તો અરજદાર મતદાન મથકના પ્રમુખ અધિકારી તેને પૂછે તેવા મશ્વોનો હોય રીતે જવાબ આપ્યા પછી, મતપત્ર મેળવવાને હક્કાર રહેશે. ત્યાર પછી મતદાર નિયમ ૧૮માં કરાવેલી રીતે પોતાનો મત નોંધશે અને મતપત્ર મતદાન મથકના પ્રમુખ અધિકારીને આપશે. મતદાન મથકના પ્રમુખ અધિકારી તેના ઉપર મતદારનું નામ અને મતદાર યાદીમાંનો તેનો નંબર લખશે અને મતપત્ર જુદા પેકેટમાં બંધ કરીને તે પેકેટ સીલ કરશે. આવા મતપત્રો ચુંટણી અધિકારીએ ગણ્યતરીમાં દેવા નહિ અને તે પેશ કરેલાં મતપત્રો તરીકે ઓળખાશે. આવી રીતે પેશ કરેલાં મતપત્રોની યાદી રાખવી જોઈશે.

૨૩. કોઈ મતદારે પોતાનું મતપત્ર એવી રીતે વાપર્યું હોય કે જેથી તેના મતપત્ર તરીકે સહેલાઈથી બગડેલાં મતપત્રો ઉપયોગ થઈ શકે નહિ, તો તે મતદાર મતપત્ર મતદાન મથકના પ્રમુખ અધિકારીને આપીને અને પોતાની શરતચૂક સંબંધી ખાતરી કરાવીને, બગડેલા મતપત્રને બદલે બીજું મતપત્ર મેળવી શકશે અને બગડેલા મતપત્ર અને તેની સ્થળપ્રત પર “રદ કરેલ” તરીકે નિશાની કરવી જોઈશે.

૨૪. (૧) મતદાન મથકના પ્રમુખ અધિકારીએ, મતદાન પૂરું થયા પછી, વ્યવહાર્ય હોય તેટલું મતપેટીઓને સીલ જલદી, કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના પ્રતિનિષ્ઠિ હાજર હોય તો તેની છાજરીમાં મતપેટીઓનાં બાકોરાં મારવા વગેરે બાબત સીલ કરવાં જોઈશે અને મતદાન મથકે ઉપયોગમાં લીધેલી દરેક મતપેટી ઉપર પોતાના સિક્કાથી તથા કોઈ ઉમેદવાર અથવા તેનો પ્રતિનિષ્ઠિ તેનાં સીલ કરવા માગે, તો તેમના સિક્કાથી સીલ કરવું જોઈશે.

(૨) મતદાન મથકના પ્રમુખ અધિકારી નીચેના કાગળોનાં જુદાં જુદાં પેકેટો કરશે —

- (૧) ઉપયોગમાં લીધેલા ન હોય તેવા મતપત્રોની ચોપડીઓ;
- (૨) પેશ કરેલા મતપત્રો;
- (૩) બગડેલા મતપત્રો;
- (૪) મતદાર યાદીના નિશાની કરેલી નકલો;
- (૫) ઉપયોગમાં લીધેલા મતપત્રોની સ્થળપત્રોની ચોપડીઓ;
- (૬) પેશ કરેલ મતોની યાદી.

આ નિયમ ડેટાન તૈયાર કરેલાં તમામ પેકેટો પર તેણે પોતાના સિક્કાથી અને કોઈ પણ ઉમેદવાર અથવા આવા ઉમેદવારનો પ્રતિનિષ્ઠિ તેના પર તેમના સિક્કા લગાવવા ઈચ્છતો હોય તો તેમના સિક્કાથી સીલ લગાવવું જોઈશે.

(૩) મતગણતરી કરવામાં ન આવે અને સ્થળપત્રોની ચોપડીઓ અને ઉપયોગમાં લીધેલી પ્રતોનો નિયમ ૩૩ ડેટાન નાશ કરવામાં ન આવે ત્યાં સુધી તેનો હવાલો દેવા માટે મતદાન મથકના પ્રમુખ અધિકારીએ, ચુંટણી અધિકારીને અથવા ચુંટણી અધિકારીઓ નીમેલી બીજ કોઈ વ્યક્તિને મતપેટી અને પેકેટો મોકલી આપવાં જોઈશે. તેણે તેમની સાથે તેને સોંપેલા મતપત્રોની સંખ્યા દર્શાવતું અને નીચેનાં શીખકો ડેટાન મતપત્રોનો હિસાબ દર્શાવતું પત્રક પણ મોકલતું જોઈશે —

- (૧) ઉપયોગમાં લીધેલા મતપત્રો;
- (૨) પેશ કરેલા મતપત્રો;
- (૩) બગડેલા મતપત્રો;
- (૪) ઉપયોગમાં લીધા ન હોય તેવાં મતપત્રો;

મત ગણતરી

૨૫. (૧) મતગણતરી કરવામાં પોતાને મદદ કરવા ચૂંટણી અધિકારી નીચે તે વ્યક્તિઓની મદદથી તેઓ પોતાની દેખરેખ તળે મતગણતરી કરશે.

(૨) મતગણતરી માટે નિયમ ૬ ડેટન નક્કી કરેલા દિવસે અને સમયે અને સ્થળે ચૂંટણી અધિકારી, મતદાન વખતે ઉપયોગમાં લીધેલી મતપેટીઓના સંબંધમાં નીચે પ્રમાણે કાર્યવાહી કરશે—

(૧) મતગણતરી માટે મૂકેલી તમામ મતપેટીઓ ગજાશે અને તપાસશે અને ચૂંટણી અધિકારીએ પોતે ખાતરી કરવી કે જે મતપત્રોની એવા સ્થળોએ ગજાતરી કરવાની હોય તેવા મતપત્રો પરાવતી હોય તેવી મતપેટીઓ મળી છે અને તેનો ડિસાખ રાખવામાં આવ્યો છે.

(૨) ત્યાર પછી ચૂંટણી અધિકારી, મતગણતરી વખતે હાજર રહેલા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટોને મતપેટીઓ અને તેનાં સીલો બરાબર છે કે નહિ તેની ખાતરી કરવા માટે તપાસનાની તક આપશે.

(૩) જે ચૂંટણી અધિકારીને એમ ખાતરી થાય કે જે મતપત્રો એવા સ્થળે ગજાવાના હોય તેવા મતપત્રો જેણાં હોય તેવી તપામ મતપેટીઓ મળી છે અને બરાબર છે, તો તે મતપેટીમાં હોય તેવા મતપત્રોની ગજાતરી કરવાનું કામ હાથ પરશે.

(૪) મતગણતરી કરવા માટે દરેક મતપેટીને ખોલવામાં આવ્યા પછી, સ્પષ્ટ માન્ય મતપત્રો, અમાન્ય અને શંકાસ્પદ મતપત્રોથી જુદા પાઉવા જોઈશે. અમાન્ય અને શંકાસ્પદ મતપત્રોને, નિર્ણય માટે ચૂંટણી અધિકારી સમય રજૂ કરવાની જોઈશે. માન્ય મતપત્રો મતગણતરી માટે લેવામાં આવશે અને દરેક ઉમેદવારની તરફેણમાં નોંધાયેલા મતો મતગણતરીમાં મદદ કરવા નિમાયેલી વ્યક્તિઓની સહાયથી ગજાવામાં આવશે.

(૫) ચૂંટણી અધિકારી ઉમેદવારોને અને હાજર હોય તેવા તેમના ચૂંટણી અને મતગણતરી એજન્ટોને જે મતપત્રો, ચૂંટણી અધિકારીના અભિપ્રાય મુજબ અસ્વીકૃત થવાને પાત્ર હોય તે તપામ મતપત્રો તપાસવાની વાજબી તક આપશે પણ તેમને તે અથવા બીજા કોઈ પણ મતપત્રોને અહ્કવા દેશે નહિ.

(૬) તપામ મતપેટીઓમાં રહેલા તપામ મતપત્રોની ગજાતરી પૂરી થયા પછી, ચૂંટણી અધિકારી જુદા પેકેટોમાં સીલ કરાવશે અને આવા મતપત્રોના દરેક પેકેટ પર ગજાવામાં આવેલ મતપત્રો અને અસ્વીકાર કરેલા મતપત્રોનું વર્ણન લખશે.

(૭) ચૂંટણી અધિકારીએ, શક્ય તેટલે સુધી, મતગણતરી કરવામાં સતત કામ કરવું જોઈશે અને જે કોઈ ગાણામાં ગજાતરી કરવાનું હોય, તે ગાણા દરમિયાન, મતપત્રો, પેકેટો અને ચૂંટણીને લગતા બીજી દસ્તાવેજો, તેના પોતાના સિક્કાથી અને જેઓ પોતાના સિક્કા લગાવવા માગતા હોય તે ઉમેદવારો અથવા ચૂંટણી અથવા મતગણતરી એજન્ટોના સિક્કાથી સીલ કરીને રાખવા જોઈશે અને તે સુરક્ષિત કસ્ટરીમાં રાખવા માટે પૂરતી સાવચેતી રખાવવી જોઈશે.

(૮) તપામ મતદાન મથ્યે પર ઉપયોગમાં લીધેલી તપામ મતપેટીઓમાંના મતપત્રોની ગજાતરી પૂરી થયા પછી, ચૂંટણી અધિકારીએ, દરેક ઉમેદવારે મેળવેલા મતોની કુલ સંખ્યા જરૂરવાનું એકનિત પત્રક, તૈયાર કરવું જોઈશે.

૨૬. (૧) ચૂંટણી અધિકારી નીચે પ્રમાણેનું કોઈ પણ મતપત્ર રદ્દબાતલ ગજીને નામંજૂર કરશે —

(૨) જે તેના પર જે કોઈ નિશાની અથવા લખાશથી મતદારને ઓળખાવી શકાય તે નિશાની અથવા લખાશ હોય, તો,

મતપત્રોના  
અસ્વીકાર માટેના  
કારક્ષો

- (અ) જો તેના પર એક પણ મત નોંધો ન હોય, તો.
- (બ) મતદાર મત આપવાને હક્કદાર હોય તે કરતાં વધારે મત તેજો નોંધા હોય, તો.
- (ચ) તેના પર મત દર્શાવતી નિશાની એવી રીતે કરી હોય કે ક્યા ઉમેદવારને મત આપ્યો છે તે નક્કી કરવાનું શંકાસ્પદ બને, તો.
- (ઝ) જો તે બનાવવી મતપત્ર હોય, તો.
- (ઞ) તેને એવી રીતે નુકસાન કર્યું હોય કે અથવા તે એવી રીતે અહેરાઈ ગયું હોય કે ખરા મતપત્ર તરીકે તેને સાબિત કરી શકાય તેમ ન હોય, તો.
- (ઝી) તેના પર, મતદાન મથક ઉપર ઉપયોગ કરવા માટે અધિકાર આપેલા મતપત્રની આકૃતિથી જુદી જ આકૃતિ હોય, તો.

પરંતુ ચુંટણી અધિકારીને ખાતરી થાય કે બંડ (ગ)માં જગ્ઘાવવામાં આવી હોય તેવી કોઈ પણ ખામી તેના પણે અથવા મતદાન મથકે તેની નીચે કામ કરતી વક્તિંઓના પણે કંઈ પણ ભૂલ અથવા ચુક થવાથી થઈ છે, તારે આવી ખામીના કારણો જ માત્ર મતપત્ર નામંજૂર કરવું નહિ.

વધુમાં કોઈ અમુક ઉમેદવારને માટે મત આપવામાં આવેલ છે એવો ઈરાદા જે રીતે મતપત્ર પર નિશાની કરી હોય તે પરથી સ્પષ્ટ લાગે તો મત દર્શાવતી નિશાની અસ્પષ્ટ છે અથવા એક કરતાં વધારે વાર કરી છે, તે જ કારણે કોઈ મતપત્ર નામંજૂર કરવું નહિ.

(૨) ચુંટણી અધિકારીએ, જે મતપત્ર પોતે નામંજૂર કરે તે દરેક ઉપર “આર” એ અક્ષર અને નામંજૂર કરવાનાં કારણો સંક્ષિપ્તમાં પોતાના હાથે લખવાં જોઈશે અથવા રજ્જુર સ્ટેમ્પ વડે જગ્ઘાવવાં જોઈશે.

- (૩) આ નિયમ ડેઢણ નામંજૂર કરેલા તમામ મતપત્રો બંડલોમાં એક સાથે રાખવા જોઈશે.
- (૪) મતપેટીમાં મતપત્રની માન્યતા સંબંધી ચુંટણી અધિકારીનો નિર્ણય છેવટનો ગણાશે.

૨૭. (૧) મતગણતરી પૂરી થયા પછી ઉમેદવાર અથવા તેની ગેરહાજરીમાં તેનો ચુંટણી એજન્ટ મતોની ફરી ગણતરી તે ક્યા કારણસર આવી ફરી ગણતરી કરવા માગે છે તે કારણો જગ્ઘાવીને, પહેલાં ગણતરી કરેલા તમામ કરવા બાબત મતપત્રો અથવા તે પેકી કોઈ પણ મતપત્રની, ફરી ગણતરી કરવા માટે ચુંટણી અધિકારીને લેખિત અરજી કરી શકશે.

(૨) આવી અરજી કરવામાં આવ્યે, ચુંટણી અધિકારી તે બાબતનો નિર્ણય કરશે અને તે આખી અરજી અથવા તેનો અમુક ભાગ મંજૂર કરી શકશે અથવા જો તે તુલ્ય અથવા ગેરવાજળી જગ્ઘાય તો આખી અરજી નામંજૂર કરી શકશે.

(૩) પેટા-નિયમ (૨) ડેડણ ચુંટણી અધિકારીનો દરેક નિર્ણય, લેખિત હોવા જોઈશે અને તે માટેનાં કારણો તેમાં હોવાં જોઈશે.

(૪) જો ચુંટણી અધિકારી પેટા-નિયમ (૨) ડેડણ પૂરેપૂરી અરજી અથવા તેનો અમુક ભાગ સ્વીકરવા નિર્ણય કરે તો તેણે —

- (ક) તેના નિર્ણય અનુસાર મતપત્રો ફરીથી ગણવા જોઈશે.

(ખ) નિયમ ૨પના પેટા-નિયમ (૪)માં નિર્દિષ્ટ કરેલ, નોંધાપેલા મતોની સંખ્યા દર્શાવતું પત્રક એવી રીતે મતોની ફરીથી ગણતરી પછી આવશ્યક હોય તેટલે સુધી સુધારવું જોઈશે. અને

- (ગ) તેણે તેવી રીતે કરેલા સુધારા તથા ચુંટણીનું પરિણામ જાહેર કરવું જોઈશે.

**ચુંટકી અધિકારીએ** ૨૮. (૧) નોંધાયેલા મતોની સંખ્યા દર્શાવતું પત્રક પૂરું થયે, ચુંટકી અધિકારીએ ઉમેદવારોમાંથી ચુંટકીનું પરિણામ જેણે વધુમાં વધુ સંખ્યામાં મતો મેળવ્યા હોય તે ઉમેદવારને ચુંટાયેલા જીહેર કરવાના રહેશે.

**જીહેર કરવા બાબત**

(૨) કોઈ ઉમેદવાર વગે સરખા મતો થયા હોવાનું જણાય અને તે પૈકી કોઈ ઉમેદવાર એક મત ઉમેરવાથી ચુંટાયેલો જીહેર થવાને ઉક્કાર બને, ત્યારે (તે ઉમેદવારોમાંથી) જેને આવો વધુરાનો મત આપવામાં આવેલો હોવાનું ગણાય તે ઉમેદવારને ચુંટકી અધિકારી અને ઉમેદવારોની અથવા દાજુ રહેવા માગતા તેમના ચુંટકી એજન્ટોની હાજરીમાં અને ચુંટકી અધિકારી નક્કી કરે તે રીતે ચિડી નાખીને નક્કી કરશે.

**ચુંટકીનું પરિણામ પ્રસિદ્ધ કરવા રાજપત્રમાં પ્રસિદ્ધ કરવાનું જોઈશે.**

**બાબત**

પરંતુ ચુંટાયેલા ઉમેદવારોનાં નામ પ્રસિદ્ધ કરતાં પહેલાં, ચુંટકી અધિકારી આવા ઉમેદવારોનાં નામમાં કઈ પણ ભૂલો હોય, તો તે સુધ્ધારી શકશે.

**કાર્યવાહીની નોંધ**

**મતપત્રોની કસ્ટડી** ૩૧. મતગણતરી પૂરી થયા પછી, મતપત્રો અને ચુંટકી સંબંધી બીજી તમામ કાગળોને તરત જ સીલ કરવાનું જોઈશે અને ચુંટકી અધિકારીએ તે પોતાની કસ્ટડીમાં રાખવાનું જોઈશે. મતપેટીઓ તે આદેશ કરે તેવી કસ્ટડીમાં રાખવી જોઈશે.

**ચુંટકીના કાગળો રજૂ કરવા અને તપાસવા બાબત.**

**મતપત્રોનો નાશ કરવા બાબત**

૩૨. ગણેલા, નામજૂર કરેલાં અથવા પેશ કરેલા મતપત્રોનાં અને / અથવા તેમની સ્થળપત્રોનાં પેકેટો ચુંટકી અધિકારીની કસ્ટડીમાં હોય ત્યારે, સત્તા પરાવતી કોર્ટના ફુકમ મળ્યા હોય તે સિવાય, ઉઘાડવાનું નહિ અને તેમાંથી વિગતો તપાસવી નહિ અથવા રજૂ કરવી નહિ.

૩૩. ચુંટકીનું પરિણામ જીહેર કર્યાની તારીખથી એક મહિનો પૂરો થયે અથવા ચુંટકીની માન્યતા સામે સત્તા પરાવતી કોર્ટમાં વાંચો ઉકાવવામાં આવ્યો હોય ત્યારે સત્તા પરાવતી કોર્ટના નિર્ણયની તારીખથી ગ્રાન્ઝ માછેના પૂરા થયે, ચુંટકી અધિકારીએ બોર્ડની પૂર્વમંજૂરી લઈને, મતપેટીઓમાંના મતપત્રો અને સીલ કરેલા પેકેટોમાંના મતપત્રો સહિત મતપત્રોનો અને ચુંટકી સંબંધી બીજી દસ્તાવેજનો નાશ કરવો જોઈશે.

**પ્રસંગોપાત ખાલી પડેલી જગ્ગાઓ**

૩૪. આ નિયમોની જોગવાઈઓ, જોઈતા ફેરફારો સાથે પેટા-ચુંટકી લાગુ પડશે, પરંતુ —

(૧) નિયમ ૪ હેઠળ સામાન્ય ચુંટકીની બાબતમાં ઠરાવ્યા પ્રમાણે મલદારયાદી પ્રસિદ્ધ કરવાનું પેટા-ચુંટકીની બાબતમાં આવશ્યક ગણાશે નહિ.

(૨) નિયમો ૭, ૧૦, ૧૧ અને ૧૨માં ઠરાવેલી મુદતો, પેટા-ચુંટકી, બને તેટલી જલદી, પૂરી કરવા માટે ચુંટકી અધિકારી નક્કી કરે તેટલે સુધી ઘટાડી શકશે.

નમૂળો ક  
(જુઓ નિયમ C)  
ઉમેદવારીપત્ર

શિક્ષણ બોર્ડની ચૂંટણી

(દરખાસ્ત કરનારે ભરવું)

- હું, આથી, ઉમેદવાર તરીકે ..... ના નામની દરખાસ્ત કરું છું.  
 ૧. દરખાસ્ત કરનારનું પૂરેપૂરું નામ .....  
 ૨. મતદારયાદીમાં, દરખાસ્ત કરનારનો નંબર .....  
 ૩. ઉમેદવારના પિતા/પતિનું નામ .....  
 ૪. ઉમેદવારનું પૂરેપૂરું ટપાલનું સરનામું .....  
 ૫. મતદારયાદીમાં ઉમેદવારનો નંબર .....

તારીખ ..... દરખાસ્ત કરનારની સહી.

(ઉમેદવારે ભરવું)

હું, ઉપર જણાવેલો ઉમેદવાર, મારા નામની દરખાસ્ત કરવા સંમતિ આપું છું અને આથી જોઈએ  
કરું છું કે —

મે ..... વર્ષની ઉંમર પૂરી કરી છે.

તારીખ ..... ઉમેદવારની સહી.

(ચૂંટણી અધિકારીએ ભરવું)

ઉમેદવારીપત્રનો અનુક્રમ નંબર.....

ઉમેદવારે/દરખાસ્ત કરનારે મને મારી કયોરીમાં ..... તારીખ ..... સમયે  
આ ઉમેદવારીપત્ર આપ્યું હતું.

તારીખ ..... ચૂંટણી અધિકારી.

ઉમેદવારીપત્ર સ્વીકારતા કે નામંજૂર કરતાં ચૂંટણી અધિકારીનો નિર્ણય

મે આ ઉમેદવારીપત્ર ..... અનુસાર તપાસ્યું છે અને નીચે મુજબ નિર્ણય કર્યો  
છે—

તારીખ ..... ચૂંટણી અધિકારી.

જરૂર પડે તો એક વિકલ્ય છેકી નાંખવો

ઉમેદવારીપત્રની પહોંચ અને ચકાસજીની નોટિસ

(ઉમેદવારીપત્ર રજૂ કરનાર વ્યક્તિને આપવી)

ઉમેદવારીપત્રનો અનુક્રમ નંબર.....

.....ઉમેદવારનું ઉમેદવારીપત્ર મને મારી કયેરીમાં.....

તારીખ..... (વાર્ષિક)..... કલાકે આપ્યું હતું.

સ્થળ.....

તારીખ.....

ચુંટણી અધિકારી

નમૂનો ખ

(જુઓ નિયમ ૧૫)

મતપત્ર

.....બોર્ડની ચુંટણી

અનુક્રમ ઉમેદવારનું નામ

ચોકડી

નંબર

૧.

૨.

૩.

૪.

વરે.

## પરિશીલ - ૧

### જૂંગો વિનિયમ : ૨૭(અ) (૧)

રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનરીશાસ્કિક કર્મચારીઓ નીચેના કોઈ પણ કારણોસર શિક્ષાને પાત્ર ઠરશે.

- (૧) ગેરવર્તણુક
- (૨) નૈતિક અધઃપતન
- (૩) બિનકાર્યક્રમતા
- (૪) બોડી દારા લેવાની જહેર પરીક્ષાઓમાં ગેરરીતિનું આચરણ.
- (૫) રાજકારણ અને ચુંટણીઓમાં ભાગ લેવા બાબત.

સ્પષ્ટતા :

- (૧) (૧) ગેરવર્તણુક એટલે વિનિયમોના નિયમો અને નોકરીની શરતોનો ભંગ.  
(૨) સેવા, શિસ્ત અને વર્તણુકના નિયમોનો ભંગ
- (૨) નૈતિક અધઃપતન એટલે ગુજરાત રાજ્યની રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનરીશાસ્કિક કર્મચારીઓએ કોઈ પણ રીતી કે પુરુષ વિદ્યાર્થી સાથે અથવા સંસ્થાના કોઈ પણ કર્મચારી સાથે અનૈતિક કે અખાંગનું વર્તન કર્યું હોય અથવા તેના જેવું બીજું એવું કહી શકાય તેવું કાર્ય કે જેનાથી સમાજ ઉપર કોઈ વિપરીત અસર પડવાની સંભાવના હોય.
- (૩) બિનકાર્યક્રમતા એટલે ૩
  - (૧) વારંવારની સૂચનાઓ આપવા છતાં પોતાને જે ફરજો સોંપવામાં આવી હોય તેને લગતી અધતન વાન માછિતી મેળવવામાં, જીણવવામાં અને ઉપયોગ કરવામાં નિષ્ણલતા.
  - (૨) નિયત કરેલ સમય મર્યાદામાં વર્ષ દરમ્યાન તેને સોંપવામાં આવેલ જે તે વિષયોના અભ્યાસક્રમો તેમનાથી કાણૂં બહારના સંજોગો સિવાય પૂર્ણ કરવામાં નિષ્ણલતા.
  - (૩) શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવકમાંક : મશબ. ૧૦૮૮-૨૮૫૮-૭, તા. ૧૬-૮-૮૮ થી કરેલ છે.
  - (૪) ઉપર જણાવ્યા પ્રમાણેના તેના જેવાં બીજાં કોઈ કાર્યો.
- (૪) બોડી દારા લેવામાં આવતી જહેર પરીક્ષાઓમાં બોડી તરફથી સોંપવામાં આવેલ કોઈ પણ પરીક્ષા સંબંધી કાર્યમાં બતાવેલ ઢીલાશ કે બેદરકારી અથવા નિષ્ણળ આચરેલી ગેરરીતિઓ.
- (૫) (૧) રાજકારણ અને ચુંટણીમાં ભાગ લેવા બાબત એટલે કોઈ પણ શૈક્ષણિક - બિનરીશાસ્કિક કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષનો અથવા સામાન્ય રીતે

રાજકારણમાં ભાગ લેવા કોઈ પણ સંગઠનનો સભ્ય થઈ શકશે નહીં તેમજ બીજું કોઈ રીતે તેની સાથે સંબંધ રાણી શકશે નહીં કે કોઈ પણ રાજકીય ચળવળ અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં, તેમાં મદદરૂપ ફાળો આપી શકશે નહીં કે બીજું કોઈ પણ રીતે મદદ કરી શકશે નહીં.

- (૨) શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવકમાંક : મશબ. ૧૦૮૮-૨૬૫૮-૭-તા. ૧૬-૮-૮૨થી કમી કરેલ છે.

#### ૨૭. (અ) (૨) શિક્ષા :

રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના કોઈ પણ શૈક્ષણિક અને બિન્દેશૈક્ષણિક કર્મચારી વિનિયમ ૨૭ (અ) (૧)માં દર્શાવેલી જોગવાઈઓના ભંગ માટે નીચેનામાંથી કોઈ પણ શિક્ષાને પાત્ર કરશે.

- (૧) ચેતવણી, ટપકો (વેખિત)
- (૨) એક વર્ષથી વધુ નહીં તેવા સમય માટે ભવિષ્યમાં અસર ન કરે તે રીતે ઈજફાની રૂકાવટ.
- (૩) એક વર્ષથી વધુ નહીં તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તે રીતે ઈજફાની રૂકાવટ.
- (૪) બેદરકારી અથવા હુકમના ભંગથી શાળાને થયેલ કોઈ આર્થિક તુકસાન. તેની પાસેથી અથવા તેના પગારમાંથી આપી કે આંશિક વસ્તુલાલાત
- (૫) પાયરી ઉતાર (ફક્ત બિન્દેશૈક્ષણિક કર્મચારીઓ)
- (૬) ભવિષ્યમાં માધ્યમિક શાળાની નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે નોકરીમાંથી બરતરફ.
- (૭) ભવિષ્યમાં માધ્યમિક શાળાની નોકરી માટે ગેરલાયક ઠરે નહીં તે રીતે નોકરીમાંથી રૂખસદ.
- (૮) ફરજિયાત નિવૃત્તિ

#### ૨૭. (અ) (૩) શિક્ષાના પ્રકાર :

- (૧) નાની શિક્ષાઓ : વિનિયમ ૨૭ (અ) (૨)માં દર્શાવેલ કમાંક ૧ થી ૪ સુધીની શિક્ષાઓ
- (૨) મોટી શિક્ષાઓ : વિનિયમ ૨૭ (અ) (૨)માં દર્શાવેલ કમાંક ૫ થી ૮ સુધીની શિક્ષાઓ. વિનિયમ ૨૭ (અ) (૨)માં દર્શાવેલ કમાંક ૧ થી ૪ પરની શાળાના આચાર્યની નીચેના કર્મચારીઓને આવી નાની શિક્ષા કરવાના અધિકાર સંચાલક મંડળ ટ્રસ્ટીઓની મિટિંગમાં અથવા કારોબારી સભામાં ઠરાવ કરીને શિસ્ત અધિકારીને આપવાના રહેશે.

સ્પષ્ટતા - શિસ્ત અધિકારી એટલે જે તે શાળાના આચાર્ય (પ્રથમ વડા)

#### ૨૭. (અ) (૪) નાની શિક્ષા કરવા માટેની પદ્ધતિ :

- (૧) નાની શિક્ષાઓ સામાન્ય રીતે રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના કર્મચારીઓને સોંપવામાં આવેલ ફરજી પ્રત્યેની બેદરકારી ઉપરી અધિકારી/સહકાર્યકર તરફ અખાજાજનું વર્તન, ઉપરી અધિકારીઓના હુકમોના અનાદર જેવા કારણોસર કરી શકાશે અને જ્યારે

કોઈ કર્મચારીને આવી શિક્ષા કરવામાં આવે તે પહેલાં તે કર્મચારીને શિસ્ત અધિકારીએ કારણો દર્શાવતી નોટિસ આપવાની રહેશે અને કર્મચારીએ બે અઠવાડિયામાં તેનો લેખિત જવાબ શિસ્ત અધિકારીને આપવાનો રહેશે. કર્મચારી તરફથી મળેલ લેખિત જવાબ ઉપરથી વિચારણા કરીને કર્મચારીને રૂબરૂ સાંભળીને શિસ્ત અધિકારી ગુનો સાબિત થયાનું જણાય તો નાની શિક્ષાનો હુકમ તેના કારણો સહિત કરશે.

- (૨) આવી નાની શિક્ષા કરવાના શિસ્ત અધિકારીના હુકમ સામે મજકુર કર્મચારી તે (શિક્ષા કરવાના) હુકમ મળ્યાના ડૉ દિવસમાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અપીલ કરી શકશે, જેની જાણ મંડળને/આચાર્યને કરશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીએ સંબંધિત કર્મચારી, આચાર્ય તેમજ સંચાલક મંડળને રૂબરૂ સાંભળવાની તક આપીને અપીલ અંગેની દરખાસ્ત મળ્યેથી દિન રૂપમાં આ અંગેનો નિર્ણય લઈ લાગતા વળગતાઓને તે અંગેની જાણ કરવાની રહેશે અને જો રૂપ દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિર્ણય ન કરે તો શિસ્ત અધિકારીનો નિર્ણય આપણી રહેશે.

આચાર્ય વિદુદ નાની શિક્ષાની ઉપરોક્ત પ્રકારની કાર્યવાહી મેનેજમેન્ટ કરશે.

#### ૨૭ (અ) (૧) મોટી શિક્ષા કરવા માટેની પદ્ધતિ :

- (૧) આજ્ઞાભંગ, ફરજ પ્રત્યેની બેદરકારી, ગેરવર્તણૂક, નૈતિક અધઃપતન, બોર્ડમાં આચરેલ ગેરરીતિઓ માટે તદ્દન કામચાલાઉ ધોરણે નિમાયેલ કર્મચારીઓ સિવાયના રજિસ્ટર ખાનગી માધ્યમિક શાળાના કર્મચારીઓને આ વિનિયમ હેઠળ યોગ્ય રીતે રચવામાં આવેલ તપાસ સમિતિ દ્વારા નિયમસરની તપાસ ચલાયા પછી જ અધિનિયમની કલમ ઉદ્દી જોગવાઈઓ મુજબ (૧) પાયરી ઉત્તાર, ફરજિયાત નિવૃત્તિ, નોકરીમાંથી રૂખસદ અને બરતરફ જેવી મોટી શિક્ષાઓ કરી શકશે.

#### (૨) તપાસ સમિતિની રચના :

- (અ) સંબંધિત શાળાના સંચાલક મંડળના પ્રતિનિધિ
- (બ) સંબંધિત કર્મચારીએ નિયુક્ત કરેલ પ્રતિનિધિ
- (ક) આ ડેટુ માટે જે તે જિલ્લા માટે બોર્ડ તૈયાર કરેલ પેનલમાંથી સંબંધિત શાળાના આચાર્ય પસંદ કરેલ કોઈ પણ એક સત્ય.

નોંધ : આચાર્યની બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડ તૈયાર કરેલ પેનલમાંથી પસંદ કરેલ સત્ય.

સ્પષ્ટતા : આ ડેટુ માટે પ્રતિનિધિ તરીકે વકીલ/ગેડવોકેટની નિમણૂક થઈ શકશે નહીં.

તપાસ સમિતિની કાર્યરીતિ : તપાસ સમિતિની કાર્યરીતિ નીચે પ્રમાણે રહેશે :

- (૧) મેનેજમેન્ટ ખાનગી રજિસ્ટર માધ્યમિક શાળાના કર્મચારી પર આજ્ઞાભંગ, ફરજ પ્રત્યેની બેદરકારી, નૈતિક અધઃપતન, બોર્ડની જહેર પરીક્ષામાં ગેરરીતિ અથવા ગેરવર્તણૂકનો

આકેપ હોય તો કર્મચારીને આકેપો સ્પષ્ટ અને સરળ ભાષામાં લેખિત જગ્ઘાવીને કારણદર્શક નોટિસ આપવી જોઈશે અને કર્મચારીએ આવી કારણદર્શક નોટિસનો જવાબ નોટિસ મળ્યેથી ૧૫ દિવસમાં મેનેજમેન્ટને લેખિત આપવાનો રહેશે. રજિ.પોસ્ટથી ઈનલેન્ડથી મોકલેલ નોટિસ કોઈ કર્મચારી ન સ્વીકારે તો સ્વીકાર્ય બરાબર ગણાશે.

- (૨) મેનેજમેન્ટને કારણદર્શક નોટિસના બદલામાં કર્મચારી તરફથી મોકલો ખુલાસો સંતોષકારક ન જગ્ઘાય અથવા કર્મચારી સમયમર્યાદામાં એવો લેખિત ખુલાસો ન કરે તો તે કર્મચારીની સામે મેનેજમેન્ટ તપાસ સમિતિ નીમવા લેખિત હુકમ કરશે.
- (૩) તપાસ સમિતિની રચના માટે મેનેજમેન્ટ સંબંધિત કર્મચારીને તેનો પ્રતિનિધિ નિયુક્ત કરવા રજિ.એ.ડી./ધાર્થોધાથ લેખિત જગ્ઘાવશે અને સંબંધિત કર્મચારી પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરીને લેખિત જગ્ઘ થયાથી ૧૫ દિવસમાં મેનેજમેન્ટને રજિ.એ.ડી./ધાર્થોધાથ લેખિત જગ્ઘ કરશે. જો કર્મચારી નિયત સમયમર્યાદામાં આવી લેખિત જગ્ઘ કરશે નહીં તો સંબંધિત કર્મચારીને પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરવાનો નથી તેમ માની મેનેજમેન્ટ તપાસ સમિતિની રચના પૂરી કરી શકશે. આવી રીતે નિમાયેલ તપાસ સમિતિ કાયદેસર ગણાશે.

મેનેજમેન્ટ પોતાના પ્રતિનિધિની નિમણૂક મંડળના કરાવથી ૧૫ દિવસમાં કરવી જોઈશે અને તેની જગ્ઘ સંબંધિત કર્મચારીને લેખિત રીતે કરવાની રહેશે. કર્મચારીની બાબતમાં બોર્ડ નક્કી કરેલ પેનલમાંથી એક સભ્ય પસંદ કરી વધુમાં વધુ ૩૦ દિવસમાં સંચાલક મંડળને જગ્ઘ કરવાની રહેશે તથા આચાર્ય સામે તપાસ કરવાની હોય ત્યારે બોર્ડની પેનલમાંથી સભ્યની નિમણૂક માટે મેનેજમેન્ટ જિલ્લા શિક્ષણપદ્ધતિકારીશ્રીને લેખિત રજિ.એ.ડી./ધાર્થોધાથ જગ્ઘ કરવાની રહેશે. આચાર્યએ/જિલ્લા શિક્ષણપદ્ધતિકારીએ તેમને લેખિત જગ્ઘ થયાની ૩૦ દિવસમાં તપાસ સમિતિ ઉપર બોર્ડની પેનલમાંથી એક સભ્યની નિમણૂક કરવાની રહેશે.

- (૪) તપાસ સમિતિ તેની રચના પૂર્ણ થયેથી ૧૦ દિવસમાં સંબંધિત કર્મચારીની વિરુદ્ધમાં આકેપનામું તૈયાર કરશે અને સંબંધિત કર્મચારીને તે આકેપનામું તેનું પુરાવાપત્રક લેખિતમાં પંદર દિવસમાં રજિ.એ.ડી./ધાર્થોધાથ/ઇનલેન્ડ લેટર મોકલશે.
- (૫) ત્યાર બાદ તપાસ સમિતિ સંચાલક મંડળ તથા કર્મચારીને ઓછામાં ઓછી ઉ દિવસની નોટિસ રજિસ્ટર્ડથી આપીને તપાસ હાથ ધરશે. તપાસ સમિતિની કાર્યવાહી દરમાન સંબંધિત કર્મચારી સંચાલક મંડળ કે તેનો કેસ રજૂ કરવા માટે નીમેલ તેમના કોઈ પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે. તેમ છતાં તપાસ સમિતિના સભ્યો કે સંચાલન કે તેમનો કેસ રજૂ કરવા માટે નીમેલ કોઈ પ્રતિનિધિ મંડળ કે સંબંધિત કર્મચારી હાજર રહેશે નહિ તો પણ તપાસ સમિતિની કાર્યવાહી કાયદેસરની ગણાશે.

તપાસ સમિતિ સમક્ષ સંચાલક મંડળ અથવા તેના વતી કેસ રજૂ કરવા માટે નીમાયેલ પ્રતિનિધિએ પોતાનો કેસ રજૂ કરવાનો રહેશે, જેમાં સંબંધિત કર્મચારી વિરુદ્ધ પુરાવાપત્રો તથા મૌખિક નિવેદનો અને સંચાલક મંડળ રજૂ કરેલ સાક્ષીના નિવેદનોનો

સમાવેશ થાય છે. આ નિવેદનો અને પુરાવાઓ તપાસ સમિતિએ લખી લેવાના રહેશે અને તેની પ્રમાણભૂતતાની નિશ્ચાની તરીકે સંબંધિત કર્મચારી તેમજ સંચાલક મંડળ કે તેના દ્વારા કેસ રજૂ કરવા નિયુક્ત થયેલ વ્યક્તિની સહી લેવાની રહેશે. એ કર્મચારી ગેરખાજર હોય તો તે તપાસના કાર્યવાહી દરમ્યાન રજૂ થયેલ પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને રોજગારની નકલો લેખિતમાં રજિ.એ.ડી./ધાર્થોધાય કર્મચારીને પૂરી પાડ્યા બાદ જ તપાસ સમિતિ આગળની કાર્યવાહી ચલાવી શકશે.

- (૬) તપાસ સમિતિની બીજી બેઠકમાં સંબંધિત કર્મચારીઓ પોતાના બચાવ માટે સંચાલક મંડળ તરફથી રજૂ થયેલા પુરાવાઓને સંચાલક મંડળ અથવા તેનો કેસ રજૂ કરવા નિયુક્ત થયેલ પ્રતિનિધિની અને સંચાલક મંડળે રજૂ કરવા નિયુક્ત થયેલ પ્રતિનિધિની અને સંચાલક મંડળે રજૂ કરેલ સાક્ષીઓની ઊલટતપાસ કરી શકશે અને તપાસ સમિતિએ તેને લેખિત નોંધી લેવાની રહેશે.
- (૭) ત્યાર બાદ સંબંધિત કર્મચારીએ તેના બચાવના સમર્થનમાં જો કોઈ સાક્ષી કે પુરાવો રજૂ કરવા હોય તો રજૂ કરવાની તેને વાજબી અને પૂર્ણી તક તપાસ સમિતિએ આપવાની રહેશે અને તેની ઊલટતપાસ સંચાલક મંડળ કે તેના નીમેલા પ્રતિનિધિ કરી શકશે.
- (૮) તપાસ સમિતિએ તપાસની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બે અઠવાડિયામાં સંબંધિત તપાસ દરમ્યાન રજૂ થયેલા બધા જ દસ્તાવેજો, નિવેદનો, પુરાવાઓ વગેરે ધ્યાનમાં લઈ તપાસનો અહેવાલ તપાસના તારશો સાથે સંચાલક મંડળને લેખિતમાં રજૂ કરવાનો રહેશે.
- (૯) સંચાલક મંડળે તપાસ સમિતિનો અહેવાલ મળ્યાના એક અઠવાડિયામાં તપાસ સમિતિના અહેવાલની નકલ સંબંધિત કર્મચારીને રાઇઝર્ટ પોસ્ટથી/ધાર્થોધાય મોકલીને સૂચિત શિક્ષાત્મક પગલાં તેની સામે કેમ ન લેવાં તેવી કારણદર્શક નોટિસ સંબંધિત કર્મચારીને આપવાની રહેશે.
- (૧૦) સંબંધિત કર્મચારીએ આવી કારણદર્શક નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં પોતાનો લેખિત ખુલાસો રજિ.એ.ડી./ધાર્થોધાય કરવાનો રહેશે અને સંચાલકમંડળે કર્મચારી તરફથી કારણદર્શક નોટિસનો ખુલાસો આવ્યા બાદ અને નિયત સમર્થમાં કર્મચારી ખુલાસો ઈરાદાપૂર્વક ન કરે તો પણ દ્રસ્તી મંડળની મિટિંગમાં અથવા મંડળની કારોબારીમાં સંબંધિત કર્મચારી સામેની શિક્ષાનો નિર્ણય લેવાનો રહેશે અને તે પછી તેની ઉપર અધિનિયમ, કલમ ઉદ (૧) (બ) મુજબ કાર્યવાહી કરવાની રહેશે. તપાસ સમિતિના સંચાલક તરીકે સંચાલક મંડળે નિયુક્ત કરેલો પ્રતિનિધિ રહેશે અને તે તપાસ સમિતિની તમામ કાર્યવાહી તેમજે કરવાની રહેશે. તપાસ સમિતિએ તપાસ સમિતિની પ્રથમ બેઠક મળ્યાના ૧૫૦ દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે. સમય મર્યાદામાં તપાસ પૂરી ન થાય તો જિલ્લા શિક્ષાપદ્ધતિકારીશ્રી જે પણ ચૂક થઈ હોય તે બાબતે આખરી નિર્ણય નીચે પ્રમાણે લઈ શકશે.

- (૧) જે કર્મચારી પણ ઈરાદાપૂર્વક ચૂક થઈ હોય તો તપાસ પૂરી થયેલી છેઠેર કરી શકશે.
- (૨) જે સંચાલક મંડળે ઈરાદાપૂર્વક ચૂક કરી હોય તો તપાસ પડતી મૂકવાનું છેઠેર કરી શકશે.
- (૧૧) તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે બોર્ડની પેનલમાંથી નિયુક્ત થયેલ સભ્ય રહેશે.
- (૧૨) કોઈ પજા પજા તરફથી નિમાયેલા પ્રતિનિષિ પોતાના કાખું બઢારના સંજોગોને કારણે હાજર ન રહી શકે તો જે તે પદ્ધતિકાર દિન, ૧૫માં પોતાના નવા પ્રતિનિષિની નિમણૂક કરી લેખિત જ્ઞાન કરશે.

### પરિશિષ્ટ - ૨

#### (૧) સંચાલક મંડળ માટેની ફરજો :

- (૧) સંસ્થાના કર્મચારીઓને સરકારના નીતિનિયમોને આધીન સમયસર અને પૂર્ણપણે નિયમ અનુસારનું વેતન ગ્રાન્ટ મળવાપાત્ર ન હોય તેવા સંજોગોમાં પજા મળે તેની જવાબદારી સંચાલક મંડળની રહેશે.
- (૨) સંસ્થાનાં નાણાંનો સંચાલક મંડળ/આચાર્યશ્રી કે કોઈ પજા કર્મચારી દ્વારા દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી સંચાલક મંડળની રહેશે.
- (૩) રાખ્યીય કે રાજ્યકક્ષાની શિક્ષણ માટેની જે કોઈ નીતિ શિક્ષણ સાથે સંકળાયેલ સૌને વિશ્વાસમાં લઈ સરકારશ્રી તરફથી અમલમાં મુકાય તે સંચાલક મંડળે સ્વીકારવાની રહેશે.
- (૪) સરકારશ્રી તરફથી આપવામાં આવતું અનુદાનના તે અંગેના નિયમોને લક્ષમાં લઈ તથા આચાર્યશ્રીને પૂર્ણ વિશ્વાસમાં લઈ સંપૂર્ણપણે અને સાચી રીતે તેનો ઉપયોગ થાય તે જોવાનું રહેશે.
- (૫) શાળામાં સરકારશ્રીએ નક્કી કરેલ લાયકાત ધરાવતા સભ્ય અને કાર્યદક્ષ કર્મચારીઓની ભરતી થાય તે બાબતે પૂર્ણ સજ્ઞગતા તેજવવાની રહેશે.

#### (૨) આચાર્યની ફરજો :

- (૧) શૈક્ષણિક કાર્યના સંદર્ભમાં ફરજો : વર્ગ કે વર્ગોમાં વ્યક્તિગત રીતે શીખવવાની બાબતમાં શિક્ષક તરીકેનો તેમની ફરજો ઉપરાંત શાળાના વગાને વખતોવખત સરકાર કે બોર્ડ દ્વારા મોકલાતી સૂચનાઓ અનુસાર ફરજો બજાવવાની રહેશે.
- (૨) પોતાની શાળાના બધા વિદ્યાર્થીઓના અસરકારક શિક્ષણ માટે તેમની જવાબદારી રહેશે.
- (૩) આયોજન અને મૂલ્યાંકન માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.
- (૪) શાળાના તમામ વર્ગો માટે સુયોગ્ય શિક્ષણવ્યવસ્થા ગોઠવશે. વિદ્યાર્થીઓની પ્રગતિ મુજબ ઉપલા ઘોરણમાં બઢતી માટે નિયતકાલીન પરીક્ષાઓનું આયોજન કરશે અને સંચાલન કરશે તેમજ અવારનવાર લેવાતી પરીક્ષા માટે પજા આયોજન કરશે/અમલ કરાવશે.

- (૪) હેન્ડબુક, વર્કબુક, લોગબુક વગેરેના નમૂના શાળા સમિતિ સાથે મસલત કરીને નક્કી કરશે અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોશે. (શાળા સમિતિનું : આચાર્ય, સુપરવાઈઝર અને શિક્ષક બે પ્રતિનિધિઓ) બંધારક્ષ.
- (૫) પ્રશિક્ષણ વર્ગોમાં જો અને સફળતાપૂર્ક કરશે.
- (૬) એસ.એસ.સી., એચ. એસ. સી. પરીક્ષાઓમાં સતત નભળા શૈક્ષણિક પરિશામ માટે તે સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારીને પરિજ્ઞામોની સુધ્ધરક્ષા માટે આયોજન કરશે અને અમલ કરાવશે.
- (૭) બીજી શાળામાં કે અન્ય બીજી કોઈ જગ્યાએ નોકરી મેળવવા માટે આચાર્ય/બીજી વડાઓ સંચાલક મંડળ મારફત અરજી કરવાની રહેશે.
- (૮) વર્ગશિક્ષક મારફત અથવા સીધેસીધી વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી ધીમેધી શીખનાર વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણની તેમજ પ્રતિભાશળી વિદ્યાર્થીઓ માટે તેમની પ્રતિભાને વિશેષ વિકસાવે તેવી શિક્ષણની વિશિષ્ટ વ્યવસ્થા કરવાની રહેશે.
- (૩) આચાર્યશીની સામાન્ય વહીવટીય બાબતોના સંદર્ભમાં (વિનિયમો તરીકે) :
- (૧) શાળાના સરળ અને અસરકારક વહીવટ માટે પ્રવર્તમાન નિયમોની મર્યાદામાં મંડળને જવાબદાર રહેશે.
- (૨) (ક) વાલીઓને તેમના બાળકોને શાળામાં નિયમિત રીતે છાજરી આપવા માટે પ્રેરશે.  
(ભ) પોતાના મદદનીશોની મદદથી શાળાએ છાજર નહિ રહેતા બાળકોના વાલીઓનો સંપર્ક સાધીને તેમની ગેરહાજરી અને શાળામાં અનિયમિત છાજરીના કારણોની તપાસ કરીને અને તેમના બાળકો શાળામાં નિયમિત રીતે છાજરી આપે તે માટે સમજીવશે.
- (૩) બોર્ડ દ્વારા નિયત થયેલ ધારાધોરણોના ભાગભામાં રહી તે રજીઓ અને કામના દિવસોની સંખ્યા નક્કી કરશે અને દરવર્ષે શાળાનું સમયપત્રક તૈયાર કરશે.
- (૪) શાળાના તમામ પત્રકો અને રેકોર્ડની યોગ્ય જાળવણી થાય તે જોશે.
- (૫) રમતો અને ખેલકૂદ સહિતની શાળાના સામાન્ય સંયોજન માટે નિયતકાલીન પરીક્ષાઓ લેવા માટે તેમજ સહભાગ્યાસ પ્રવૃત્તિઓ આપોજવા માટે જવાબદાર રહેશે.
- (૬) પોતાની શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુંદરતાની ટેવો વિકસે તે માટે આયોજન કરશે તેમજ વિદ્યાર્થીની સારી વર્તણૂક અને શિક્ષણ માટે યોગ્ય માળખું ઊંઠું કરી દેખરેખ રાખશે.
- (૭) પોતાના મદદનીશોની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેના ઉપર નિયંત્રક રાખશે અને તેનું સંયોજન કરશે તેમજ તેઓની સંતોષકારક કામગીરી અને શિક્ષણ માટે જવાબદાર રહેશે. આ માટે તેના મદદનીશોના શિક્ષણનો લંગ અથવા ગેરવર્તણૂક અંગે જો કોઈ બાબત ધ્યાનમાં આવે એવો કોઈ કેસ હોય તો તે અંગેની જાણ મંડળના સંચાલક મંડળને કરશે.

- (૮) પોતાની અને મદદનીશ્વરોની કામગીરીની લોગબુક રાખશે/રખાવશે.
- (૯) શિક્ષકના દર પખવાડીથે વધુમાં વધુ બે પાઠને નિરીક્ષણ કરશે અને તેની નોંધ કરશે તે જીથની રાખશે અને સમયે સમયે નિરીક્ષણ દ્વારા રાખવામાં આવતી લોગબુક ચકાસણી કરશે.
- (૧૦) માધ્યમિક શાળાત્મક પ્રમાણપત્ર પરીક્ષા અથવા ઉ.મા. શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે ઉ.મા. શિક્ષણબોર્ડ કે સરકાર દ્વારા પરીક્ષક, સમીક્ષક, મુખ્ય સમીક્ષક, પ્રાક્રિકો, નિરીક્ષક, સંવાહક, સહસંચાલક કે એવી બીજી પરીક્ષાને લગતી કોઈ પણ કામગીરી સોંપવામાં આવે તે વિભસનીથ રીતે ગુપ્તના જીથનીને નિષ્ઠા અને પ્રમાણિકપૂર્વક કાર્યક્રમાની જવાબદારી પૂર્વક પાર પાડશે.
- (૧૧) બોર્ડ/ખાતાની સૂચના મુજબ શાળા સંકુલનો યોગ્ય ઉપયોગ કરશે/કરાવશે અને ખાતા/બોર્ડની ખાસ જરૂરિયાત અને શાળાની સામાન્ય જરૂરિયાત મુજબની જુદી જુદી પરીક્ષાઓના સમયસર સંચાલન માટે પોતાની બધી મદદ પૂરી પાડશે.
- (૧૨) વિવિધ વિષયની સમિતિની મીટિંગો બોલાવવાની વ્યવસ્થા કરશે.
- (૧૩) બોર્ડ/ખાતા દ્વારા રાજ્ય દ્વારા કે મંડળ દ્વારા જે તે સમયે માંગવામાં આવે તે બધી માહિતી સમયસર પૂરી પાડવાની રહેશે.
- (૧૪) તમામ પ્રકારની શાળાની મિલકતની યોગ્ય રીતે કાળજ લેશે અને શાળા સંકુલ સ્વચ્છ અને સુંદર રખાય છે તે માટેની ખાતરી કરશે અને શાળાની આવી મિલકતને જે કોઈ નુકસાન થતું હોય તો પોતાના સ્પષ્ટ અવલોકન સહિત મંડળને તે અંગેની જ્ઞાન કરવાની રહેશે.
- (૧૫) શાળાના કર્મચારીઓની સેવાપોથીઓની જીથવક્ષી અને વખતોવખત તેમાં જરૂરી નોંધ કરવા માટે જવાબદાર રહેશે. (આચાર્યની સેવાપોથીની જીથવક્ષી અને વખતોવખત તેમાં જરૂરી નોંધ કરવા માટે મંડળ જવાબદાર રહેશે.)
- (૧૬) પોતાની શાળાના કર્મચારીઓનું સીનીયોરીટી લીસ્ટ તૈયાર કરવામાં અને તેને જીથવવામાં મંડળને મદદ કરશે.
- (૧૭) કર્મચારીઓના ખાનગી અહેવાલ માટે અને કર્મચારીઓને તેની વિરુદ્ધ નોંધ (એડવર્સ રીમાર્ક્સ)ની જ્ઞાન કરવા માટે જવાબદાર રહેશે.
- (૧૮) વિકિતગત ધ્યાન આપીને શાળાના શિક્ષકો/કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરાવશે અને તે સંબંધિત અધિકારીને મોકલી આપવા માટે જવાબદાર રહેશે.
- (૧૯) નિયમો મુજબની જરૂરી એવી શાળાના સ્ટાફની અપૂર્ણતા કે અન્ય વિગત તે સંચાલકોને ધ્યાન પર લાવશે અને શક્ય હોય તે અપૂર્ણતા દ્વારા કરવા પ્રયત્નો કરશે.
- (૨૦) બીજી એવી ફરજી બજાવવી અને બોર્ડ/રાજ્ય સરકાર ખાતા દ્વારા મોકલેલ શિક્ષણને લગતી જરૂરી એવી સૂચનાઓનું પાલન કરશે / કરાવશે.

(૨૧) વિદ્યાર્થી અથવા તેના વાતીની અરજીથી અને નિયત કરેલ ફી જે હોય તો ભર્યેથી શાળાના રજુસ્ટરમાંથી વિગતો કે શાળા છોડવાનું પ્રમાણપત્ર આપશે.

**શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રનું કાપદેસરપણું :**

(૧) શાળા છોડવા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં કાઢી આપવામાં આવે તેના પર આચાર્ય પોતે જ સહી કરેલી હોય તેમજ તેના પર શાળાનો સિક્કો લગાવેલો હોય તો જે તે કાપદેસર ગણાશે.

(૨) શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર તરત જ કાઢી આપવાની માંગજી કે તે માટે કારણો હોય તો આચાર્યની ગેરહાજરીમાં સંચાલક મંડળ અધિકૃત કરેલા અને છલ્યા શિક્ષણાધિકારીએ મંજૂરી રાખેલ વ્યક્તિ શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર પર સહી કરી શકશે.

**શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રનોની નોંધ :**

(૨૨) શાળા છોડવા અંગેના પ્રમાણપત્રમાંની નોંધો ટાઈપ કરેલી નહીં પણ હાથે લખેલી હોવી જોઈશે. જન્મ તારીખ અને વિદ્યાર્થી જેમાં અભ્યાસ કરતો હોય તે ધોરણ (પ્રમાણપત્ર પાના જ અને ૧૦) અંગેની નોંધો અંકડા તેમજ શબ્દોમાં લખવી જોઈશે. જન્મ તારીખ ઈસવીસન પ્રમાણે લખવી. ૧ એપ્રિલ ૧૯૫૭ના રોજ અથવા તે પછી જન્મેલ વિદ્યાર્થીઓની જન્મ તારીખની નોંધ નવા રાખ્યી કેલેન્ડર પ્રમાણે લખવી.

**શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રમાં પરીક્ષામની નોંધ :**

(૨૩) નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીને વિષિસર ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે તે પહેલાં કાર્ષિક પરીક્ષાના પરિક્ષામની જીહેરાત બાદ શાળા છોડવા અંગેનું પ્રમાણપત્ર માંગનાર વિદ્યાર્થીઓને આપવાની શાળા છોડવાના પ્રમાણપત્રના વિશેષ નોંધ ખાનામાં વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવ્યો છે કે તે જ ધોરણમાં રોક્કો છે તે લખવું જોઈશે.

**આચાર્યની નાણાંકીય બાબતોના સંદર્ભમાં ફરજો (વિનિયમ તરીકે) :**

- (૧) શાળાના તમામ પ્રકારની મંડળ દ્વારા આચાર્યને સૌંપાયેલ નાણાંકીય વ્યવહારો માટે મંડળને પ્રવર્તમાન નિયમોને આધીન રહીને જવાબદાર રહેશે.
- (૨) તમામ પ્રકારની સ્કોલરશીપ કે ફી શીપ માટે જરૂરી મંજૂરી મેળવશે. નિયતકાલીન સમય માટેના બીલો બનાવવાની જે તે અધિકારીને મોકલશે અને તેના નાણાં શાળામાં આવેથી તાત્કાલિક ચૂકવણી કરશે / કરાવશે.
- (૩) ફી ભરતા વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને ફી ઉધરાવવાની વ્યવસ્થા કરશે અને કોઈ બેન્કના ખાતામાં તે ખાતા દ્વારા નક્કી થયેલ આવી તારીખ પહેલાં જમા કરાવશે.
- (૪) પરીક્ષા ફી સ્વીકારશે અને માધ્યમિક શાળાની પરીક્ષા કે ઉચ્ચતર માધ્યમિક શાળાત્ પરીક્ષા માટેના આવેદનપત્રનોની ચકાસણી કરશે અને સચિવશ્રી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયત થયેલ તારીખે કે તે પહેલાં તે આવેદનપત્રો અને ફી પહોંચાડશે અને

સદરહુ પરીક્ષા ફીનો હિસાબ રાખશે તેમજ પરીક્ષા તેનોનો હિસાબ અને તેના કાયનલ વિસબળો અહેવાલ નિયત કરેલ સમય મર્યાદામાં બોડીને મોકલશે.

- (૫) જે સકારાત્મક રોકાવામાં આવેલ ન હોય તો સમયસર કર્મચારીઓને નિયત તારીખોમે ઈજફા આપવાની કાર્યવાહી કરશે.
- (૬) શાળાનું માસિક પગાર બિલ બનાવડાવશે અને સંપૂર્ણ ચકાસણી કરીને સહી કરીને શિક્ષણાધિકારીશ્રીએ આ બાબતમાં નિયત કરેલ તારીખ કે તે પહેલાં તેમને મોકલી આપશે.
- (૭) પોતાની શાળાના કર્મચારીઓના પુરવણી બીલો તૈયાર કરાવશે અને શિક્ષણ અધિકારીએ આ બાબતમાં જે તારીખ નક્કી કરી હોય તે તારીખ અથવા તે તારીખ પહેલાં તે બીલો ચકાસણી કરીને સહી કરીને તે અધિકારીને મોકલી આપશે.
- (૮) શિક્ષણાધિકારી તરફથી પગારબીલ, પુરવણી બીલમાંની વસુલાત કરવા માટે કર્મચારીના પગારમાંથી કરેલી રીકવરીની સત્તવે ગૂકવણી કરશે.
- (૯) શાળાનો રોજમેળ તૈયાર કરાવશે અને દરરોજ તેને અપ-ડુ-ટેટ રાખવો અને તેમાં સહી કરી અને ખરાઈ માટે તે જવાબદાર રહેશે.
- (૧૦) બીન સરકારી હિસાબો રાખશે / રખાવશે અને તે નિયમિત રીતે રોજ રોજ તૈયાર રખાવશે શાળા સમિતિ પાસે મંજૂર કરાવશે.
- (૧૧) ખાતાની તેમજ ઓડીટ ખાતાની ઓડીટ નોંધનો તાત્કાલિક પૂર્તિ કરાવશે અને જવાબ આપશે.
- (૧૨) નિયમાનુસાર ખર્ચની જોગવાઈ મુજબ અંદાજપત્રક તૈયાર કરશે અને સંચાલક મંડળની મંજૂરી આપશે.

#### (૪) નિરીક્ષકની ફરજો (વિનિયમો તરીકે) :

પોતાના વર્ગ અને વર્ગોમાં વક્તિગત રીતે શીખવવાની કામગીરી બાબતમાં અને વખતેવખત આચાર્ય કે બીજી વડા વડા આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે શિક્ષક તરીકેની કામગીરી ઉપરાંત નિરીક્ષક નીચેની ફરજો બજ્જવવશે.

- (૧) પોતે જે વર્ગ કે વર્ગોના ઈન્સાર્જ હશે તે માટેની આચાર્યની કે બીજી વડાની ફરજો બજ્જવવામાં તેમને મદદ કરશે.
- (૨) પોતાના ચાર્જમાંના શિક્ષકોની બાબતમાં લોગલુક રાખશે.
- (૩) પોતાના ચાર્જના દરેક શિક્ષકનો પખવાડીયામાં ઓછામાં ઓછા એક પાઠનું નિરીક્ષણ કરશે અન તેની નોંધ રાખશે.

- (૪) પોતાના ચાર્જમાં મુકવામાં આવેલ શિક્ષકો દ્વારા થયેલ કામનું આચાર્ય કે બીજી વડાનો સુચનાઓ મુજબ નિરીક્ષણ કરશે અને તેઓની કર્તાઙ્કું શિક્ષણ અને સમગ્ર કાર્ય જેણું નિબંધું જરૂરિસ નકશાપોથી, એસાઇમેન્ટ વક્ત વગેરે પર નિયંત્રણ રાખશે.
- (૫) આવી બીજી ફરજો બજીવવી અને આચાર્ય કે બીજી વડા દ્વારા આપવામાં આવેલ જરૂરિયાત મુજબની શિક્ષણને લગતી આવી સુચનાઓનું પાલન કરશે.
- (૬) અભિસ્થાપન કોર્સમાં જ્ઞો અને તે સફળતા પૂર્વક પૂર્ણ કરશે.
- (૭) શિક્ષકોની ફરજો (વિનિયમો તરીકે) :
- આચાર્ય કે નિરીક્ષક દ્વારા આપવામાં આવેલ જે કોઈ આવી સુચનાઓ પ્રમાણ શિક્ષક નીચેની ફરજ બજીવશે.
- (૧) પોતાના ચાર્જમાંના વિદ્યાર્થીઓના અસરકારક શિક્ષણ માટે તે મૂળભૂત રીતે જવાબદાર રહેશે.
- (૨) સમયસર શાળામાં હાજર રહેશે અને શિક્ષણ કાર્ય કે વર્ગની કામગીરી પર પોતાનું સમગ્ર ધ્યાન આપશે અને માસના છેલ્લા દિવસે આચાર્યની સુચના મુજબ પુરા થતા માસના પત્રકો પૂર્ણ કરશે અને તે પછીના મહિના માટેના પત્રકો લખશે અને અન્ય પત્રકો અને રીપોર્ટ તૈયાર કરશે.
- (૩) હાજરી પુરશે અને વિદ્યાર્થીઓની હાજરીની નોંધ કરશે.
- (૪) પોતાના વર્ગની હાજરી સુધ્યાવા માટેના તમામ શક્ય પ્રયત્નો કરશે અને ઓછામાં ઓછા જરૂરી હાજરી કરતાં ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને જ્ઞાન કરશે.
- (૫) પોતાના ચાર્જના વિદ્યાર્થીઓ પાસેથી ફી જે કંઈ હોય તો ઉધરાવશે અને આવી ફીની ઉધગણીની રકમ આચાર્ય, સુચના આપે તે મુજબ જમા કરાવશે (જે તે શાળાની પ્રષ્ટાલિકા મુજબ)
- (૬) આચાર્યની સુચના મુજબ જરૂરી પત્રકો અને અન્ય રેકોર્ડ ચોક્કસતાપૂર્વક અને સુંદર રીતે રાખવા માટે જવાબદાર રહેશે.
- (૭) શાળાની પ્રવૃત્તિઓની વ્યવસ્થામાં નિયતકાલીન અને અવારનવાર આચાર્યને તેમની સુચના અનુસાર મદદ કરશે.
- (૮) વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુધ્યક્તાની ટેવો પાડવા માટે અને વ્યવસ્થિત વર્તન માટે માન ઊંચું કરવાની અને આવા ઢેતુઓ માટે આયોજવામાં આવતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ટેવો પાડવા માટે વિદ્યાર્થીઓને પ્રેરશે.
- (૯) ધર્મ, કોમ, લિંગ, જીતિ, શાતિ, ઊચનીચ જેવા કોઈ ભેદભાવ સમાજમાં ન રહે તે માટે સંપૂર્ણ સમાજતાના વ્યવહારોની જાળવણી કરશે.

- (૧૦) શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ વર્ગવાર, વિષયવાર શૈક્ષણિક આયોજન કરશે.
- (૧૧) પોતાના શિક્ષણકાર્યની પૂર્વતૈપારી કરવી અને નીચે જગ્યાબાટું મુજબ તેની ખૂલ ટૂંકી નોંધ કરવી. શિક્ષકોએ લોગલુક નિયમિત ભરવાની રહેશે.
- (૧) (૧) તારીખ (૨) વર્ગ (૩) વિષય
- (૨) શીખવવાના તાસ દરમ્યાનમાં શીખવવાનો એકમ (જેટલો ભાગ શીખવવાનો હોય તો)
- (૩) જેના ઉપર ભાર મૂકવાનો હોય તેવા વિશિષ્ટ મુદ્દાઓ જેવા કે શબ્દો, શબ્દસમૂહ, કહેવતો, માન્યતાઓ, સિદ્ધાંતો, સૂત્રો, પ્રસંગો વગેરે કે જે અભ્યાસક્રમ પર આધારિત હોય.
- (૪) નિર્દેશન માટેના શૈક્ષણિક સાધનો— જો કોઈ હોય તો
- (૫) ગૃહકાર્યનો પ્રકાર જેવા લેખિત કાર્ય, મુજબાઠ, વિશિષ્ટ વાંચન
- (૧૨) શૈક્ષણિક કાર્ય કરતી વખતે ખાસ ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન, ગજિત, ચિત્રકલા વગેરે શાળમાં પ્રાપ્ત હોય તે શૈક્ષણિક ઉપકરણનો ઉપયોગ કરશે. વિજ્ઞાન શિક્ષક તમામ પ્રયોગોનું નિર્દેશન કરશે અને અભ્યાસક્રમ મુજબ ચુસ્ત રીતે વિદ્યાર્થીઓ પાસે, પ્રાયોગિક કાર્ય કરાવશે.
- (૧૩) કામના કરેલ ખરેખર આયોજન અને વર્ગક્રમ વચ્ચે સુસંગતતા રાખશે અને તેમાં જો કોઈ ઊંઘપ રહે તો દર મહિનાની આખરે જે તે વર્ગના પત્રોમાં તેના કારણની નોંધ કરશે અને આ બાકી રહેલ કાર્યની અને સરલર કરવા માટે સંબંધિત આચાર્ય કે નિરીક્ષકનો સંપર્ક સાધી તે માટે આયોજન કરશે.
- (૧૪) વિદ્યાર્થીઓને અઠવાડિક ગૃહકાર્ય આપવું જેથી દરેક વિદ્યાર્થી એક સમગ્ર વર્ષમાં દરેક વિષયદીઠ ડૉ અઠવાડિયાનું ગૃહકાર્ય પૂર્ણ કરવા માટે સમર્થ બની શકે. પણ જ્યાં શિક્ષકને વિષયના એક ભાગની કામગીરી આપવામાં આવી હોય, જેવી કે સમાજવિદ્યામાંથી ફક્ત ઇતિહાસ કે ભૂગોળ અથવા પ્રાકૃતિક વિજ્ઞાનમાંથી ફક્ત ભૌતિક કે રસાયન વિજ્ઞાન વગેરે તો આવા ખાસ ભાગ માટે પ્રમાણસર ગૃહકાર્યની સંખ્યામાં ઘટાડો કરવો.
- (૧૫) સામાન્ય રીતે વિદ્યાર્થીઓને લખેલ નિબંધ દર આંતરે અઠવાડિયે જરૂરી ક્ષતિઓ બતાવી તપાસશે અને સૂચનો કરશે.
- (૧૬) આચાર્ય દ્વારા તૈયાર કરેલા આયોજન મુજબ પોતાને સોંપવામાં આવેલ વિષય માટે બીજી પરીક્ષાઓ માટે સત્રાંત પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રો કાઢશે અને જીવાખવહીઓ ન્યાયપૂર્વક અને સમયસર તપાસશે.
- (૧૭) માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા અથવા ઉ.મા.શિ. બોર્ડ કે સરકાર દ્વારા પરીક્ષક, સમીક્ષક, મુખ્ય સમીક્ષક, પ્રાશ્નિક, નિરીક્ષક, સંવાદક સહસંચાલન કે એવી બીજી પરીક્ષાને લગતી કોઈ પણ કામગીરી સોંપવામાં આવે તે વિચસનીય રીતે, ગુપ્તતા જગદીને નિષાં અને પ્રામાણિકતાપૂર્વક કાર્યદક્ષતાથી જવાબદારીપૂર્વક પાર પાડશે.

- (૧૮) બીજું શાળામાં કે અન્ય બીજું કોઈ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેની એક નકલ આચાર્યને આપશે અને એડવાન્સ નકલ પરખારે ભોકલી શકશે.
- (૧૯) પ્રોફીલમાં જરૂર અને વર્ગમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરશે.
- (૨૦) પોતાના ચાર્જમાંના ડેડસ્ટોક રાજીસ્ટરમાં ખરીદેલ વસ્તુઓની નોંધ કરશે અને વર્ધને અને વ્યવસ્થિત કરશે અને ખોવાયેલ કે અન્ય કોઈ કારણોસર કોઈ વસ્તુ કબી કરવાની થાપ તો તેની કારણોસર નોંધ આચાર્યશ્રીને રજૂ કરશે.
- (૨૧) અભિવ્યક્તિ કોર્સમાં જરૂર અને સફળતાપૂર્વક પૂર્ણ કરશે.
- (૨૨) આવી બીજું કોઈ કરજો બજેવશે અને શાળાના આચાર્ય, બીજી વડા કે નિરીક્ષક દ્વારા આપવામાં આવતી કે જરૂરિયાત મુજબની શિક્ષણને લગતી આવી બીજું સૂચનાઓનું નિયત કામ અને હાજરીના સમય દરમ્યાન પાલન કરશે. શક્ય હોય ત્યાં સુધી અગાઉથી રજી મંજૂર કરાવશે. સમયસર વર્ગમાં તાસ લેવા, પ્રાર્થનામાં હાજરી આપશે અને આચાર્યની સૂચના મુજબની કામગીરી કરશે.
- (૨૩) કોઈ શિક્ષક તેના શૈક્ષણિક ઘ્યાલો રજૂ કરતી વખતે કે અભિવ્યક્તિ વખતે શાળા તરફથી મળતી સુવિધાઓનો ગેરઉપયોગ કરશે નહિ.
- (૨૪) કોઈ કર્મચારી પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી, રાજકીય હેતુ માટે સંસ્થાના અથવા મંડળની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકશે નહિ.
- (૨૫) દરેક શિક્ષક વિદ્યાર્થીઓના પરીક્ષણમાં નિષ્પક્ષપાત્રી રહેશે અને ઈચ્છાપૂર્વક રીતે વધારે કે ઓછા ગુણ આપી શકશે નહિ અથવા અન્ય કોઈ ભૂમિકા પર વિદ્યાર્થીને તેનો ભોગ બનાવશે નહિ.
- (૨૬) કોઈ શિક્ષક ખાનગી કોણીંગ કલાસ ચલાવી શકશે નહિ અથવા તેમાં નોકરી કરી શકશે નહિ.
- (૨૭) કોઈ શિક્ષક વેકેશન દરમ્યાન કે ૨૫૦ દરમ્યાન પોતાના સરનામામાં જો ફેરફાર થયો હોય તો તેની જ્ઞાન આચાર્યને મુખ્ય વ્યવસ્થાપક અથવા પ્રમુખને (લાગુ પડતું હોય તે) અવશ્ય કરવાની રહેશે.
- (૨૮) વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, કાર્યકરો, આચાર્ય, વાલીઓ, બિનરોકાણિક કર્મચારીઓ વગેરે તમામ સાથે તેનું વર્તન વિવેક અને નમ્ર હશે.
- (૧) (૧) દરેક શિક્ષક પોતે જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં જે તે સમયે અમલમાં હોય તેવા કેફી પીજાં કે માદક દ્વયોની અસરમાં હશે નહીં અને તે કાળજી રાખશે તેની ફરજની કામગીરી કોઈ પણ સમયે આવા પીજાં માદક દ્વયોની અસરમાં રહેશે નહિ.
- (૨) કોઈ પણ કેફી પીજાં કે માદક દ્વયોની અસરમાં હશે નહીં અને તે કાળજી રાખશે તેની ફરજની કામગીરી કોઈ પણ સમયે આવા પીજાં માદક દ્વયોની અસરમાં રહેશે નહિ.

- (૨૮) મુખ્ય શિક્ષકે, બીજી શિક્ષકે અને / અધ્યવા ઉપરીએ સૌંપેલું બીજું કોઈ પણ કામ કરશે.
- (૯) કારકુની સ્થાનની ફરજો (વિનિયમો તરીકે) :
- (૧) આર્થિક બાબતોના સંદર્ભમાં ફરજો :
- (૧) શાળાની બાબતો : લેવડાયડના ડિસાબ રાખવા.
  - (૨) સત્ર ફી ની વસ્તુલ કરેલી રકમનો ડિસાબ રાખવો.
  - (૩) વિકાસ ફડનો ડિસાબ રાખવો.
  - (૪) માધ્યમિક વિભાગની વસ્તુલ કરેલ રકમના અને લેવડાયડના જુદા ડિસાબો રાખવા.
  - (૫) ફી ઉધરાવવી, તેની નોંધ પત્રકમાં કરવી, પહોંચો આપવી અને તેનો ડિસાબ રાખવો.
  - (૬) બેંકમાં રકમો જમા કરાવી, બેંકમાંથી રકમો ઉપડાવી અને બિલોની જરૂરી ચકાસણી કરવી.
  - (૭) ડેઝટોક રખાસ્ટર રાખવા - તૈયાર કરવાં.
  - (૮) પગારબીલો, પુરવજી બિલો તૈયાર કરવા અને સંબંધિત અધિકારીને તે સમયસર મોકલી આપવા વગેરે.
  - (૯) આવકયેચા, સી.ડી.એસ., સી.ડી.ડી., વ્યવસાયયેચે, વીમો તમામ મ્રકારના વેરાના સંદર્ભમાં કામગીરી કરવી.
  - (૧૦) વ્યવસાય વેરો કે અન્ય કોઈ પણ વેરો જે કંઈ વસ્તુલ કરેલ હોય તે રકમ જમા લેવી.
  - (૧૧) ડિસાબો ઓડિટ કરાવવા.
  - (૧૨) ખાતામાં ડિસાબી પત્રકો મોકલવા.
  - (૧૩) ડિસાબોની તપાસણી માટે જરૂરી તૈયારી કરવી અને તેની તપાસણી કરાવવી.
  - (૧૪) બેંકમાંથી ફી જમા કરાવવી.
  - (૧૫) સામયિકોનું લવાજમ ભરવું.
  - (૧૬) પગાર સિવાયની ગ્રાન્ટને લગતી બાબતોની દરકાર રાખવી.
  - (૧૭) આચાર્ય તરફથી સૂચનાઓ મુજબ શાળાને જરૂરી એવી ચીજવસ્તુઓની ખરીદી કરવી.
  - (૧૮) તમામ સભ્યોના પે ફિક્સેશન અને એન્સાનને સંબંધિત તમામ કામગીરી કરવી.

- (૧૮) આચાર્ય સાથે ચર્ચા કરીને અંદરૂપત્ર તૈયાર કરવા અને તેનો અમલ કરવો.
- (૨) શૈક્ષણિક સ્ટાફના સંદર્ભમાં કારકુની સ્ટાફની ફરજો (વિનિયમો) :
- (૧) શૈક્ષણિક સ્ટાફને લગતી માહિતી ખાતાને પૂરી પાડવી.
  - (૨) તેમની સેવાપોથીઓ અને રજના હિસાબો તૈયાર કરવા.
  - (૩) તેમના પગારબિલ તૈયાર કરવા અને તેમની સહીઓ તથા પ્રતિસહીઓ લેવી.
  - (૪) વખતોવખત સેવાપોથીઓમાં નોંધો કરવી અને તે નોંધોની સામે તેમની સહીઓ લેવી.
  - (૫) તેઓના પ્રોવિડન્ડ ફંડના હિસાબો રાખવા.
  - (૬) પ્રોવીડન્ડ ફડમાંથી એડવાન્સ/લોન મંજૂર કરવા માટેની અરજીઓ મોકલી આપવી.
  - (૭) તેઓના નિમલૂકપત્રો તૈયાર કરવા.
  - (૮) તેઓના પેન્શન પેપર્સ તૈયાર કરવા.
  - (૯) તેઓના વાર્ષિક આવકપત્રકો તૈયાર કરવા.
  - (૧૦) આચાર્યની સૂચના મુજબ છૂટા કરવા માટેની ધારી (મેમો) તૈયાર કરવા.
  - (૧૧) આવકદેરો, વ્યવસાય વેરો, સી.ઈ.ડી. વીમો, સી.ડી.એસ. વગેરે અંગે જે કઈ પગારમાંથી કૃપાત હોય તે રકમોની ચુકવણી કરવી.
  - (૧૨) તેઓના પગાર ફિક્સેશન સંબંધિત કામગીરી કરવી.
  - (૧૩) શિક્ષકોની નોકરીની બાબતોને લગતી ફાઈલો તૈયાર કરવી.
  - (૧૪) બીજી શાળામાં બીજી કોઈ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેની એક નકલ આચાર્યને આપશે અને એડવાન્સ પરલારે મોકલી આપશે.
- (૩) ઓફિસને લગતી અન્ય ફરજો :
- (૧) સરકાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે મંડળ અને અન્ય મંડળ કે અધિકારી સાથે કરવાના પત્ર વ્યવહાર તૈયાર કરવા.
  - (૨) આવકજવકના પત્રકો તૈયાર કરવા.
  - (૩) વખતોવખત સરકારના ખાતા/ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે અન્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચનામોનું પાલન કરવું અને જ્યારે જરૂરી હોય ત્યારે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓના ધ્યાન ઉપર તે સૂચનામો લાવવી.

- (૪) પત્રો પગારભિલ અને સ્ટેટમેન્ટ તૈયાર કરવા અને તેને ટાઈપ કરવા.
- (૫) આવશ્યક માહિતી વાલીઓને પૂરી પાડવી.
- (૬) હાજરીપત્રક તૈયાર કરવું અને પગાર સિવાયની ગ્રાન્ટની બાબતોની કલેઇઝના સંદર્ભમાં કામગીરી કરવી.
- (૭) વિષયવાર ફાઈલ રાખવી, નોંધ કરવી અને શિક્ષણ ફિન્ડું તેમજ શાળાના સામાન્ય રાશિસ્ટર તૈયાર કરવા.
- (૮) શાળાકીય કામગીરીને લગતાં જરૂરી સ્ટેટમેન્ટ્સ, પત્રોનાં ફોર્મ, સાઈકલોસ્ટાઇલ કરાવવા.
- (૯) શાળાકીય પરીક્ષાઓ, સરકાર દારા લેવામાં આવતી પરીક્ષાઓ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, તેમજ હિન્દી, અંગ્રેજી, ચિત્ર વગેરેની પરીક્ષાઓને લગતી કામગીરી કરવી.
- (૧૦) હાજરીપત્રકોની ચકાસણીમાં આચાર્યને મદદ કરવી.
- (૧૧) પોતાને સોંપવામાં આવતી જે. કંઈ આવી બીજા કાર્યાલય સંબંધિત ફરજો હોય તે બજીવલ્લી.
- (૧૨) અભિસ્થાપન કોર્સમાં જવું અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા.
- (૪) વિદ્યાર્થીઓના સંદર્ભ ફરજો (૧) સામાન્ય ફરજો :
- (૧) શાળા છોડ્યાના પ્રમાણપત્રો અને બીજા પ્રમાણપત્ર તૈયાર કરવા અને ખરી નકલોને લગતી કામગીરી કરવી.
  - (૨) રાજ્ય પરિવહન અથવા રેલવે કન્સેશન અને બીજા કન્સેશનને લગતી માહિતી પૂરી પાડવી.
  - (૩) મળેલ ફોર્મ્સ અને પ્રમાણપત્રોની ચકાસણી કરવી.
  - (૪) રમત-ગમત, હરીફાઈઓ અને અન્ય બીજી મૃવૃત્તિઓ જેવી કે નાટક વગેરેને લગતી પત્રવ્યવહાર કરવો.
  - (૫) પોતાને સોંપવામાં આવેલ અન્ય બીજી ફરજો હોય તે બજીવલ્લી.
- (૫) વિદ્યાર્થીઓની ફી માં કન્સેશન કે સ્કોલરશીપને લગતી ફરજો :
- (૧) ફી માં રાહત અંગેના ફોર્મ્સ વહેંગવા, તે ફોર્મ્સ પરત ઉધરાવવા, તેની ચકાસણી કરવી અને યોગ્ય પત્રકમાં મોકલી આપવા અને કિલ્લા પંચાયત કે જ્યાં જરૂરી હોય ત્યાંથી મંજુર કરાવવા અને ત્યાર બાદ તેના બિલો તૈયાર કરીને મોકલાવી અને તે બીલોની રકમ યોગ્ય જીજાકારી નીચે જે તે વિદ્યાર્થીને જ્ઞાન કરવી.

(૨) હાઇસ્કુલ અને ધ્યારસેકન્ડરી સ્કોલરશીપને લગતી (તેમની હાજરીને લગતી માહિતી ખાતાને જણાવવી) શાળાના કર્મચારીઓનાં બાળકો, રૈન્જિકો સ્વતંત્ર લડવૈધાના બાળકો અને અપંગ વિદ્યાર્થીઓ વગેરેની માન્ય ફી રહેત.

(સ્કોલરશીપને લગતા પત્રવ્યવહાર, બીલો તૈયાર કરવા તથા રકમની વહેંચણી કરવા સહિત કામગીરી કરવી.)

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાના સંદર્ભમાં ફરજ :

- (૧) નિયમિત વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરાવવા અને માહિતી પૂરી પાડવી, માહિતી ભરવી, (શાળાની પ્રણાલીકા મુજબ)
- (૨) તે આવેદનપત્રો અને તેની ફી સરકારમાં કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં (જે પ્રમાણે મોકલવાની હોય તે પ્રમાણે) સમયમર્યાદામાં મોકલી આપવી.
- (૩) પરીક્ષા ફીનો ડિસાબ રાખવો.
- (૪) પરીક્ષા ફોર્મની ઓફિસ કોપી તૈયાર કરવી.
- (૫) પરીક્ષામાં જીએર થવાના સમયે ગુણપત્રો વહેંચવા.
- (૬) પરીક્ષાને લગતી બ્યવસ્થા અંગે પત્ર બ્યવહાર કરવો.
- (૭) સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ / ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રોની વહેંચણી કરવી.
- (૮) પરીક્ષા વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવી.
- (૯) પ્રવેશકાર્ડની વહેંચણી કરવી. (રસીદ)
- (૧૦) સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો વહેંચવા.
- (૧૧) પેપરના રીચેકિંગ માટે આવેલ અરજુઓનું બારીકાઈથી અવલોકન કરતું અને મળે તે તરત જ અરજુઓ બોર્ડમાં મોકલવી.
- (૧૨) પરીક્ષાના પરિણામોની સામાન્ય રજીસ્ટરમાં નોંધ કરવી.
- (૧૩) કુલીકેટ પ્રમાણપત્રો આપવામાં આચાર્યને મદદ કરવી.
- (૧૪) બોર્ડ દ્વારા જ્યારે જ્યારે અને જે રીતે જરૂરી માહિતી માંગવામાં આવે ત્યારે મોકલવામાં મદદ કરવી.

- (૧૫) ખાનગી વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા તેમજ તે બોર્ડમાં મોકલવા અને આ સંબંધમાં પત્ર વ્યવહાર કરવો.
- (૧૬) નેશનલ સ્કોલરશીપને લગતો પત્રવ્યવહાર કરવો.
- (૧૭) વિવિધ પરીક્ષાઓની વ્યવસ્થામાં આચાર્યને મદદ કરવી અને આવી પરીક્ષા માટે સ્કૂલમાં નિયત કરેલા નિયમો પ્રમાણેની કાર્યક્રમતા અને શિક્ષણ માટે જવાબદાર રહેશે.
- (૧૮) ભરતી અને નિમણુંકની સધળી કાર્યવાહી આચાર્યની સૂચના મુજબ તેણે કરવાની રહેશે.

નોંધ : એક કરતાં વધારે કારકુનની જગ્યા ધરાવતી શાળાની બાબતમાં બિનરૈકાંપિક કર્મચારીઓના કામના નિરીક્ષણ, નિયંત્રણ અને સંપોજનમાં આચાર્યને સૌથી સ્ક્રિનિયર વ્યક્તિ (કારકુન) મદદ કરશે. અને આચાર્ય દ્વારા કારકુનનો વચ્ચે તેમની ફરજોને અનુકૂળ તરીકે વહેંચી આપવી.

#### પટાવાણા :

- (૧) શાળાના શરૂ થવાના સમય પહેલાં એક કલાક અગાઉ અને શાળાના સમય પૂરો થયા બાદ એક કલાક સુધીનો સમય ફરજ પર હાજર રહેવાનો રહેશે.
- (૨) સંસ્થાએ નક્કી કરેલો ગણવેશ ફરજાત પણ પહેલવાનો રહેશે.
- (૩) કચેરીને લગતાં કાર્યો ઉપરાંત વર્ગસંકાઈ અન્ય પ્રકારની સફાઈની જવાબદારી સ્વિકારવાની રહેશે.
- (૪) ટપાલને લગતું કામકાજ જેણું કે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, ટ્રેઝરી વગેરે જગ્યાઓ માટે આચાર્યશ્રી સોચે તે કરવાનું રહેશે.
- (૫) જરૂર પડે તો સંસ્થાનું રાચરચીલું ઘોઝ્ય જગ્યાએ ગોઠવણી કરવાનું કાર્ય કરવાનું રહેશે.
- (૬) સંસ્થાની સ્થાનિક કે જાહેર પરીક્ષાઓના સમય દરમ્યાન આચાર્યશ્રી જે કોઈ કામગીરી બતાવે તે બજીવાની રહેશે.
- આચાર્યશ્રી, શિક્ષકશ્રી તરફથી શાળા માટે સોંપાયેલ અન્ય કામગીરીઓ જેવી કે પાણી પાણું, નોટો લાવવી વગેરે.
- (૭) બીજી શાળામાં કે બીજી કોઈ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેની એક નકલ આચાર્યને આપશે અને એડવાન્સ નકલ પરમારે મોકલી શકાશે.

## નમૂળો ૧

ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ કેદા નવી માધ્યમિક શાળાના રજિસ્ટ્રેશન માટેની અરજનો નમૂળો.

સૂચનાઓ (૧) કોલમો ૮(બ), દમાંની માહિતી, અલગ રીતે તૈપાર કરેલ અને અનુકૂળે ક. ખ. નિશાની કરેલ અને અરજના મુજ્ય નમૂળા સાથે જોડેલ, પત્રકમાં આપી શકાશે. (૨) બિલાક્ષ સાથેની અરજની પહેલી નકલ, સેકેટરી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને સીધી મોકલવી જોઈશે. તેની સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગાંધીનગરનો ડિમાન્ડ પ્રાઇસ્ટથી જ્વાતે અગાઉના શૈક્ષણિક વર્ષના ડિસેમ્બર મહિનાની ૧લી તારીખે અથવા તે પહેલા તેમને મળે તે રીતે રૂ. ૨૫,૦૦૦ ફી મોકલવી જોઈશે એ (ડી સિવાય) તેની બીજી નકલ, જિલ્લા શિક્ષણ અધિકારીને એવી વિનંતી સાથે મોકલવી કે તેઓ તે (અરજન) તપાસ રિપોર્ટ અને અભિપ્રાય સાથે બોર્ડના સેકેટરીને મોકલે. (૩) સ્વયંસ્પષ્ઠ વિગતો સહિત યોગ્ય રીતે ભરી ન હોય અને પૂરતી ફી ભરી ન હોય તેવી અરજનો, વિચારક્ષામાં દેવારો નહિ.

પ્રેષ્ટક :

પ્રતિ,

સેકેટરી,

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

સેક્ટર નં. ૧૦ બી, સચિવાલય પાસે,

ગાંધીનગર.

સાહેબ,

હં

(પૂરેપૂરું નામ)

સંચાલક મંડળનું નામ

ના. વતી, આથી, ૨૦ \_\_\_\_\_ ના. જૂન મહિનાથી \_\_\_\_\_ જિલ્લાના \_\_\_\_\_  
તાલુકાના \_\_\_\_\_ ગામમાં અમારી મારફત શરૂ કરવા ધારેતી \_\_\_\_\_

(સૂચિત નવી માધ્યમિક શાળાનું નામ)

ના. રજિસ્ટ્રેશન માટે અરજ કરું છું.

૨. જરૂરી વિગતો નીચે પ્રમાણે છે :

વિગતો

૧. સૂચિત માધ્યમિક શાળાનું નામ અને તેનું ટપાલનું પૂરેપૂરું સરનામું :
૨. (ક) શાળાનું સ્થળ, નગર અથવા શહેરમાં આવેલી હોય તો, લતાનું નામ અને ગ્રામ વિસ્તારમાં આવેલી હોય તો, ગ્રામ, તાલુકા અને જિલ્લાનું નામ :
  - (બ) છેલ્લી વસ્તી ગઝતરીના અંકડા પ્રમાણે તેની વસ્તી
૩. શાળાનો પ્રકાર, (સાધારણ માધ્યમિક શાળા અથવા વ્યવસાયલક્ષી માધ્યમિક શાળા, ઉત્તર બુનિયાદી શાળા અથવા કોઈ પક્ષ બીજી શાળા છે કે કેમ તે નિર્દિષ્ટ કરાયું.)
૪. (૧) સંચાલક મંડળ, (૨) પ્રમુખ, (૩) સેકેટરી, (૪) પત્રવ્યવહાર કરનાર,

## (૫) લાપકાતો સાથે શાળાના ઉપરીનું નામ :

૫. જે મંડળ આ શાળાનો વહીવટ કરવાનું છે તે મંડળ, મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૬૦ અથવા મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ રજિસ્ટર થયેલ છે કે કેમ : (રજિસ્ટ્રેશન પ્રમાણપત્રની અધિકૃત નકલ બીડવી જોઈશે. મંડળના બંધારણની નકલ, પણ બીડવી જોઈશે. સંચાલક મંડળ અથવા ટ્રસ્ટના દરેક સંખ્યાનાં પૂરેપૂરાં નામ અને વ્યવસાય પણ જણાવવાં જોઈશે.)

## ૬. શાળા શરૂ કરવાની સૂચિત તારીખ :

- (ક) જે વિષયો માટે શાળામાં શિક્ષણ આપવાનું હોય તે વિષયો.
- (ખ) જે માધ્યમ અથવા માધ્યમોમાં શાળામાં શિક્ષણ આપવાનું હોય તે માધ્યમ અથવા માધ્યમો.

## ૭. શિક્ષણ આપવાના વિસ્તારની વિગત :

- (ક) સૂચિત શાળા, શહેરમાં આવેલી હોય તો, શહેરની અધતતન વસતી અને નવી શાળા શરૂ કરવા ધાર્યું હોય તે લાલાભાંની વિધમાન માધ્યમિક શાળાઓની સંખ્યા આપવી.
- (ખ) સૂચિત શાળા, ગામમાં આવેલી હોય તો, ગામ માટે અને ૮ ડિલોભીટરની ત્રિજ્યામાં આવેલાં આજુબાજુનાં ગામ માટે નીચેના કોષ્ટક માટે માહિતી આપવી.  
વિસ્તારમાંનાં ગામ, રસ્તા, નદી અથવા વહેળાની પૂરેપૂરી વિગતો આપતો, યોગ્ય માપવાળો ચોક્કસ નકશો, આ સાથે જોડવો જોઈશે.
- (ગ) સૂચિત શાળા શહેરમાં હોય અને નજીકનાં ગામોને પણ લાભ મળવાનો હોય તો તેમની વિગતો નીચેના કોષ્ટકમાં આપવી જોઈશે :
- (ધ) વર્ગવાર અપેક્ષિત વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ?

અનુક્રમાંક	ગામનું નામ	વસતી	મુજા ગામથી અંતર	ત્યાં પૂરેપૂરી વિકસિત પ્રાથમિક શાળા છે	કેમ
૧	૨	૩	૪	૫	

આ અરજના વર્ષ દરમિયાન જમા  
ધોરણમાં વિદ્યાર્થીઓ, છોકરાઓ અને  
છોકરીઓની સંખ્યા

આ ગામોમાં આજ તારીખ  
સુધી માધ્યમિક શિક્ષણ કેવી  
રીતે મળતું હતું ?

વિશેષ નોંધ

૬

૭

૮

c. સૂચિત શાળાની સૂચિત જગાથી ૧૦ કિલોમીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોમાં વિદ્યમાન રાઇસ્ટર થયેલી માધ્યમિક શાળાની વિગતો નીચે પ્રમાણે આપો :

- (૧) અનુકૂળમાંક :
  - (૨) શાળાનું નામ
  - (૩) જ્યાં (શાળા) આવેલી હોય તે ગામનું નામ :
  - (૪) સૂચિત શાળાથી સાચું અંતર :
  - (૫) સંચાલક મંડળનું નામ :
  - (૬) સ્થાપનાનું વર્ષ :
  - (૭) હાલના સંચાલક મંડળમાંની વ્યક્તિઓ, આ શાળાઓના સંચાલક મંડળ સાથે જોડાયેલી હોય તો :
  - (૮) જે નેમ હોય તો, વિગતો આપો :
  - (૯) અગાઉના વર્ષના માર્ચ મહિનાની ૩૧મી તારીખે વર્ગવાર સાચી સંખ્યા:
- c. સૂચિત શાળા માટે સૂચિત જગાની જોગવાઈ :
- (ક) તે શાળાની માલિકીની છે કે કેમ ?
  - (લ) તે સંચાલક મંડળની માલિકીની છે અને શાળાને ભાડે આપી છે કે કેમ ?
  - (ગ) વ્યક્તિ અથવા મંડળની માલિકીની છે અને શાળા માટે ભાડે લીધી છે કે કેમ ?

- (૫) શાખા અથવા સંગ્રહક મંડળની માલિકીની હોય તો, મહાન અને તેને (જોડેલા હોય તો) રમતના મેદાનની કુલ કિંમત કેટલી છે ?
- (૬) આ અરજુનની સારે, શાખાના મહાન અને રમતના મેદાનનો માપ પ્રમાણે દોરેલા હોય નકશો જોડવો અને નીચે જગ્ઘાવેલી વિગતો પણ આપવી.
- (૭) વર્ગ ખંડનું સરેરાશ માપ કેટલું છે ? (ઓરસ દૂઠમાં)
- (૮) ત્યાં સ્વતંત્ર પ્રયોગશાળા ખંડ છે કે કેમ (ચોકકસ માપ આપો) પ્રયોગશાળા સાધનસર્જન કરવા પાછળ કેટલી રૂમ ખર્ચવા પાઈ છે તે, જણાવો.
- (૯) સ્વતંત્ર ગ્રેઇંગ રૂમ છે કે કેમ ? (માપ આપો)
- (૧૦) સ્વતંત્ર વાસન ખંડ અને ગ્રંથાલય ખંડ છે કે કેમ ? ગ્રંથાલય અને વાંચન ખંડ પાછળ કેટલી રૂમ ખર્ચવા પાઈ છે તે જણાવો.
- (૧૧) વિદ્યાર્થીનીઓ માટે બાધ્યકુમાર સાથેનો કોમન મર્ક્ઝ સીટ્યપર્સિંગ રૂમ છે ?
- (૧૨) શાખાની સારે રમતાંનું મેદાન છે કે કેમ ? મુખ્ય શાખાના મહાનથી તેનો વિસ્તાર અને અંતર આપો.
- (૧૩) તમાર ખંડે પૂરતા કવાઉઝસવાળા છે ?
- (૧૪) અન્ય ફીલાંડિક મદદ પાછળ વર્ગવા ઘારેલી રકમો જણાવો.

#### ૧૦. આરોગ્યવર્ક વષસા :

- (૧) (૧) વિદ્યાર્થીઓ,
- (૨) વિદ્યાર્થીનીઓ,
- (૩) કર્મચારી વર્ગ,

માટે કુતર્દીઓ અને સંપ્રેસોની પૂર્યત્વ સભવ છે કેમ.

મહાર પ્રમાણે સંખ્યા આપવી.

- (૨) પીલાના સોખવા પાછીની તેમજ બીજી જરૂરિયાત જાટેના પાછીની જોનવાર્ફ છે ?

૧૧. વર્ગવાર ટ્યુશન અને ટર્ફ કી કંપા દરે લેવા પાઈ છે ?

૧૨. શાખા માટેનાં નાસાકીય સાધનો.

- (૧) હાલમાં શાખાને કસ્ટક પૂરેપૂરી ઉપલબ્ધ હોય તેવી ખરેખર રોકડ રૂમ જણાવો. જેમાં સંગ્રહક મંડળના સૂલ્યો અથવા ટ્રસ્ટીઓએ લીધેલી લોનનો સમાવેશ થયો જોઈશે નહિ. તે અનામત મૂકવાયાં આવી છે કે કેમ તે જગ્ઘાવો અને તેનો સંતોષકારક પુરાવો આપો.

- (બ) જે સ્થાવર અને ઝુગમ  
અસ્ક્રીપ્શિયલ આવક આ  
શાખા માટે જ સંપૂર્ણપણે  
અંકિત થયેલી હોય તેની  
વિગતો આપો.
- (ગ) શાળા માટે આવર્તક અથવા  
અનાવર્તક આવકનાં અન્ય  
કોઈ પણ સાપન છે? વિગતો  
આપો.
૧૩. તે જ સંચાલક મંડળ, આ રાજ્યમાં  
અન્ય કોઈ રીલાલીક સંસ્થાનું સંચાલન  
કરે છે? જો તેમ હોય તો, તેનાં  
નામ, સ્થળ અને અન્ય વિગતો  
આપો.
૧૪. આ સંચાલક મંડળનો કોઈ પણ  
સભ્ય અથવા સભ્યો આ અથવા  
અન્ય કોઈ પણ શાખામાં મુખ્ય  
શિક્ષક, મુખ્ય શિક્ષક અથવા શિક્ષક  
અથવા કારકુન તરીકે કામ કરતા  
હોય તો જણાવો. તેમ હોય તો,  
ચોક્કસ વિગતો આપો.
૧૫. શાળા સરકારી ગ્રાંટ પેણવવા આગે  
છે કે કેમ તે જણાવો.

- (૧) આપેલી તમામ વિગતો તદ્દન  
ખરી અને સાચી છે અને  
ઉપરનો નમૂનો ભરતીવાચા  
કોઈ પ્રસ્તુત બાબત  
હિરાદાપૂર્વક અટકાવવામાં  
આવી નથી એમ પ્રમાણિત  
કરો.
- (૨) સંચાલક મંડળ બોર્ડ કરાવેલા  
અથવા હવે પછી ઠચાવાય  
તેવા નિયમો અને  
વિનિયમોનું પાલન કરવા  
બધાય છે.

આપનો વિધાનુ,

- (૧) પ્રમુખ અને સેકેટરીનું નામ  
અને સહી.
- (૨) ટ્રસ્ટના ટ્રસ્ટીઓનાં નામ અને સહી.

નમૂળો ૨

## આધ્યાત્મિક શાળાનાં રજિસ્ટર

[જુઓ વિનિયમ ૮ (૮) સાથે વાંચતાં કલમ ૩૧ (૩)]

અનુક્રમ નંબર	શાળાનું નામ તથા તેનું સરનામું	સંચાલક મંડળનું નામ	પત્રવ્યવહાર કરનાર અથવા સંચાલક મંડળના સેકેટરીનું નામ
૧	૨	૩	૪

મુખ્ય શિક્ષક/મુખ્ય શિક્ષકાનું નામ	મુખ્ય સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ અથવા મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૬૦ ડેફા સંચાલક મંડળ રજિસ્ટર થયેલું છે કે કેમ.	શાળા બિધાત્વાની તારીખ	શિક્ષણા વિષયો
૫	૬	૭	૮

શિક્ષણાનું માધ્યમ અથવા માધ્યમો.	ધોરણો અને વિભાગો	તાલીમ પામેલા શિક્ષકો	શાળામાં ઉપલબ્ધ સગવડ લાયકાત સાથે સંખ્યા
૯	૧૦	૧૧	૧૨

આરોગ્ય અને મનોરંજન માટેની જોગવાઈ અને શાળામાં શિસ્ત.	રજિસ્ટ્રેશનની તારીખ	સેકેટરીની સહી	વિશેષ નંંધે
૧૩	૧૪	૧૫	૧૬

## નમૂળો - ૩

[જુઓ વિનિયમ ૮ (૧૧) સાથે વાંગતાં કલમ ૩૧ (૮)]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર

પ્રમાણિત કરવામાં આવે છે કે નીચેના વિષયોમાં તેમની સામે દર્શાવેલાં ધોરણો માટેના શિક્ષણના માધ્યમ માર્કશિર માધ્યમિક શિક્ષણ આપવા માટે .....ને (શાળા અને સ્થળનું નામ) ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ અને તે હેઠળ કરેલા વિનિયમોની જોગવાઈઓ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, માધ્યમિક શાળાના રજિસ્ટરમાં .....અનુક્રમ નંબર ઉપર નોંધેલી છે.

અનુક્રમ નંબર	વિષયોનું નામ	શિક્ષણનું માધ્યમ	ધોરણો અને વિભાગ
૧	૨	૩	૪
(૧)			
(૨)			
(૩)			
(૪)			
(૫)			
(૬)			
(૭)			
(૮)			
(૯)			
(૧૦)			

સેકેટરી

ગુજરાત માધ્યમિક  
શિક્ષણ બોર્ડ

સ્થળ :

તારીખ :

## નમૂલે ૪

[જુન્નો વિનિયમ ૧૬(૪)]

જીડેર આરોગ્ય તાલીફી તપાસનો નમૂલો

વિદ્યાર્થીનું નામ .....	..... પરસેલો / કુવારા
સરનામું .....	..... પુણ્ય/સૌન્ય-જન્મ તારીખ .....
તપાસનું વર્ષ	૧૯ ૧૯ ૧૯ ૧૯

ઘોરક અને વિલાગ

વર્ષ અને મહિના સાથે ઉમર

૧. રોજ, એપોપેશન અથવા અક્ષરાલાનો ઈતિહાસ

૨. પી. વી. + આર. વી. + બી.ચી.જ. અધિક

૩. ખોરાક :

છોટેલ-નોન. એન્ડાલ્યુ એમ.વી.

૪. શારીરિક તાલીફ + શાળા + પર

૫. ઊંચાઈ ખાસોઝવાસ

વજન પેટે

૬. કદ્ય નારી

કિલો અને એનીથીયા

૭. ખાસોઝવાસ

૮. પાચન લૂધ, અંતરડા,

૯. કાનતંતુ તંત્ર,

૧૦. ઉત્સર્જ તંત્ર,

૧૧. જી. બી. કાર્ટાઇલ્ડ

અનેકસ્ક ટેસ્ટીંગ કાર્ટાઇલ્ડ

૧૨. જી. એ. જી. વિ. આર્ટિ.વી.

ડી.ડી.

૧૩. અંધની દાઢ રોજ વગેરે

૧૪. કાન, નાક

૧૫. ગળું, કાકડા

૧૬. દાત સારે

તપાસનું વર્ગ	૧૬	૧૬	૧૬	૧૬
૧૬. રસગ્રંથિ				
૧૭. ચામડીનાં દરેદ				
૧૮. હાડકાં સાંખ્યા				
૧૯. તંદુરસ્તી વર્ગ ક + ખ + ગ				
૨૦. કોઈ વિશિષ્ટતા				
૨૧. ખાસ તપાસ, જ્યારે કરવામાં આવી હોય ત્યારે અને જો કરવામાં આવી હોય તો.				
૨૨. શિક્ષકની નોંધ				
૨૩. વાલીની હાજરી				
૨૪. દાઢતરી નોંધ				
૨૫. પાછળની કામગીરીનાં સૂચન				
૨૬. તબીબી તપાસ કરનારની સહી અને તપાસમાની લાયીએ				

- |    |           |
|----|-----------|
| १  | प्राप्ति  |
| २  | शुद्धि    |
| ३  | संवर्द्धन |
| ४  | विवरण     |
| ५  | विवरण     |
| ६  | विवरण     |
| ७  | विवरण     |
| ८  | विवरण     |
| ९  | विवरण     |
| १० | विवरण     |
| ११ | विवरण     |
| १२ | विवरण     |
| १३ | विवरण     |
| १४ | विवरण     |
| १५ | विवरण     |
| १६ | विवरण     |
| १७ | विवरण     |
| १८ | विवरण     |
| १९ | विवरण     |
| २० | विवरण     |

४५

१०८

સુધીના

3. 帕爾默

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਜੀਵਨ ਰੋਚਕ ਮੁਖ

ପ୍ରକାଶ + ଟୋଚାର୍ ପ୍ରକାଶନ.

۱۰

ନାମ

२. अन्तः. संस.

三、政治小説

ੴ ਪਿੰਡ ਸਾਹਿਬ ਪ੍ਰਸ਼ਾਸਨ ਕੇਂਦਰ ਸਾਹਮਣੇ

નાટક + સોન્દર પ્રથમાં

३६४

१८५

२. वेद. रस.

### 3. નિષ્પત્તા

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ

ମରୀଚ + ଶୋଭାର ପ୍ରକଳ୍ପରେ

અનુભૂતિ :

१. અનુભૂતિ + રોકરાસ + પ્રાણી
૨. અનુભૂતિ રોકરાસ પ્રાણી
૩. અનુભૂતિ પ્રાણી
૪. અનુભૂતિ રોકરાસ
૫. અનુભૂતિ રોકરાસ + પ્રાણી

અનુભૂતિ :

૧. અનુભૂતિ
૨. અનુભૂતિ
૩. અનુભૂતિ
૪. અનુભૂતિ
૫. અનુભૂતિ

## નમૂળો ૫

(જુઓ વિનિયમ (૨૩))

## સર્વિસ બુક

૧. પૂરેપૂરું નામ
૨. કાયમી સરનામું
૩. હાલનું સરનામું
૪. જનમતારીખ (શબ્દો અને આંકડા બનેમાં)
૫. જે પુરાવા ઉપરથી સર્વિસ બુકમાં જનમતારીખની નોંધ કરવામાં આવી હોય તેની વિગત (દા.ત.) પી.એસ.રી./ એસ.એસ.રી. મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, વગેરે.
૬. (ક) માતૃભાષા  
(ખ) જે ભાષાના માધ્યમ દ્વારા શિક્ષક શિખવવાની લાયકતા ખરાવત્તા હોય તે ભાષા  
(ગ) બીજા જે કોઈ માધ્યમ દ્વારા શિક્ષક શીખવી શકે તે.
૭. અંગત ઓળખચિહ્નનો.
૮. શૈક્ષણિક લાયકાતો, પૂરેપૂરી.

અનુક્રમ નંબર	પરીક્ષા વિષયો	લીધેલા વિષયો	યુનિવર્સિટી શિક્ષકને શિખવવાની	પસાર કર્તાનું વર્ષ	મેળવેલ વર્ગ	શ્રેષ્ઠતા, (ડિસ્ટિન્ક્શન)
૧	૨	૩	૪	૫	૬	૭

## ૮. વ્યાવસાયિક (પૂરેપૂરી શૈક્ષણિક લાયકાતો)

અનુ. ક્રમાંક	પરીક્ષા તાલીમ આપી હોય તે વિષયો	જે વિષયોમાં શિક્ષકને શિખવવાની	યુનિવર્સિટી તાલીમ આપી હોય	પસાર કર્તાનું વર્ષ	મેળવેલ વર્ગ	શ્રેષ્ઠતા વગેરે
૧	૨	૩	૪	૫	૬	૭

૧૦. ખાસ વાયકાતો, કોઈ છેય તો,

અનુ. ક્રમાંક	પરીક્ષા વર્ષ	યુનિવર્સિટી વર્ષ	પસાર કર્યાનું મેળવેલો વર્ગ	શ્રેષ્ઠતા ડિસ્ટિક્શન વર્ગેરે
૧	૨	૩	૪	૫

૧૧. શિક્ષકની સહી

૧૨. મુખ્ય શિક્ષક/મુખ્ય શિક્ષિકાની સહી

નોકરીનો સંક્ષિપ્ત અહેવાલ

નોકરી				
શાળા	હોદ્ડો	ધી	સુધી	વર્ષ
૧	૨	૩	૪	૫

કુલ					પગાર
મહિના	દિવસો	પગાર ધોરણ	શરૂઆતનો	છેવટનો	પગાર
૬	૭	૮	૯	૧૦	૧૧

શાળાનું નામ નિમણૂકની તારીખ હોદ્ડો શિખવાતા વિષયો કાયમી અથવા અજમાયશી અથવા હંગામી અશાંકાલીન કે પૂર્જકાલીન અથવા કાયમી છે કે કેમ

૧	૨	૩	૪	૫
૧લી જૂને છેય તે પ્રમાણે પગાર	ઈજફાની તારીખ અને રકમ	મૌખિક વિષયો	ભાષાં	ભાષાં
૬	૭	૮	૯	૧૦

બીજી કોઈ પક્ષ (પક્ષાર જગ્ઘાવો)	પ્રકારો અને પગાર સાથે કે તે વગર	૨૫			
		થી	સુધી	મહિના	દિવસો
૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬

નિયમાત્મક સમાપ્ત કર્યાની તારીખ	વિરોધ નોંધ, કોઈ હોય તો (નોકરી સમાપ્ત કરવા માટેનાં કારણો)	તારીખ અને સહી શાળાના ઉપરીની રિઝાકની		
૧૭	૧૮	૧૯	૨૦	

### નમૂનો ૬.

[જુઓ વિનિયમ ૩૧ (૪)]

રજીના ડિસાબનો નમૂનો

કર્મચારીનું નામ :

જનમતારીખ :

સંબંધ નોકરીની શરૂઆતની તારીખ :

કરણિકાત નિવૃત્તિની તારીખ.

નોંધ : ૧.-વગર પગારની રજી લીધી હોય તો તેની મુદતની, વિરોધ નોંધ માટેની કોલમ ૨૪મા લાલ શાહીથી નોંધ કરવી જોઈએ.

નોંધ : ૨.-કોલમો (૧૦) અને (૧૧)માંની નોંધોમાં આર્થિક પગારની રજી થાય તે વખતે, માત્ર, નોકરીના પૂરેપૂરા વર્ષની શરૂઆત તથા અંત દર્શાવવાં જોઈશે. કોઈ કર્મચારી અર્થાત્ પગારની રજી પર હોય ત્યારે નોકરીનું બીજું વર્ષ પૂરું કરે તે દર્શાવામાં, નોંધોમાં, યોગ્ય વધારાની નોંધો કરીને વધારાની જમા (રજી) કોલમો (૧૦) અને (૧૪)માં બતાવવી જોઈએ અને આ કોલમ (૨૩) પૂરેપૂરું ભરતી વખતે ગણતરીમાં લેવી જોઈએ.

નોંધ : ૩.-જ્યારે જ્યારે પ્રાપ્ત રજીના દરમાં ફેરફાર થાય ત્યારે અગાઉના દરે એકઠી થયેલી પ્રાપ્ત રજીના અપૂર્ણાંકને સૌથી નિયમના દિવસ સુધી પૂર્ણાંકના ફેરવવો જોઈશે, એટલે કે અર્થાત્ કરતાં ઓછા અપૂર્ણાંકને ધ્યાનમાં લેવો નહિ અને અર્થાત્ અથવા તે કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને એક દિવસ તરીકે ગણવો જોઈએ.

## પ્રાપ્ત રજી

## પ્રાપ્ત રજી

થી સુધી ફરજ પ્રાપ્ત કરેલી રજી યોગ્ય મર્યાદાને આપીન રહીને,	થી સુધીમાં રજી ઉપરથી
ઉપર (દિવસોમાં) (દિવસોમાં) જમા રજી (દિવસોમાં)	લીધેલી રજી પાછા ફરે
(કોલમ ૮-૪)	દિવસોની ત્યાર સિલક
	રજી સંખ્યા (કોલમ ૫-૮)

૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪
---	---	---	---	---	---	---	---	---	----	----	----	----	----

## અર્થ પગારની રજી

અંગત કામકાજ અંગે અને/અથવા તબીબી

## નોકરીની મુદત

પ્રમાણપત્રના આપારે

## જમા રજી

થી	સુધી	પૂર્ય વર્ષની સંખ્યા	પ્રાપ્ત કરેલી રજી (દિવસોમાં)	જમા રજી (કોલમ ૮ વત્તા ૧૩)
૧૦	૧૧	૧૨	૧૩	૧૪

## લીધેલી રજી

## અર્થ પગારની રજી સામે ઉધારી

તબીબી પ્રમાણપત્ર ઉપરથી પૂર્ય પગારે રૂપાંતરિત  
રજી સમગ્ર નોકરી દરમિયાન ૨૪૦ દિવસ પૂરતી

## મર્યાદિત

થી	સુધી	દિવસોની સંખ્યા	થી	સુધી	દિવસોની સંખ્યા
૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦

અર્ધ પગારની રજીમાં	લીધેલી કુલ અર્ધ	રજી ઉપરથી પાછા ફરે	વિશેષ નોંધ
ફરેવેલી રૂપાંતરિત રજી	પગારની રજી	ત્યારે સિલક	
(કોલમ ૨૦ થી બમસી) (કોલમ ૧૭ વત્તાં ૨૧)	(કોલમ ૧૪-૨૨)		

૨૧

૨૨

૨૩

૨૪

## નમૂનો ૭

[જુઓ વિનિયમ ૩૫]

## ધૂટા શાળાના પ્રમાણપત્રનો નમૂનો

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી/શ્રીમતી/કુમારી .....  
 જે ..... શાળામાં શિક્ષક હતા અને .....  
 વર્ગમાં ..... વિષયો શિખવતા હતા તેમની નોકરી .....  
 તારીખ અને તે તારીખથી સમાપ્ત કરવામાં આવેલી છે.

૧. પ્રમાણપત્ર કાઢી આપનાર શાળાનું નામ તથા સરનામું :
  ૨. શાળાનું પૂર્ણ નામ :
  ૩. લાયકાતો :
    - દિશ્રી/દિશ્રીમા
    - વર્ગ
    - વર્ષ
    - પુનિવર્સિટી  ૪. હંગામી/કાયમી છે કે કેમ.
  ૫. બજીવેલી સેવા (... થી ... સુધીની મુદ્દત સહિત)
  ૬. લીધેલો પત્રાર ...
    - (ક) રૂ. ... પગાર ધેરજીમાં
    - (ખ) ભાયાં, કોઈ છોય તો.
    - (ગ) આગામી ઈજાફાની તારીખ.  ૭. વેમાંથી કોઈ એક પક્ષ તરફથી પોત્ય નોટિસ આપવામાં આવી હતી કે નાણે\*
  ૮. (ક) સરકારી પ્રોવિડન્ટ ફડમાં પેસા ભરવામાં આવે છે કે કેમ.
    - (ખ) પોસ્ટલ સેવિઝન બેન્ક એકાઉન્ટ નંબર.  ૯. તેણે શાળાનાં બધાં નાશાં અને પુસ્તકો, વગેરે પરત કર્યા છે કે કેમ.
૧૦. વિશેષ નોંધ :
- સ્થળ :
- તારીખ :

શાળાના ઉપરીની સહી

\* રૂપસદ કે બરતરફીના દાખલવામાં, તેની સામે મુકેલા આરોપો માટે રીતસરની તપાસ કરવામાં આવી હતી કે કેમ તે જઘાવવનું જોઈશે.

## નમૂળો ૮

[જુઓ વિનિયમ ઉચ (૧) (૫) (૫)]

રજિસ્ટર થયેલી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ખાનગી અહેવાલનો નમૂળો

મુદ્દત..... થી..... સુધી.....

શિક્ષકનું પૂરું નામ :

લાયકાતો :

દોષો :

અવધિ (કાયમી કે હંગામી) :

૧લી એપ્રિલના રોજ સંસ્થામાં નોકરીની મુદ્દત :

પગાર ધોરણ

૧લી એપ્રિલના રોજ પગાર

આગામી ઈજાફો ..... તારીખે

ખાસ પગાર અથવા ભાષા.

શિખવેલા વિષયો.

શિક્ષક વિષે મધ્યે અભિપ્રાય નીચે મુજબ છે.

..... થી..... સુધીની મુદ્દત માટે.

## ૧. વર્ગક્રમ

(ક) જ્ઞાન અને વિષયની તૈયારી.

(બ) (૧) શિક્ષકનું માધ્યમ

(૨) હિન્ડી

(૩) અંગ્રેજનું જ્ઞાન

(ગ) સમીક્ષા કરવાની :

દ્રષ્ટાંત આપવાની ગ્રંથો પૂર્ણવા, વગેરેની શક્તિ.

(ઘ) વિદ્યાર્થીઓમાં અભિરુચિ પેદાં કરવાના આવકત અને તમના.

(ય) વર્ગ ઉપર કષ્ટું રાજવા અને શિક્ષણ.

(યુ) વિદ્યાર્થીઓ, વાલી અને સહ-કર્મચારીઓ પર પ્રભાવ.

(જ) વર્ગક્રમ ઉપર સામાન્ય શેરો.

## ૨. વર્ગોત્તર પ્રવૃત્તિઓ

(ક) રમતગમત, શિક્ષણ, છાઉટ વગેરેમાં લીધેલો રસ.

(બ) પ્રયારીષિકતા અને વફાદારી.

(ગ) સહ-કર્મચારીઓ સાથે સહકારનું વલખણ

(ઘ) શાખાના ઉપરોચે આપેલાં સૂચનોનો અમલ કરવામાં વફાદારી.

(ય) સામાન્ય અભિપ્રાય

## ૩. ખાસ અભિપ્રાય કોઈ હોય તો

હું તેને માટે સામાન્ય અભિપ્રાય આપું છું.

(શ્રેષ્ઠ, ધંઢો સારો, સારો, ટીકટીક, સારો, ટીક નબળો.)

સ્થળ :

તારીખ :

મુખ્ય શિક્ષકની સહી.

નમૂનો ૬

શાળા છોડયાનું પ્રમાણપત્ર

[જુઓ વિનિયમ-૧૩]

આ પ્રમાણપત્રમાંની કોઈ નોંધમાં તે કાઢી આપનાર સત્તાપિકારી સિવાય બીજા કોઈથી કશો ફેરફાર થઈ શકો નહિ અને આ શરતનો લંગ કરનાર શાળામાંથી કાઢી મુકવાની શિક્ષાને પાત્ર બનશે.  
(આ પ્રમાણપત્ર શાહીથી ભરવું.)

શાળાનું નામ :

- (ક) વિદ્યાર્થીનો જનરલ રિજિસ્ટર નંબર.
- (ખ) પ્રમાણપત્ર
- (૧) વિદ્યાર્થીનું પૂરેપૂરું નામ  
(અટક અથવા લખવી.)
- (૨) પર્મ અને જાતિ
  ૧. અનુસૂચિત જાતિ
  ૨. અનુસૂચિત જનજાતિ
  ૩. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો  
(બસી પંચે ભવામશ કરેલ શાંતિઓ-વર્ગો-જૂથો)
- (૩) જનરસ્થળ (તાલુકા નિલ્લા સહિત)
- (૪) બ્રિસ્ટી વર્ષ અનુસાર જન્મની તારીખ, મહિનો  
(શબ્દો અને આંકડા બન્નેમાં)
- (૫) જ્યાં ભણ્યો હોય તે છેલ્લી શાળા
- (૬) પ્રવેશ તારીખ (ધોરણ સહિત)
- (૭) શાળા છોડયાની તારીખ
- (૮) કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને કયારથી
- (૯) શાળા છોડયાનું કારણ
- (૧૦) પ્રગતિ
- (૧૧) વર્તુલ્યક
- (૧૨) વિશેષ નોંધ

ઉપરની માહિતી શાળાના રિજિસ્ટર અનુસાર હોવાનું પ્રમાણિત કરવામાં આવે છે.

તારીખ : કાર્કન શાળાના ઉપરી

સ્થળ :

નોંધ : વિદ્યાર્થી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બસી પંચે ભવામશ કરેલી શાંતિઓ-વર્ગો-જૂથો)ના હોય તો તે કોલમ-૨ માં દર્શાવવું.